




आनंद घेऊ सारे  
या तेजीमय दिव्यांचा  
दिवाळसणासारी  
फुराळ ख्रास साहित्याचा...



સંપાદકાચ્ચા લેખણીતૂન... 

નમસ્કાર,

કલાવિષ્કાર યા ઈ દિવાળી અંકાચી સલગ ૪ થી આવૃત્તિ આપલ્યાસાઠી પ્રસિદ્ધ કરતાના ખુપ આનંદ હોત આહે. ચાર વર્ષાપુર્વી સ્થાપના જ્ઞાલેલ્યા યા ઈ દિવાળી અંકાચ્ચા માધ્યમાતૂન અનેક સાહિત્યિક, કવી, લેખક, ચિત્રકાર, છાયાચિત્રકાર, પાકકૌશલ મંડળી કેવળ ભારતાતંત્ર નથે તર સાતાસમુદ્રાપકીકડે વાચકાંપર્યત પોહોચલી. કલાવિષ્કાર ઈ દિવાળી અંકાચે ખરે શિલેદાર તર હીચ મંડળી આહेत. યા શિવાય કલાવિષ્કારસાઠી સાહિત્ય દેણ્યાચે આવાહન પોહોચવણ્યાપાસુન તે સાહિત્ય આલ્યાવર ત્યાચે યોગ્ય તે પૃથ્વીકરણ કરણ્યાપર્યતચે સહકાર્ય જ્યાંની કેલે ત્યાંચે કાર્ય શબ્દાંત માંડળે કઠીણ આહે. પ્રત્યક્ષ કિંવા અપ્રત્યક્ષરિત્યા જ્યાંની કલાવિષ્કાર ઈ દિવાળી અંકાસાઠી સાહિત્ય ગોળા કરણ્યાચે કામ કેલે તસેચ, કલાવિષ્કાર સર્વાપર્યત પોહોચવલા ત્યાંચેહી મી મન:પુર્વક આભાર માનતો. ધ્કાધકીચ્ચા આયુષ્યાત છાપીલ દિવાળી અંક વાચાયલા વેલ મિળેલંચ કી નાહી હે સાંગતા યેત નાહી. આવડ અસેલ તર સવડ મિળતેચ. દિવસાતીલ કમીત કમી ૮ તે ૧૦ તાસ સંગણકીય કામ કરણારી યંત્રમાણસાંના હે છાપિલ દિવાળી અંક વાચણ્યાસ સવડ મિળેલ કી નાહી યાચે તર્કવિતક્રંચ બાંધાવે લાગતાત. કલાવિષ્કાર હા ઈ દિવાળી અંક pdf (Portable Document Format) તયાર કરણ્યાચે ઉદ્દીષ્ટ હે યા ઈ દિવાળી અંકાચે સહજ હસ્તાત્મણ કરતા યાવે આણિ જિથે ઇંટરનેટચી વ્યાસી કિંવા કવરેજ નાહી અશા ઠિકાણચ્ચા વાચકાંસાઠી સાહિત્ય ફરાલ પોહોચવણે હે આહે. સ્માર્ટફોનચ્ચા સ્માર્ટયુગાત ઈ બુક હે એક ઉત્તમ વ્યાસપીઠ આહે અસ મલા વાટતં ! છાપિલ દિવાળી અંકાંશી સ્પર્ધા કરણ્યાચે કિંવા છાપીલ પુસ્તક વાચનાચ્ચા આવડીપાસુન વાચકાંના પરાવૃત્ત કરુન ફક્ત ઈંટરનેટ જગતાતીલ સાહિત્યાકડે વળવણ્યાચે કોણતેહી ઉદ્દીષ્ટ કલાવિષ્કાર યા ઈ દિવાળી અંકાચે નાહી યાચી કૃપયા નોંદ ઘ્યાવી.

પહીલ્યા વર્ષાચ્ચા યશસ્વી વાટચાલીનંતર સલગ દુસ્ન્યા વર્ષી મ્હણજે ૨૦૧૧ સાલીહી કલાવિષ્કારસાઠી બરેચ સાહિત્ય, પાકકૃત્યા, ચિત્રકં, છાયાચિત્રે, કલાકુસર, ઇત્યાદિંચા હૌશી સાહિત્યિકાંકાડૂન આણિ કલાકારાંકાડૂન હાતભાર મિળાલા. તમામ સાહિત્યિકાંના આણિ કલાકારાંની સજવલેલ્યા કલાવિષ્કાર, ઈ દિવાળી અંક, ઑફ્ટોબર - ૨૦૧૧ લા જયસિંગપૂર યેથીલ અલિશા અંડબ્રાર્ટયિઝિંગ એજન્સીજચ્ચા વર્તીને આયોજિત વિશેષ આંતરરાષ્ટ્રીય વિનાશુલ્ક ખુલી મરાઠી દિવાળી અંક સ્પર્ધેત ૨ રે પારિતોષિક મિળાલે. રૌપ્ય પદક આણિ પ્રમાણપત્ર અસે યા પરિતોષિકાચે સ્વરૂપ હોતે. ખાલીલ લિંક ક્લિક કરા!

<http://goo.gl/phkW2>

માગિલ તીન કલાવિષ્કાર ઈ દિવાળી અંક આપણાસ ખાલીલ લિંકવરુન મોફત ડાઉનલોડ કરતા યેતીલ.

- [કલાવિષ્કાર, ઈ દિવાળી અંક, નોવેમ્બર - ૨૦૧૦](#)
- [કલાવિષ્કાર ઈ દિવાળી અંક, ઑફ્ટોબર - ૨૦૧૧](#)
- [કલાવિષ્કાર, ઈ દિવાળી અંક, નોવેમ્બર - ૨૦૧૨](#)

સાહિત્યાને બહરલેલા કલાવિષ્કાર, ઈ દિવાળી અંક, નોવેમ્બર - ૨૦૧૩ આપલ્યા પસંતીસ નક્કીચ ઉતરેલ યાત શંકા નાહી. અનુક્રમણિકેવરીલ લેખાચ્ચા/ સાહિત્યાચ્ચા નાવાવર ક્લિક કરુન આપણ થેટ ત્યા સાહિત્ય પર્યત પોહોચૂ શકતા. પુન્હા અનુક્રમણિકેવર પરતણ્યાસાઠી પ્રત્યેક પાનાચ્ચા શેવટી અનુક્રમણિકા અસે લિહિલેલે આહે તેથે ક્લિક કરા. સંબંધિત સાહિત્યિકાચ્ચા /કલાકારાચ્ચા નાવાવર ક્લિક કરુન આપણ થેટ ત્યા સાહિત્યિકાશી / કલાકારાશી ઈમેલ કિંવા ફેસબુકદ્વારે કિંવા ઉપલબ્ધ દુરધ્વની ક્રમાંકદ્વારે (જ્યાંચે ઈમેલ આયડી નાહી અશાંચ્ચા) સંપર્ક સાધૂ શકતા, . જ્યા સાહિત્યિકાંચા ઈ મેલ પત્તા ઉપલબ્ધ નાહી અશા સાહિત્યિકાંચા થોડક્યાત પત્તા આણિ સંપર્કસાઠી દુરધ્વની ક્રમાંક દિલે આહેત. કલાવિષ્કાર, ઈ દિવાળી અંક વાચત અસતાના વિશેષ કાલજી ઘેઊન દેખીલ કાહી શાબ્દિક કિંવા ટંકલેખનાચ્ચા ચુકા સાપદણ્યાચી શક્યતા આહે, પરંતુ લિખાણાતીલ ત્યા કાહી ત્રુટી માનુન આપલે યોગ્ય તે સહકાર્ય અપેક્ષિત આહે .કલાવિષ્કાર, ઈ દિવાળી અંકાબદ્દ આપલ્યા પ્રતિક્રિયા, મતં આણિ સુચના આપણ [kalaavishkaar@gmail.com](mailto:kalaavishkaar@gmail.com) યા ઈ મેલ પત્યાવર પાઠવુ શકતા. આપણ આપલ્યા ઈતર સહકાર્યાપર્યત દેખીલ કલાવિષ્કાર ઈ દિવાળી અંક પોહોચવા.

- કલાવિષ્કાર, ઈ દિવાળી અંક, નોવેમ્બર-૨૦૧૩  
વિશેષ આભાર
- નિર્મિતી સહાય્ય - વિનય ગડો, કિશોર કદમ, અંજલી અભિનવ આણિ વિદ્યા પાલકર.

કલાવિષ્કાર ઈ દિવાળી અંકાચે ફેસબુકવરીલ પાન લાઈક કરણાસાઠી યેથે કિલ્ક કરા.

આપલ્યાલા હી દિવાળી ભરભરાટીચી, આનંદદાયી, આરોગ્યદયી જાવો યાચ સદિચ્છા ! શક્યતો મોઠ્યા આવાજાચે આણિ ધૂર કરણારે ફટાકે વાજવું નકા, લહાન મુલાંચી તસેચ અબાલ વૃદ્ધાંચી વિશેષ કાળજી ઘ્યા. દિવાળીચા આનંદ પ્રત્યેકાલા અનુભવું દ્યા જગા આણિ જગૂ દ્યા.

આપલા કૃપાભિલાષી,

સંપાદક આણિ પ્રકાશક

કલાવિષ્કાર ઈ દિવાળી અંક

- © યા ઈ દિવાળી અંકાતીલ સર્વ સાહિત્ય આણિ કલાકુસરીંચે અધિકાર સંબંધિત સાહિત્યિક આણિ કલાકારાંકડે રાખિવ આહેત.  
યા ઈ દિવાળી અંકાત માંડલેલ્યા મતાંશી કિંવા વિચારાંશી સંપાદક આણિ પ્રકાશક સહમત અસતીલંચ અસે નાહી.
- © મુખપૃષ્ઠ, મલપૃષ્ઠ આણિ કલાવિષ્કાર લોગોચે ચે સંપૂર્ણ અધિકાર સંપાદક આણિ પ્રકાશકાંચ્યા સ્વાધીન.

## ૩૦ અનુક્રમણિકા

- ગવ્ય વિભાગ (કથા, લઘુકથા, પ્રવાસવર્ણન, મહિતીપર લેખ, પત્ર, ચરિત્રાત્મક લેખ, ઇત્યાદિ)
- જીવાચી મુંબઈ :નાણ્યાચી દસરી બાજુ સાઇનાથ આવલે
  - વાસના (લઘુકથા) પંડિત પાટ્ટર
  - પ્લેચેટચી ગંમત (લઘુકથા) વિજય તિરબડે
  - ભાવશ્યાચે આજીલા પત્ર ચંદ્રકાંત ભોસલે
  - હાચ ખરા ગુરુ સિદ્ધેશ ભરત શિરવાડકર
  - હરવલેલાં વાલપણ - A Sigh Of A Prodigy મયુરી
  - પ્રજેચે માનસશાસ્ત્ર વિનાયક પ્રભાકર ફડકે
  - શ્રી શાંતાદુર્ગા - મંગેશી સંકેત ભંડારી
  - ભાવ આણિ હાવભાવ નામ ગુમ જાયેગા (નામકાકા)
  - માંજર આડવી ગેલ્યાને ખરંચ અપશક્ન હોતો કા ? રાજેશ હજારે
  - સિવલલંડચી સફર મોહના કારખાનિસ
  - ૧૫ ઓંગસ્ટ વ ૨૬ જાનેવારી 'નાવાચે' રાષ્ટ્રીય સણ રાજેશ હજારે
  - તુ, મી આણિ પાઊસ રાહૂલ આરાધ્યે
  - સંવેદનવિન કાહી નાહી અરુણ દેશપાંડે
  - "હિ"ચી ગોષ્ઠ વિશાખા સમીર મશાનકર
  - સ્મરણયાત્રા અરુણ વિ. દેશપાંડે
  - માનસિક અર્થકારણ પ્રથમેશ સુરેશ શિરસાટ
  - અવિસ્મરણીય ચાર ધામ પ્રવાસ સ્વામિનિ લોખંડે - કોળેકર

- પવ્ય વિભાગ (કવિતા, ચારોક્યા, ગજલ, વિડંબન કાવ્ય, વાત્રટિકા, ઇત્યાદિ)

- આઈ સ્વાતી ઠુબે-ખોડદે
- દિપોત્સવ મિલિંદ કલ્યાણકર
- મૈત્રીચે ધાગે સ્વામિની લોખંડે - કોળેકર
- એક કિનારા ગાઠત આહે સ્વામિની લોખંડે - કોળેકર
- એકટા મી મિલિંદ કદમ
- એક ક્ષણ જગાયચા આહે સ્નેહલ તાંબે
- રાત્ર હોતી વૈષ્ણવી સરોદે
- હી રાધા પણતી ઝાલી વૈષ્ણવી સરોદે
- ઈડિયા ટુડે સાગર મેહતા
- આતા સંજય સિંગલવાર
- કાય ઝાલં મી તુઝા નાહી ઝાલો તર સિદ્ધેશ ભરત શિરવાડકર
- લાજ ઓંકાર ઘાડગે
- દર્શનાલા દેવા તુઝ્યા પ્રથમેશ સુરેશ શિરસાટ
- વાવા પ્રથમેશ સુરેશ શિરસાટ

૧૫. વાત્રટિકા	ગજાભાડ લોહંડે
૧૬. માઘાર	કલ્પી જોશી
૧૭. સંસ્કાર	મિલિંદ હિવરાળે
૧૮. એક વિચાર	રૂપેશ પેવેકર
૧૯. ગાંઠલ	સુધીર મુઠીક

• પાકકૃત્યા

૧. કિસમસ કેક સંકેત ભંડારી

૨. ચોકલેટ ગનાશ કેક સંકેત ભંડારી

ખાસ સીકેપી પાકકૃત્યા

૧. નિનાવે સીમા ગિરીશ બેન્દ્રે

૨. નારળી ભાત સીમા ગિરીશ બેન્દ્રે

૩. મટણ/ચિકન વિર્યાણી સીમા ગિરીશ બેન્દ્રે

• છાયાચિત્રે, ચિત્રે આણિ ઇતર કલાકૃત્યા

૧. કાર્ટૂન ચિત્રે ચેરિલ ડિસોઝા

૨. છાયાચિત્રે અમિત શિંદે

૩. છાયાચિત્રે વિશાલ મસૂરકર

૪. ચિત્રે શુભાંગી તેલંગ

૫. છાયાચિત્રે દર્શન વાસુદેવ કામત

૬. છાયાચિત્રે પ્રથમેશ સુરેશ શિરસાટ

૭. ગ્રાફિટી પ્રથમેશ સુરેશ શિરસાટ

# ગદ્ય વિભાગ

## ◎ જીવાચી મુંબર્ડી :નાણ્યાચી દુસરી બાજૂ

સુમારે ૪ -૫ વર્ષપૂર્વી જસે માર્ગે મહાવિદ્યાલયીન જીવન સુર ઝાલે તસે મલા શિક્ષણાકરિતા મુંબર્ડી મધ્યે ફિરાવે લાગલે... કારણ યાઓથી કળવા -ઠાણ્યાચ્યા બાહેર માઝી સ્વારી કથીચ ફિરલી નબૃતી. ત્યામુલે રોજ મુંબર્ડિલા જાવે લાગણાર ,રોજચા મુંબર્ડી ઠાણે પ્રવાસ આપલ્યાલા ઝેપેલ કી નાહી યાને મલા પ્રચંડ ટેન્શન આલે હોતે ,યાચે કારણ મ્હણજે ઇથલી લોકલમધીલ પ્રચંડ ગર્ડી,કલ્લોલ હે મી આધી પહિલે હોતે ત્યામુલે ભીતી તર હોતીચ , યાચે કારણ મ્હણજે માર્ગે રહેજા કાલેજ મ્હણજે વાંદ્રાલા ,ત્યાત રોજ સેન્ટ્રલ તે વેસ્ટર્ન ટ્રેન ચી પકડાપકડી ત્યાત દાદર સારખ્યા વર્દલીચે ઠિકાણ યાત આપલા ઠાવઠિકાણ કિતી લાગેલ ઇત્યાદી પ્રશ્નાંની ગર્ડી કેલી હોતી.

ઠરલ્યાપ્રમાણે માર્ગા મુંબર્ડિલા જાણ્યાચા દિવસ ઠરલા . સુરુવાતીલા ત્રાસ ઝાલા પણ નંતર સવય ઝાલી, આણિ મગ મીહી ત્યા ગર્ડીચા અનિવાર્ય ભાગ કથી હોઊન ગેલો મલાચ કળલે નાહી . નંતર વષણી જેજે સ્કૂલ ઑફ આર્ટ લા પ્રવેશ મિલાલા ,ત્યાને અજૂન પ્રવાસ સોપા કેલા, કારણ સકાળી કળવા કારશેડ મધૂન ટ્રેન પકડાયચી આણિ આરામાત બસૂન લાસ્ટ સ્ટોપ સી. એસ .ટી .લા ઉત્તરાયચે . તસે બસાયલા મિલાવે મ્હણૂન એકા ગુપ શી ઓછા કરુન ઘેતલી હોતી, યાચા ફાયદા મ્હણજે એક તાસ પ્રવાસાત મજામસ્તી વિનોદ તર બ્ધાયચે આણિ દિવાલી, નવરાત્રી ,દસરા, ભજને ઇ .ગોષ્ઠીંચા આસ્વાદ હિ ઘ્યાયલા મિલાયચા. (ત્યાત ખાણ-પિણે હિ આલેચ )

ત્યાત ઉન્હાલા આણિ ગર્ડી અસલી કિ મુંબર્ડિત નકોસે હોતે ,ધામ યેઉન ગર્ડીવાલ્યા ટ્રેન મધ્યે ચઢલે કિવા કાહી કારણાસ્તવ ટ્રેન યેણ્યાસ ઉશીર ઝાલા કિવા ટ્રેન બંદ અસલ્યા કિ અગદીચ સહનશક્તીચા અંત હોતો અશા વેણી નકો વાટતે મુંબર્ડી. તેબ્બા મી નેહમી દેવાકડે મનાતલ્યા મનાત માઝી તકાર માંડાયચો (અશાવેણી જોરાત ઓરડલો તર આજૂબાજૂચે મલા ઉચ્ચલૂન બાહેર ફેક્ટીલ યા ભીતીને ) કિ, કા મુંબર્ડિલા હિલ સ્ટેશન સારખી થંડ હવા નાહી જેણેકરુન કમીતકમી રાત્રી તરી ગારવા વાટેલ. અશાચ ગર્મીમુલે રાત્રી ઝોપ નબૃતી લાગત તેબ્બા વાટલે, શી !! ઉગાચ આપણ મુંબર્ડિત જન્માલા આલો કુઠલ્યા તરી મસ્ત પર્યટન ઠિકાણી આપણ રાહત અસતો તર કિતી બરે ઝાલે અસતે.

નંતર જેવઢી મુંબર્ડી મી કામાબ્યતિરિક્ત ફિરલો જસે રહેજા લા અસતાના મિત્રમંડલી સોબત નિસર્ગચિત્ર (landscaping) સાઠી બોરીવલી નેશનલ પાર્ક,કાન્હેરી ગુહા, યેઉરચ્યા ડોંગરરાંગા,જિજામાતા ઉદ્યાન (રાણીચી બાગ),મરીન ડ્રાઇવ ઇત્યાદી ઠિકાણી તાસંતાસ બસાયચો તેબ્બા કલ્લુન ચુકલ કિ ખરચ ... હે સગળ આપલ્યા મુંબર્ડીચી શાન આહેત. નંતર જેજે લા ફોટોગ્રાફી ઇલેક્ટીવ ઘેતલે મ્હણૂન કેમેરા હાતાત આલા તશી મુંબર્ડીચ્યા નાણ્યાચી દુસરી બાજૂ હલ્લુંનું ઉલગડાયલા લાગલી, મગ તર દર આઠવડ્યાચ્યા શેવટી ફોટોગ્રાફી ચ્યા નાવાખાલી મુંબર્ડીચી દુસરી બાજૂ મિત્રમૈત્રીણિસોબત પ્રસંગી એકદ્યાનેચ પાયી તુડવલી. ત્યાત મગ કમલા નેહરૂ ઉદ્યાન,ગોરાઈ સમુદ્ર,જગાતલે હોણારે આઠવે આશ્ર્ય ગ્લોબલ પાગોડા,હાકેચ્યા અંતરાવર અસલેલે એલિફંટા અશા અનેક ઠિકાણી કલત નકલત ભેટ દિલી ગેલી ત્યાનંતર પોર્વિ તલાવ હિરાનંદાની ગાર્ડન યા માનવનિર્મિત નિસર્ગ સ્થળેહી પહિલી. ફોટોગ્રાફીહિ કેલી. ઇથલા પાવસાઠા હિ અનુભવલા. એક વેગણીચ દ્વિંગ અસતે ઇથલ્યા ડોંગરદર્યાત,મગ યેઊર લા જાણ્યાસાઠી હાતાત કેમેરા ઘેઊન મી પદ્ધતો ...

મુંબર્ડિલે નિસર્ગચે અજૂન એક રૂપ જે મી અજૂન કથીચ પહિલે નબૃતે તે પાહ્યાસાઠી મલા બરાચ વેલ વાટ બધાવી લાગલી તે મ્હણજે હિવાળયાત શિવડી માહૂલ ચ્યા ખાડીત યેણારે ગુલાબી ફ્લેમિંગો આણિ ઇતર સ્થળાંતરિત પક્ષી. પક્ષી મ્હંટલે કિ માર્ગા જિન્હાળયાચા વિષય ,પણ રાણીચ્યા બંદીસ્ત બાગેત તેચ પક્ષી પાહ્યાત આણિ શિવડીલા મુક્ત સંચારણારે પક્ષી પાહ્યાત ફાર જમીન અસ્માનાચા ફરક અસતો . ઠરલ્યાપ્રમાણે એકા મિત્રસોબત જાણ્યાચા પ્લાન આખવલા આણિ ભરતી ઓહોટીચી સગણી માહિતી ચેક કરુન આમ્હી ટ્રેન ને નિધાલો આણિ તડક શિવડી ગાઠલે. બંદરાવર જાયચા રસ્તા વિચારપૂસ કરત કરત અખેર તિથે પોચલો આણિ સમોર બઘતો તર હજારો ગુલાબી જીવ તિથે મુક્ત સંચારત હોતે . રોજ ફેસબુક વર્તમાનપત્રાત દિસણારા હા નજારા પ્રત્યક્ષાત પાહતાના આમચ્યા અંગાવર રોમાંચ ઉભે રાહત હોતે, માર્ગાસાઠી તર જગ ફિકે પડલે હોતે મગ લગોલગ માર્ગા આણિ મિત્રાચા કેમેરા હાતાત ઘેઊન એકા બાજૂને સ્ટીલ આણિ ન્હિંડિયો અશા દોન્હી પ્રકારે તે ક્ષણ ડોલ્યાત આણિ કેમેરાયત ફિલ્મ બનવતા યેર્દીલ અશા તર્હેને ટિપત હોતો. મધેવ જોડીજોડીને ફિરણારે ,કુઠે ગટાત ચિખલાત આપલા મેવા ખાણારે ,મધેચ પંખ પસરવુન નાચણારે તર કુઠે લાંબ વર રાંગેને ઉડણારે મોઠે ફ્લેમિંગો, તર અધૂનમધૂન કાઠાવર કિવા ફાંદીચ્યા તુકડ્યાવર ગે હેર્નેન, ઘાર , તુતારી,કિંગફિશર, ઇબીસ ઇત્યાદી પક્ષી જે મુંબર્ડીચ્યા ખાડી કિનારી ચ્યા વનાત નેહમી દિસતાત , ત્યાત ફ્લેમિંગો હે વિશિષ્ટ ઠિકાણીચ દિસતાત જે મુંબર્ડી ઠાણ્યાચ્યા ખાડીકિનારી આઢલતાત.

શિવડીલા ફ્લેમિનોચી પંદરી મહંટલે તરીહી ચાલેલ , કારણ ત્યા પરિસરાત ત્યાંના મુબલક ખાદ્ય ઉપલબ્ધ અસતે. ચિખલાતલે કિડે ,માસે ખેકડે જે મિલેલ તે ગુણ્યાગોવિંદાને ખાત અસતાત , ઇથલે ચિખલાતલે કિડે અસે આપલ્યા ચોચીને અલગદપણે ખાતાત કિ ત્યાંચા રૂવાબ બઘતચ રાહાવા. યાત દુપારચી સંધ્યાકાળ કશી ઝાલી તે કળલચ નાહી, અગદી સમાધાની મનાને આમ્હી દોઘે ઘરી જાયલા ટ્રેન પકડલી .કુંમેર્યાતિલ ફોટો બઘત હોતો પણ મનાત એક કુતૂહલ લાગલે હોતે કિ હજારો કિમી ચા પ્રવાસ કરુન હે પાહુણે કસે કાય મુંબર્દ લા ન થકતા યેત અસતીલ ,આપલ્યાલા ઠાણે મુંબર્દ પ્રવાસ નીટ કરતા યેત નાહી ,ત્યાંના ખરચ મુંબર્દ ઇતકી આવડત અસેલ કા ? ત્યાંના ત્યાંચેહી નાતલગ સાંગત અસતીલ કા? કિ યેતાના આમચ્યાસાઠી શિવડીતલ્યા ખાડીવરચે 'સ્પેશલ' કિડે ઘેઊન યા રે !! આપણ એખાદ્યાલા સાંગતો તસં .

ત્યા દિવશી બરેચ પરદેશી પર્યટક આલે હોતે ત્યાંના પાહાયલા .ત્યાંચ્યાશી તોડક્યામોડક્યા ભાષેત કા હોઈના આમ્હી સંવાદ સાધલા તેબ્બા ત્યાંની મુંબર્દ આણિ ઇથલ્યા નિસર્ગાચી બરીચ તારીફ કેલી કિ" આમચ્યા ઇથે શહરાજવળ એવઢા ભરભરુન નિસર્ગ કુઠેચ નાહીયે, તુમ્હી લોક ફાર ભાગ્યવાન આહાત કિ તુમ્હી મુંબર્દિત રાહત આહાત !ત્યાંચે હે ઉદ્ભાર આમ્હાલા આ... વાસૂન કરણ્યાશિવાય રાહિલે નાહીત . ખરચ ત્યાદિવશી મલા મુંબર્દિચ્યા નાણ્યાચી દુસરી બાજુ કાય આહે હે સમજલે. કિ જરી યા શહરાલા ગર્દાચી ,પ્રદૂષણાચી, ઘડ્યાલાચ્યા કાટ્યાવર ધ્યાવણારા મુંબર્દિકર ,કોણાસાઠીહી ન થાંબણ્યાચી વૃત્તિ ઇ .વિશેષણે અસેલહી . પણ ઇથલા ચૌફેર નિસર્ગ હા આપલ્યાસાઠી થાંબલેલા આહે. ત્યાચ્યા જોરાવર આજહી મુંબર્દ આપલા જીવ સાવરુન ઉભી આહે . ગરજ આહે ફક્ત આતા તી બાજુ સાંભાળાયચી,વાઢવાયચી આણિ ત્યાચા મનમુરાદ આનંદ લુટાયચી . તરચ પ્રત્યેક મુંબર્દિકર ઇથે "જીવાચી મુંબર્દ" યાપુછે કરુ શકેલ . મુંબર્દિચ્યા હ્યાચ બાજુમુલે આજ મી માઝા પહિલા લેખ લિહુ શકલો . ખરોખર આજ મલા અભિમાન આહે મી મુંબર્દિત રાહતો. આણિ મુંબર્દ ખરચ માઝ્યાસાઠી "જીવાચી મુંબર્દ" ઝાલીયે .... અગદી પ્રત્યેક મુંબર્દિકરાલા વાટતે તશીચ...

સાઈનાથ આવલે ...

## ◎ વાસના ( લઘુકથા )

વેડીચ તી..... ભર તારુણ્યાત, તિલા વેડ લાગલ હોતાં. કોણાચી હોતી ? કોઠલી હોતી ? કશાચા મ્હણુન તપાસ ન્હવતા. દિસાયલા સુદ્ધા, અગદી ચારચૌધીસારખી. અવધી, બાવીસ પંચવીસ વર્ષાંચી પોર અસાવી. વસ્તીમધ્યે ફિરત અસાયચી, કોણી કાહી દેઈલ તે ખાયચી, પ્યાયચી... દિવસ ભર, તિચ્ચા પાયાત અગદી ભિંગરી વાંધલેલી અસાયચી. કોણાલા, કાહી બોલનં નાહી. કિ, કોણાલા તિચ્ચાપાસુન કાહી ત્રાસ. ફક્ત, આપલ્યાચ ધુંદીત અસાયચી. કધી-કધી, એકટક નજર લાઝન બસાયચી. મધેચ, હસાયચી મધેચ રડાયચી. કાહીચ સમજત નસાયં... રાત્ર જ્ઞાલી' કિ; એખાદા આડોસા પાહુન તેથેચ રાત્ર ઘાલવાયચી. વસ્તીમધ્યે યેઊન, તિલા આતા જવણ પાસ મહિના જ્ઞાલા હોતા. આપલ્યા મરાઠીમધ્યે, એક મ્હણ આહે. "દેખણી પોર, અન; જીવાલા ઘોર"..... મુલગી, વયાત આલ્યાવર ચાર લોકાંચ્યા નજરા તિચ્ચાવર પડણારચ. આણિ, તિચ્ચાવર લક્ષ ઠેવણ મ્હણા. કિંવા, આપલી 'અંત્ર' આપલ્યા હાતાત અસાવી. અસં મ્હણા, ઘરચ્ચાંચી સુદ્ધા, તિચ્ચાવર કરડી નજર હિ અસતેચ. યાત, નવીન અસં કાહી નાહી. પણ, કોંબડ જ્ઞાકલ્યામુલે દિવસ ઉગવાયચા સુદ્ધા રાહત નાહી. આણિ, કોંબડા આરવાયચા સુદ્ધા રાહત નાહી. યેવઢ કરૂન સુદ્ધા, કાહી મુલીચ્યા બાબતીત 'જે' ઘડાયં, તે ઘડતં સુદ્ધા. પરંતુ, હિચ્ચા બાબતીત નેમકં કાય ઘડલં હોતાં ? યાબાવત, કોણાલાચ કાહીચ માહિતી ન્હવતી. અસાચ, દોન એક મહિન્યાચા કાલાવધી નિઘૂન ગેલા.

તિલા, સગળી વસ્તી 'યેડી' મ્હણાયચે. યેડીચં, કુઠેહી ઝોપણ કસંહિ બસનં પાહુન.... કાહી, કામાંધ પુરુષાંચી વાસના ચાલવલી ન ગેલી તર નવલચ હોતાં. આણિ, અશાચ કાહી કામાંધ પુરુષાંચી નજર તિચ્ચાકડે વલાલી સુદ્ધા હોતી. પણ કોણી, ઠોસ પાઉલ ઉચલત ન્હવત. આણિ, તી કાલ રાત્ર ઉજાડલી..... ત્યા દિવશી, બબન ચાંગલાચ તરાટ હોઊન આલા. રાત્રીચે, દહા સાડેદહા વાજલે અસાવેત. વસ્તીપાસુન થોડસં દૂર, એક નાલા વજા પૂલ હોતા. યેડી, તિથેચ પડલેલી અસાયચી. બબનચી પાવલં, પુલાચ્યા દિશેને વબ્લ લાગલી. યેડી, અંગાચી ઘડી કરૂન ઝોપી ગેલી હોતી. બબનચ્યા ડોક્યાત 'અક્કાબાઈંચા' સંચાર હોતા, ઝોપલેલ્યા યેડીચ્યા, ઉઘડ્યા ગોર્યા માંઢ્યા પાહુન બબનચી 'કામવાસના' જાગૃત જ્ઞાલી. આજૂબાજૂચા અંદાજ ઘેત, બબન યેડીચ્યા શેજારી આડવા જ્ઞાલા. તિચ્ચા, સર્વાગાવરૂન ત્યાચા હાત ફિરુ લાગલા. ત્યાને, તિલા ચાચપાયલા સુરવાત કેલી. યેડી ગાઢ ઝોપલી હોતી. તિચ્ચાકઢૂન, બબનલા કોણત્યાચ પ્રકારચા પ્રતિસાદ મિળત ન્હવતા. કિ, વિરોધ સુદ્ધા હોત ન્હવતા. ચવતાલલેલ્યા બબનને, તિચ્ચા અંગાવરીલ એક એક વખ્ત કાઢાયલા સુરવાત કેલી. ત્યાને, તિલા અર્ધ વિવખ કેલાં. આણિ, આપલા કાર્યભાગ ઉરકૂન ઘેતલા. બબનચી કામવાસના, શાંત જ્ઞાલી હોતી.....!! આણિ, તો; આલ્યા પાવલી ગુપચૂપ વસ્તીકડે નિઘૂન ગેલા.

આતા, બબન એકટાચ ન્હવતા, યેડીચ્યા માગે, અજૂન દોન ખોંડં સુદ્ધા લાગલે હોતે. રાજા આણિ બંઢ્યા, હે દોઘે સુદ્ધા યેડીચ્યા વેડેપણાચા ગૈરફાયદા ઘેત હોતે. પણ, કોણાચીચ ખ્ખબર કોણાલા ન્હવતી..... હ્યા તિઘાનાહી, એકમેકાચ ગુપિત માહિત ન્હવત. યેડી કડૂન, ન હોણારા 'પ્રતિકાર', હા યા તિઘાના નિત્યાચાચ જ્ઞાલા હોતા. જો' જ્યાલા, વેલ મિળેલ તસા યેડીચા ઉપભોગ ઘેત હોતે. આણિ, શેવટી બ્હાયચં તે જ્ઞાલચ. નિસગાને આપલી કિમયા દાખવલી. પેરેલ તે ઉગવેલ હા સૃષ્ટીચા નિયમચ આહે, નાહી કા. ? ત્યાલા, યેડી તરી કશી અપવાદ ઠરણાર...? યેડીચ્યા પોટામધ્યે, વીજ રૂજાયલા સુરવાત જ્ઞાલી હોતી. યેડીચ્યા પોટાને, હલ્લ હલ્લ 'આકાર' ચ્યાયલા સુરવાત કેલી. વસ્તીમધ્યલ્યા બાયાંચ્યા નજરેતૂન, હિ ગોષ્ઠ; સુટ્ટલી તર, નવલચ હોતાં. યેડીકડે પાહુન, વસ્તીમધીલ આયા બાયા હલ્લહલ વ્યક્ત કરાયચ્યા. રાગાને..... "કુઠ્ટલ્યા ભાડખાવન આઈ ઘાતલી આસન".... મ્હણુન, મનાલા યેયીલ તશા શિંચા, શાપ દ્યાયચ્યા. શેવટી, ..... એક સ્ત્રીચ એકા સ્ત્રીચ્યા કામી યેણાર. વસ્તીમધીલ સ્ત્રીયાંની, યેડીકડે જાતીને લક્ષ દ્યાયચં ઠરવલાં. વસ્તીમધ્યે યેડી સાઠી એક નવીન ઝોપડં બાંધળ્યાત આલાં. જશી કાહી, તી ત્યા વસ્તીચીચ મુલગી હોતી. ઇકડે' બબન્યા, બંઢ્યા આણિ રાજા તિઘાંચ્યા ડોક્યાત કિડે પડલે હોતે. હે તિઘેહી, અવિવાહિત મુલાં. યાતલા, નેમકા "કુંવારા બાપ" કોણ ? હે કોણાલાચ માહિતી ન્હવત. યા તિઘાનાહી વાટાયચં, કિ... ચૂક આપલીચ આહે, આપણ સુદ્ધા, તિલા કાહીતરી મદત કરાવી. પરંતુ, અશા વાગણ્યાને શંકેલા વાવ મિળેલ. મ્હણુન, કોણીચ પુઢે યેત ન્હવતા. યેડીલા, કોણાપાસુન દિવસ ગેલેત ? વસ્તીમધ્યે, હા ચર્ચેચા વિપય જ્ઞાલા હોતા. જો તો, એકમેકાકડે વાકઢ્યા નજરેને પાહત હોતા. ત્યાત, વાઈટ વૃત્તીચ્યા આણિ બેવઢ્યા લોકાંના લક્ષ કેલાં ગેલાં હોતાં. પરંતુ, ડોલે બંદ કરૂન દુધ પિણારી 'માંજર' કોણાલાચ દિસત નબ્હતી.

બઘતા-બઘતા નઊ મહિન્યાચા કાલાવધી લોટલા. આણિ, યેડીને સુંદર અશા કન્યા રત્નાલા જન્મ દિલા. દોન ચાર દિવસાંની, જવળચ અસણાર્ય એકા ક્રિસ્ટી મિશનર્યાંચ્યા કાનાવર હિ બાતમી, પોહોચલી. ત્યા દિવશી, વસ્તીમધીલ આયાબાયાંની યેડીચં ન્હાન ધુનં કેલં હોતં. તિતક્યાત, દોન ચાર ક્રિસ્ટી બાયા આલ્યા. આણિ, ત્યા યેડી વ તિચ્યા મુલીલા ગાડીમધ્યે ઘાલૂન ઘેઊન જાऊ લાગલ્યા. વસ્તીમધીલ આયા બાયાંની, ત્યાંચ્યા હાતા પાયા પડૂન કસબસં યેડીચ્યા મુલીલા આપલ્યા પદરાત પાડૂન ઘેતલં. વસ્તીમધીલ મેરીલા, મુલબાલ ન્હવત. તિને, મુલીલા સાંભાળણ્યાચી તયારી દાખવલી. આણિ, ત્યા ઓલ્યા બાલંતીનીલા ગાડીત ઘાલૂન ત્યા મહિલા ઘેઊન ગેલ્યા. વેઢ્યા 'આઈચી' ઓલખ હોણ્યાઅગોદરચ, ત્યા, માયલેકિંચી "તાટાતૂટ" જ્ઞાલી હોતી.

પંડિત પાંટર ...

## ૦ પ્લેચેટચી ગંમત ( લઘુકથા )

આમચ્યા બંકેચા માર્કેટિંગ મેનેજર ખારકર આણિ ટાયપિસ્ટ વિનિતા પરવા રેલ્વે અપધાતાત ઠાર જ્ઞાલે.

આમચી બંક \* \*લા આહે. આમ્હી પુણ્યાહૂન અપડાઊન કરતો. તે દોઘે રાત્રી દહા વાજતાચ્યા દાદર-ચેન્નાઇને પુણ્યાલા યેત હોતે. દારાત ઉભે હોતે. એકા સિગ્રલપાશી તોલ જાऊન પડલે. જાગીચ નિધન.

ત્યાંચ્યા નિધનાને સર્વત્ર પોકળી નિર્માણ જ્ઞાલીય. ખારકર જ્યાચ્યાકઢૂન મસાલા પાન, સિગારેટી આણિ ગુટખા ઘ્યાયચા તો પાનવાલા ઉદાસ આહે. વિનિતા જ્યાંચ્યાકઢૂન ડ્રેસેસ, સેંડલ્સ, લિપસ્ટિક, પર્ફુમ, ઇ. ઘ્યાયચી તે દુકાનદાર અપસેટ આહેત. દોઘે જ્યા હ્યોટેલાત નિયમિત ચરાયચે (આણિ ત્યાચી વિલં ઑફિસચ્યા ખર્ચાત દાખવાયચે) તો હ્યોટેલવાલા ડિસમૂડ આહે.

મી તુમ્હાલા સગળં ખુલાસેવાર સાંગતો.

આમચ્યા કચેરીત ઇન મિન વીસેક કર્મચારી. સારે વિવાહિત. ફક્ત ખારકર આણિ વિનિતા અવિવાહિત. કારણ ત્યાંચી તશી મજબૂરીચ હોતી.

ખારકર આમચ્યા બંકેત હા મ્હણું પ્રસિધ્દ હોતા. હા મ્હણજે કાય, તે કળાં ના? થર્ડ પાર્ટી! ત્યામુંં ત્યાચં લગ્ન જમત નબ્હતં. પણ લગ્ન જમત નસલં તરી તો કાયમ મહિલાંચ્યા ઘોળક્યાત વાવરત અસે. અગદી મોકળ્યાઢાકળ્યા પદ્ધતીને. કારણ ઉઘડ હોતં. તો હા અસલ્યાને સર્વ મહિલા ત્યાચ્યાશી વિનધાસ્ત સલગીને વાગત-બોલત. ત્યાંના તો પન્નાસ ટક્કે ત્યાંચ્યાતલાચ વાટે. ઑફિસચ્યા કામાસાઠી સંધ્યાકાળી જાસ્ત વેલ થાંબલ્યાવર કિંવા સહલીહૂન પરતતાના એખાદીલા ઘરી જાયલા ઉશીર હોણાર અસેલ તર તી હક્કાને ખારકરલા સોબત નેર્ઝ.

\*\*\*\*\*

પરવાચ્યા માર્ચલા ટીબીચ્યા કામાસાઠી ખારકર આણિ વિનિતા રોજ ઉશીરાપર્યત થાંબત હોતે. વેગવેગળ્યા ટોટલ્સ વગૈરે ઘેત હોતે. વ્હાઉચર બનવીત હોતે. ટીબી ટંલી હોત આલા અસં ત્યાંની જાહીર કેલં, ત્યાચ રાત્રી તો અપધાત જ્ઞાલા. ત્યા દિવશી આમ્હી નેહમીપ્રમાણે સહા વાજતા ઑફિસાતૂન નિધાલો. હે દોઘે રાત્રી નજ વાજેપર્યત થાંબલે. ત્યાંની ટીબી ટંલી કેલા. ઑફિસલા કુલૂપ લાવલં. વૉન્ચમનજવળ ઑફિસચી કિલ્લી દિલી આણિ ઘરી યાયલા નિધાલે. આગગાડીત બસલે. રાત્રીચી વેલ. ગાર હવા. દોઘે દારાત ઉભે રાહૂન ગપ્પા મારીત હોતે. અચાનક એકા સિગ્રલપાશી તોલ જાऊન ખાલી પડલે. ગાડી વેગાત અસલ્યામુલે જાગીચ ઠાર જ્ઞાલે. સકાળી દોઘાંચી પ્રેતે સાપદલી. ત્યાંચ્યા જવળચ્યા બ્રીફકેસેસ આણિ ત્યાતલ્યા રેલ્વેચ્યા પાસેસવરુન ત્યાંચી ઓલ્યા પટલી. તે દોઘે ગેલે. પણ ત્યાંચ્યા બરોવર ટીબી પણ ગેલા. કારણ ટીબીચી ફાઈલ સંગણકાવર સાપદેના. આમ્હી ફાર હતાશ જ્ઞાલો. કારણ ટીબી હેડ ઑફિસલા સબમિટ કરાયચા હોતા. ત્યાંની ટીબી પ્રિંટ કેલા કી કાય? ત્યાચી સીડી આહે કા? સગળં શોધૂન જ્ઞાલં. ટીબી કાહી સાપદેના.

શેવટી આમ્હી એક બંગાલી માંત્રિકાલા બોલાવલં. હા ફાર પૉવરફુલ માંત્રિક હોતા. શિવાય તો સંગણકતજ્જ હોતા. ત્યાને આમચ્યા ઑફિસચ્યા મેન સર્વહરપુઢે એક કોંબડી કાપલી. મગ મલા પૂજેલા બસવલં. પૂજા જ્ઞાલ્યાવર ત્યાને મંત્ર મ્હણું માઉસલા કાળા દોરા બાંધલા. મગ નેટવર પ્લેચેટ@બંગાલીબાબા.કોમ હી સાઈટ ઓપન કેલી. તી ઓપન જ્ઞાલ્યાવર ત્યાને ખારકરચં નાવ, જન્મતારીખ, રાસ, મૃત્યુચી તારીખ ટાઈપ કરુન મંત્રોદ્વાર કરીત સર્વ આરંભલા.

આમ્હી સારે ડોલ્યાત પ્રાણ આણું સમોર ઉભે હોતો

અચાનક માંનિટરવર ખારકરચા ચેહરા આલા. પાઠોપાઠ સ્પીકરમધૂન આવાજ આલા,

“મલા કોણી બોલાવલંય?”

માંત્રિકાને મલા પુંદું વ્હાયચી ખૂણ કેલી. મી ભીત ભીત પુંદું જ્ઞાલો.

“ખારકર, તૂ મેલા આહેસ કા?”

”હો!”

“આત્તા તૂ કુઠે આહેસ?”

”મી સ્વર્ગત આહे.”

આમચે મનેજર નાગંપીસાહેબ હે રાજ કપૂરચે ફૅન આહેત. ત્યાંની પુઢં હોઊન વિચારલા,

”તિથં રાજ કપૂર આહે કા હો?”

“આહે કી, ઇથં ત્યાલા ચિત્રગુસાને પાઠણાઘરાત ડ્યૂટી લાવલી આહે. ત્યાને આયુષ્યભર સિનેમાત નાયિકાંચી સ્ત્રાન દૃશ્યે દાખવલી હોતી ના, મ્હણું ત્યાલા ચિત્રગુસાને કામ દિલંય કી રોજ સ્વર્ગતલ્યા લહાન મુલાંના આંધોળ ઘાલાયચી.”

”આપલા ટીબી કુઠં આહે તે સાંગ ના.”

”તો માઝ્યા પેન ડ્રાઇબ્લ્યુર આહે. પેન ડ્રાઇબ્લ્યુ માઝ્યા ટેબલચ્યા ખાલચ્યા ખણાત આહે.”

”થેંક યૂ.”

”મી આતા જાઊ કા?”

”થાંબ ના, વિનિતા કુઠં આહે? કશી આહે?”

”તી ઇથંચ આહે. આમ્હી આતા લગ્ન કરણાર આહોત.”

”તે કસં શક્ય આહે? તૂ તર હા આહેસ ના?”

”નાહી, મિત્રાંનો, મી હા નાહી.”

”પણ – ”

”તી એક મોઠી કહાણી આહે.”

આણિ ખારકર આપલી કહાણી સાંગુ લાગલા.

\* \* \*

મિત્રાંનો તરુણ અસતાના મી ધ્યેયવાદી આણિ પુરોગામી પુરોગામી હોતો. હુંડા ઘેણાર નાહી અશી મી કોલેજાત અસતાના શપથ ઘેતલી હોતી. પુઢે મલા નોકરી લાગલી. પગાર વાઢલા. સાહજિકચ હળ્હલ્હ જાતીતલી સ્થળં સાંગુન યાયલા લાગલી. ત્યાતલી એક મુલગી મી પસંત કેલી. તિલા દેખીલ મી પસંત પડલો.

પણ લગ્નાચી બોલણી કરતાના માઝ્યા પ્રતિજ્ઞેલા સ્મરૂન મી તિચ્યા બાપાલા મ્હણાલો,

”મલા મુલગી પસંત આહે. પણ મલા હુંડા નકો. ફક્ત મુલગી આણિ નારળ દ્યા.”

તો આધી ચકિત ઝાલા. પણ તો દેખીલ ખાનદાની હોતા. માઝ્યાવર ભડકૂન તો મ્હણાલા,

”બિન હુંદ્યાચં લગ્ન કરણાપેક્ષા મી માઝ્યા મુલીલા વિહિરીત ઢકલીન.”

અશા રીતીનં તે લગ્ન મોડલં.

નંતર અશીચ એકેક સ્થળં યેત રાહિલી. મુલીના મી આણિ મલા ત્યા પસંત પડલ્યા તરી બોલણી સુરુ ઝાલી કી યા પ્રતિજ્ઞેમુલે દર બેળી બોલણી ફિસકટાયાચી. સતત અશી લગ્ન યાચ કારણાનં મોડત ગેલી નિ હળ્હ હળ્હ જાતીતલ્યા સર્વ વધૂપિત્યામધ્યે માઝ્યાબદ્દ કુજ્બૂજ સુરુ ઝાલી. પર્મનંટ નોકરી, ફ્લેટ, ગાડી અસૂનહી હા તરુણ હુંડા નકો મ્હણતોય, ત્યા અર્થી ત્યાચ્યાત કાહી તરી જબરદસ્ત ફૉલ્ટ અસાવા. ત્યાશિવાય કોણ અશી વિચિત્ર અટ ઘાલીલ.

મગ હી અફવા સર્વત્ર પસરત ગેલી. મલા જાતીતલી સ્થળં સાંગુન યાયચી બંદચ ઝાલી.

તરી મી ધીર સોડલા નાહી. આંતરજાતીય લગ્ન કરાયચા પ્રયોગ સુરુ કેલા. વેગવેગલ્યા વર્તમાનપત્રાત તશા આશ્યાચ્યા જાહિરાતી દિલ્યા. માત્ર ત્યાચા આણખી વિપરીત પરિણામ ઝાલા. પર્મનંટ નોકરી, સ્વતઃચા ફ્લેટ, ગાડી અસૂનહી હા તરુણ જાતીતલી મુલગી ન કરતા આંતરજાતીય લગ્નાલા ઉભા આહે, હુંડા નકો મ્હણતોય, મ્હણજે ત્યાચ્યાત અગદી નંદીચ કાહી તરી ફૉલ્ટ અસાવા અશી મીડિયામધ્યે દેખીલ સમજૂત પસરલી. અશા રીતીને મી આધી જાતીત, મગ સંપૂર્ણ શહરાત આણિ નંતર એકૂણ એક વધૂવરસુચક મંડળાત હા મ્હણું બદનામ ઝાલો. મલા કોણત્યાહી જાતીતલી કિંવા ધર્માતલી દેખીલ વ્યંગાચી, ઘટસ્ફોટિત, બિજવર, તિજવર દેખીલ સ્થળે યેરેનાત. મી પૂર્ણ સંપલો. આયુષ્યાતૂન ઉઠલો.

હે દુઃખ વિસરણાસાઠી મી સ્વતઃલા કામાત બુડવૂન ઘેતલં. ખૂપ કામ કરુ લાગલો. ત્યામુલે આપલે મનેજર નાગંપીસાહેબ માઝ્યાવર ખુશ જ્ઞાલે. તે નેહમી માઝ્યાશી પ્રેમાને વાગાયચે. મલા જેવાયલા ન્યાયચે.

એકદા કાય જ્ઞાલં. ત્યાંચ્યા બાયકોલા નાશિકલા જાયચં હોતં. તીન દિવસાંની પરત યાયચં હોતં. પણ ત્યાંના રજા ઘેણ શક્ય નથૃતં. ત્યાંની મલા કેબિનમધ્યે બોલાવૂન આપલી અડચણ સાંગિતલી વ મ્હણાલે,

“ખારકર, તુમ્હી પ્લીજ માઝ્યા બાયકોબરોબર નાશિકલા સોબત જા. મી તુમ્હાલા તીન દિવસ આંન ડ્યુટી સોડતો. તુમચં ટેબલ દેખીલ મી સાંભાળીન.”

“પણ સાહેબ, આમ્હી દોઘે ઓફરનાઈટ તીન દિવસ બાહેર ગેલો તર દિસાયલા વાઈટ દિસેલ હો. લોક કાય મ્હણતીલ?”  
યાવર નાગંપીસાહેબ ખોખો હસલે.

“કોणી કાહી મ્હણણાર નાહી હો, કા કાળજી કરતાય? તુમ્હી હા આહાત હે સર્વાના ઠાક આહે.”

મી નિરુત્તર જ્ઞાલો. નંદિની મેંડમના ઘેઊન મી નાશિકલા ગેલો.

આણિ મગ માઝ્યા જીવનાત તી ક્રાંતી જ્ઞાલી. મેંડમના સાહેબાંચી બાયકો આણિ મી નાશિકલા ગેલ્યાવર તિલા માઝાં રહસ્ય સમજલં. આમ્હી દોઘાંની એકા હૈટેલમધ્યે મસ્ત મૌજ કેલી. પુઢે મેંડમની તિચ્યા મૈત્રીનીત માર્ગી શિફારસ કેલી. મગ કાય, કોણાહી મહિલેલા બાહેરગાવી સોબત હવી અસલી કી તિચા નવરા મલા સોબત જાયચી વિનંતી કરુ લાગલા. મહિલાંના સોબત જાણે હા માજા પાર્ટટાઈમ જોંબ જ્ઞાલા. મલા કાય, આમ કે આમ....

મી અશી ચોરુન મજા કરીત હોતે. પણ મલા સંસાર કરાયચી ઇચ્છા હોતી. મલા સોબત નેણાંન્યા અનેક અવિવાહિત, ઘટસ્ફોટિત સ્ત્રીયાના મી લગ્નાબદ્દ વિચારલં. પણ ત્યાંચ્યાપુંં એકચ સમસ્યા હોતી. લગ્નાંતર મૂલ જ્ઞાલં તર તે કુણાં મ્હણ્ણન સાંગાયચં.

શેવટી મી વિનિતાલા પટવલી. આમચં દોઘાંચં સૂત જમલં. સ્વભાવ જુલ્લુન આલે. તી માઝ્યા આયુષ્યાત આલ્યાપાસૂન મી ઇતર મહિલાંના સોબત જાયચં બંદ કેલં. સોબત ગેલો તરી તી ગંમત કરાયચં સોડુન દિલં. પૃથ્વીવર અસતાના આમ્હી કથીચ લગ્ન કરુ શકલો નસતો. પણ આતા સ્વર્ગાત કાહીચ પ્રોબ્લેમ નાહી. આતા મી મેલો આહે. માર્ગી પ્રેયસી વિનિતા મેલી આહે. આમ્હી આતા સ્વર્ગાતચ રાહણાર આહોત આણિ લગ્ન કરણાર આહોત. ઇંદ્રાને આમ્હાલા દોઘાંના લગ્નાંતર કાયમ સ્વર્ગાત ઠેવણ્યાચી ઓર્ડર કાઢલી આહે. મલા નિરોપ દ્યા.

\*

હે ચાલુ અસતાના દરમ્યાન આમચ્યા શિપાયાને ખારકરચ્યા ટેબલાતૂન પેન ડ્રાઇવ્લ કાઢલા હોતા. ત્યાવર ટીવી સુરક્ષિત હોતા. આમ્હી ત્યાચે મનાપાસૂન આભાર માનલે વ લોંગ આઉટ જ્ઞાલો. બંગાલી બાબાલા ત્યાચી ફી દિલી. તો આમ્હાલા આશીર્વાદ દેઊન નિઘૂન ગેલા.

ટીવીચી સમસ્યા સુટ્લ્યામુલે સારે ખુશીત હોતે.

ફક્ત આમચે મનેજર નાગંપી સાહેબ માત્ર ઉદાસ હોતે.

ખારકર સર્વાત પહિલ્યાંદા ત્યાંચ્યાચ આગ્રહાવરુન ત્યાંચ્યા બાયકોબરોબર નાશિકલા ગેલા હોતા ના!

\*\*\*

વિજય તરવડે ...

## ◎ ભાવશ્યાચે આજીલા પત્ર

તર પ્રિય આજી,

પાર દિવાળી આલી ભો. તરી તૂ ઘરાત ફટાકડ્યા આણીના. કરુ તરી કાય મી...! લય તલ્લતાયલા લાવિતી ભો તૂ. ત્યા રઘ્યાલા પહાય, કશા તીન લવણ્યા ફટાકડ્યાચ્યા લડી આણલ્યાત ત્યાચ્યા વાપાની. મ્યા મહ્યા ડોળયાંની પાદ્યાલ્યાત ત્યાચ્યા ઘરી જાવુન. ત્યા કાશ્યાલા ચાર લડી આણલ્યાત. રામ્યા દુપારી એક લડ ઘેવુન કાકરત કાકરત ગેલા. સગળ્યાંચ્યા ઘરી જાવ જાવુ મી ફટાકડ્યા પાહુ પાહુ આલો. તુલા સયીનાસંગીત સાંગિતલં કોણાકડ કશે ફટાકડે હાયેત તે. તરી તૂ મલા ફટાકડ્યા આણાયં નાવ ઘેરેના ભો... લય ડોક્યાલા કહાર ઝાલાય મહ્યા. મલા આપલ્યા ચૌફુલીવર બોલવુન ઘેવા લાગન ભો પોરાંલા. ત્યાંચ્યાચ ફટાકડ્યા વાજવાવા લાગતીન. તૂ આણુન ધીલ્યાસ મલા ટિકલ્યા.

આન્ધુલીચ્યા દગડાવર વાજવીત બસલોય. દગડાવર દગડ આપટીત બસૂન દોન્હીચે દોન્હી હાત દુખુન આલેત....તૂ આણેલ ટિકલ્યા વાજવિતા વાજવિતા કટાલા આલાય ભો. જનાવારાપુઢ ભૂસ્કાટ ટાકીત્યાત તસં તૂ મહ્યાપુઢ ટિકલ્યા ટાકલ્યાસ... અસં મલા ગુલુકાકા મ્હણત વ્હતા. તિસરા પહારચ ઝાલીય તરી પોરં લડી સોડ સોડૂ ફટાકડે વાજવાયલા લાગલેત. નિસતે નિસતે ઠો ઠોય ઠીશ.. ઠો ઠોય ઠીશ.. ઠો ઠોય ઠીશ આવાજ યેત્યાત. મંગ લય વાજવાવા વાટાયાત ભો ફટાકડે. આણ ભો તૂ ફટાકડે. નકો મહ્યા ડોક્યાલા શિન કરુસ. મલા વાટત વ્હત તૂ માહી લય ચાંગલી આજી હાયેસ. પણ તૂ કાય ચાંગલી નહી ભો. લેકરાલા ફટાકડે વાજવાયલા નહી તરી તુલા કાય વાટત નહી. તુલા કાહીચ ત્યાચા ઘમ ના પસ્તાવા આસ હાયે તોહ. મલા માહિત નહી કા કાય...! તુલા જમત નસન ના તર દી મલા પૈસે. મી ઘેવુન યેતો ગુલુકાકાકૂન. પાહાય તૂ મંગ મી કસા રખ્યાસ મધી જાતો અન રખ્યાસ મધી યેતો તે..! મહ્યા વર્ગાતલ્યા બાબ્યાની પાનપટ્ટ્યા આણલ્યાત ભો.

લાવણ્યા ફટાકડ્યાવાણીચ ઠો ઠોય ઠીશ વાજાત્યાત ત્યા. ત્યાંની સુરસુ-યા બી આણલ્યાત ભો. લય ભારી ઠિણગ્યા ઉડાત્યાત ત્યાચ્યા. જરાસક ચિમળીવર ધરાયચં કા લગેચ સુર્ર્ર્ર્રી વાજત ભો તે. કા પેટલચ. મંગ તે ઘેવુન આપુની પાછાયચં દારી. રાત જર અસલી ના આજી, લય ઉજેડ પડતો ત્યાચા....માહિત હાયે કા તુલા. મલા સુરસુરેબી આણ ભો. દિવાળી યેયીન અન લગેચ જાઈન. તી થાંબત નહી કોણાસાઠી... આસ આમચે ગુર્જી મ્હણત વ્હતે ભો. દિવાળી ગેલી કા લય દિવસાંની યેયીન. મ્હણુન મ્હણતો, મલા ફટાકડે આણ. વાજવુ દી. કિતી દિવસ હ્યા ટિકલ્યા ઠેશીત બસુ...!!! તો એડા રંગ્યા કુલપત કુલપત ચાલ્લા વ્હતા. તબ્બા મ્યા ત્યાચ્યા હાતાત ચાર સુતલી આટણ બાંબુ પાદ્યાલે ભો. તે લય મોઢ્યાંની વાજાત્યાત.... કાનઠલ્યા બસાત્યાત. આવાજાની ધાદરાત શહાણ માણૂસ... માહિત હાયે કા તુલા. રંગ્યાની મલા વાટાવરચ દાખાવલે તે.

લય નેહેલું નેહેલું પાદ્યાલે ભો મ્યા. લય ઢમ્મે ઢમ્મે વ્હતે તે. રાદ્વી ના તો એકટાચ વાજવણાર હાયે ભો તે સગલે. મી ત્યાલા મ્હણલો, ‘તૂ રાદ્વી યી ભો આપલ્યા ચૌફુલીવર. આપુની વાજવુ.’ તર તો મ્હણલા, ‘તૂ તુદ્ધા આજીલા સાંગ આણાયલા. એક શેલી ઇકાયલા સાંગ તિલા. મી મહ્યા ઘરાપશી વાજવણાર હાયે. મહી આય મ્હણી કા આપલ્યા ઘરાપશી ઉડવ ફટાકડે. ઘરાપશી આવાજ જાયાલા લાગતો. ફટાકડ્યાચા ધૂર ઘરાત જાવા લાગતો. યેડા હાયે કા કાય તૂ... મી કશાલા યેવુ ચૌફુલીવર...! ભાવશા, તૂ બસ દગડાંની ટિકલ્યા ઠેશીત.. તૂ આટણ બાંબુચ્યા આવાજાંની બેહેશીન. તૂ આદ્ભૂક લય બચ્ચ હાયેસ.’ તર આજી એડા રંગ્યા મલા કાય કાય બોલુન ગેલા.

એડા અસૂન ત્યાચ્યા આઈની ત્યાલા આટણ બાંબુ ધ્યિલેત ઘરાપશી વાજવાયલા. મલા તૂ નિદાન લાવણ્યા ફટાકડ્યાચી એખાંડી લડ તરી આણુન દી ભો.. આપલં ઘર એકન જરાસક ઠો ઠોય ઠીશ. ઘરાત ફટાકડ્યાચા ધૂર જાઈન. બર વાટન ત્યાલા. લોકં કિતી ફટાકડ્યા આણીત્યાત ભો. પિશવ્યા ભર ભરુ આણીત્યાત. દિવસ રાત નિસ્ત ઠો ઠોય ઠીશ ... ઠો ઠોય ઠીશ વાજવિત્યાત. અન મી નિસ્ત ઝોપાતૂન ઉઠલ્યાપસૂન ટૂચુટૂચુ ટિકલ્યા વાજવિતોય. આજી તૂ મલા ફટાકડ્યા આન. નાહીતર મહ્યાકડ ચાર આણે દી ભો. મી યેતો ઘેવુન. સકાળ ધરૂન સગળ્યા વાડ્યા વસ્ત્યાંવર ફટાકડે વાજાત્યાત. આપલ્યાચ વસ્તીવર વાજત નહી. ઉદ્યા લોકં કાય મ્હન્તીન આપલ્યાલા... તુલા નાવં ઠીવતીન ભો આજી લોકં. મ્હણુન જ્યાસ ઇચ્છાર કરુ નકો. ફટાકડે આણ. ઠોય ઠોય વાજવુ દી મલા. મહ્યા ડોક્યાલા લય તાપ ઝાલાય હ્યા ટિકલ્યા વાજવુ વાજવુ. દુસ્યાંચ્યા ફટાકડ્યાચે બાર એકુ એકુ ઉબાગલ્યાવાણી ઝાલંય. તબ્બા ફટાકડ્યા વાજવલ્યા બિગર મહ કાય ખરં નહી. માહી તૂ લય મસ્ત આજી હાયેસ. લય હૃશાર આજી હાયેસ. લય માહી કાળજી કરતીસ ભો તૂ... ફટાકડ્યા આણ ભો...! મોઠ ગઠુડ બાંધૂન આણ ફટાકડ્યા...! તુઝાચ લાડકા ભાવશા

ચંદ્રકાંત ભોસલે ... 

## ૦ હાચ ખરા ગુરુ

ટિપ : હા લેખ મ્હણે કોણાચી કેલેલી પબ્લિસિટી નસૂન આજકાલચ્યા દુનિયેત નાહીશા જ્ઞાલેલ્યા માણુસકીલા દિલેલે ચોખ ઉત્તર આહે.

ગુરુ બ્રમ્હા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તત્ત્વેય શ્રી ગુરુવે નમઃ

હ્યા વરીલ વાક્યાવરૂન તુમ્હી અર્થાત્ત આપલ્યા શાઠેતીલ અથવા કાહી લોકાંના ત્યાંચ્યા કોલેજ મધીલ શિક્ષક ડોઢ્યાસમોર આલે અસ્તીલ. તર કાહીની આપલ્યા આઈ-વડિલાંચી છ્વાંસ સમોર આણલી અસેલ. પણ માઝ્યા ડોઢ્યાસમોર ચિત્ર યેતે તે કાળાચૌકી, મુંબઈ સ્થીત “શ્રી. ગુરુદત્ત વાકદેકર” યાંચ. અર્થાત્ત હે નાવ કોણાલાચ પરિચિત નસેલ. ફક્ત માઝ્યા આણિ માઝ્યા મિત્રમંડળીન મધ્યેચ મર્યાદિત અસલેલ હે નાવ. આજકાલચ્યા ફેસબુકચ્યા જમાન્યાત હે નાવ તિથે હિ દિસણાર નાહી કારણ ગુરુદત્ત વાકદેકરાંચા ઓઢા હા પ્રત્યક્ષ ભેટીત્ત અસતો આણિ આપલ્યા કામાચા ગવગવા કરત નાવ કરણે ગુરુંના કથીચ જમલે નસેલ નાહીતર હા માણૂસ નક્કીચ એક મોઠા સોશલ વર્કર જ્ઞાલા અસતા હ્યાત વાદ નાહી.

માઝ્યા આણિ માઝ્યા સારખ્યા હોતકરુ તરુણાંચ્યા જીવનાત હા અવલિયા આલા તો જાનેવારી ૨૦૧૨ સાલી. આમ્હી સિક્કીમ મણિપાલ યુનિવર્સિટી મધ્યન MBA કરીતા અંડમિશન ઘેતલાં આણિ આમચ કામ સાંભાળુન સુરુ જ્ઞાલી તારેવરચી કસરત, મ્હણજેચ આઠવડાભર કામ આણિ રવિવારી MBA ચે લેક્ચર.

(આતા ‘આમ્હી’ હાચ શબ્દ તુમ્હાલા માઝ્યા પુઢીલ લિખાણાત નિર્દર્શનાત યેઈલ, કારણ હે લિખાણ જરી માઝે અસલે તરી હ્યાતલે વિચાર હે માઝ્યા તમામ મિત્ર-મંડળીચે આહેત.)

હ્યાચ દરમ્યાન આમચી ઓળખ જ્ઞાલી તી શ્રી. ગુરુદત્ત વાકદેકરાંશી. પહીલ્યાચ ભેટીત કાહી વિશેષ છાપ પડેલ

અસ્સં હે વ્યક્તિમત્વ વાટલંચ નાહી કારણ એવઢા વયાને મોઠા મનુષ્ય MBA ચ્યા કોર્સ લા કાય કરતોય અસા પ્રશ્ન આમ્હાલા પડલેલા પણ એકા નાવાજલેલ્યા ફાર્માસિટીકલ કંપનીની IT ડિપાર્ટમેન્ટ મધ્યે કામ કરણારે ગુરુ આણિ ત્યાંચી શિક્ષણાચી ઓઢ મ્હણૂન મગ MBA કરણ્યાસાઠી તે દાખલ જ્ઞાલે. આણિ શિક્ષણાલા વય નસતે હા વિચાર આમચ્યા મનાત રૂજવલા.

પણ નંતર જસ જસા હ્યા માણસાને સર્વ મિત્ર-મંડળીન મધ્યે નકળત આપલ્યા નાવાચા દબદ્વા નિર્માણ કેલા તો ખરચ વાખાણ્યાજોગા. ફક્ત મિત્ર-મંડળીચ નબે તર Learning Institute મધ્યે હી ત્યાંની આપલ્યા નાવાચી ભુરળ પાડલી તી આપલ્યા ચાંગલ્યા વાગળૂકીમુલે આણિ સુમધુર બોલીમુલે.


૩૮ વર્ષે વય મ્હણજે આમચ્યા પેક્શા જવલપાસ ૧૦ વર્ષાંની મોઠા મનુષ્ય આતા ત્યાંચ્યા બરોબર કસ જમવાયચ્ચ ? પણ હ્યા પ્રશ્ન દેખીલ ત્યાંની સ્વતઃચ સોડવલા....તે આમચ્યા બરોબર વય વિસરૂન અગદી આમચ્યાતીલ એક હોઊન વાવરુ લાગલે.

હલ્લુ હલ્લુ આમચા મિત્ર પરિવાર વાઢત ગેલા આણિ ગુપ ચે નામકરણ જ્ઞાલે *SMU-MBA Rockers.*

કોણી કથી ત્યાંચ્યા ખાજગી આયુષ્યાત ડોકાવૂન પાહિલાં નાહી.

આઈચે છ્વત્ત હરવલેલે આણિ ઘરાત ફક્ત વૃદ્ધ વડીલ આણિ ત્યાચ્યા દેખભાલીસાઠી વાહૂન ઘેતલેલાં જીવન મ્હણજે થોડક્યાત ગુરુંચે ખાજગી આયુષ્ય.

કોણાલાહી કથી અભ્યાસાસાઠી, ખાજગી અથવા આર્થિક કાહી મદત લાગલી કિ ગુરુ ત્યા માણસાસાઠી આપલી સર્વ હાતાતલી કામ સોઢૂન તત્પર હજર. MBA ચ્યા Assignment અસો અથવા Final Project. .મદતીલા હજર કોણ અસણાર ? તર ફક્ત એકચ માણૂસ મ્હણજે ગુરુ. મગ સ્વતઃચ અભ્યાસ બાજૂલા રાહિલા તરી ચાલેલ પણ ગુરુને કથીચ કોણાલા નાહી મ્હણૂન મ્હટલાં નાહી. આણિ નાવાપ્રમાણેચ તે ખચ્યા અર્થાને ગુરુ જ્ઞાલે આણિ શિક્ષક નસૂનહી પર્યાયાને આમ્હા સર્વ મિત્ર-મંડળીચે જ્ઞાલે “ગુરુજી”.



અર્थત ચ ૨ સેમીસ્ટર નંતર બહુતેક મિત્રાંની વેગવેગળે સ્પેશલાયઝેશન નિવડલે પણ સ્વતઃચે સ્પેશલાયઝેશન IT અસ્તાના સુધા Finance, SCM આણિ HR વાલ્યાંના સુધા મદત કરાયલા હે મનુષ્ય પુઢેચ. .કાય મ્હણાવ યાલા દેવાને દિલેલી દેણગી કી આમચી પૂર્વાશ્રમીચી પુણ્યાઈ ? ત્યામુલે આતા ત્યાંચી ટંગલાઈનચ ઝાલીય “ભટકો ચાહે જિધર, કામ હોગા ઇધર”

અર્થત ચ ભરપૂર લોકાંકડૂન ત્યાંના કામાપુરતા મામા અસા અનુભવ દેખીલ આલાચ પણ ત્યાત હી ત્યાંની અશ્યા લોકાંના લાંબ કેલ નાહી તર નિસ્વાર્થી પણે ત્યાંના પુન્હા પુન્હા મદત કરત રાહ્લે.

આમ્હી MBA ચા હા મહાકાય ડૉંગર ત્યાંચાચમુલે સર કરું શકલો હ્યાત વાદચ નાહી...આજકાલચ્યા દુનિયેમધ્યે સમોરચ્યાચા ઘાસ ખાણારે લોક ભરપૂર ભેટીલ પણ આપલ્યા તાટાતીલ સંપૂર્ણ ઘાસ દુસ્યાંના દેણારે ફારચ કમી આણિ ત્યાચ પંગતીત વિરાજમાન ઝાલેત “ગુરુજી”.

આજકાલચ્યા કાળાત શિક્ષકાંપેક્ષા હી જાસ્ત શિક્ષવલ તે આમચ્યા ગુરુજીંની. .ત્યામુલે વાકીચ્યા ગુરુંપ્રમાળે ફક્ત પ્રવચન ન દેતા આમચ્યા ગુરુ વાકેકરાંની આમ્હાલા માણસકી શિક્ષવલી જી આમચ્યા ભાવી આયુષ્યાત નક્કીચ કામી યેર્઱ેલ.

આતા હ્યા લેખાવરુન હી તે મલા ખડસાવણાર હ્યાત વાદચ નાહી પણ ત્યાંચાસાઠી હા લેખ મ્હણજે ત્યાંના દિલેલી ખરી દિવાળી ભેટ.

અસા સખા આણિ ખરા ગુરુ સર્વાનાચ મિલો.

આણિ આમચ્યા ગુરુજીંના દેવ ઉદંડ આયુષ્ય દેવો....હીચ ઈશ્વરચરણી પ્રાર્થના.

સિદ્ધેશ ભરત શિરવાડકર ...

## ◎ હરવલેલં બાલપણ - A Sigh Of A Prodigy

હુશારી , બુદ્ધીમત્તા , વિદ્વત્તા મ્હણજે કેવળ શૈક્ષણિક પ્રામાણ્યાવર ઠરવલ્યા જાઊ શકતાત અસા એકંદરીતચ જનમાનસાત અસણારા એકાંગી ગૈરસમજ હોય . માઝ્યા મતે તરી પુસ્તકી જ્ઞાનાપેક્ષા પ્રત્યક્ષદર્શી અનુભવ નેહમીચ ઉપયોગી ઠરતાત . અશા કાળ્યા માતીત શિકૂન મોઠા જ્ઞાલેલો મી શહરાત કામ કરુન અજૂન ચાંગલે અનુભવ ગાઠીલા યેતીલ આણ માઝ્યા ગાવાતલ્યા વિદ્યાર્થ્યાના માઝ્યા અનુભવાંચા મી જેવ્હા પરતેન તેવ્હા ફાયદા હોઈલ હ્યાચ વિચારાને શહરાત પાઊલ ટાકલે . મગ દૈવ બલવત્તર હોતે મ્હણૂન કિંવા પુઢ્યા ઘટનાંના મલા સાક્ષીદાર વ્હાયચે હોતે મ્હણૂન અસેલ કદાચિત મી લવકરચ શહરાતલ્યા એકા નામાંકિત શાલેત પ્રાથમિક વિભાગાત વિજ્ઞાન વિષયાચા પ્રાધ્યાપક મ્હણૂન રૂજૂ જ્ઞાલો .

શહરાતલી તી શાલા આણ માઝ્યા ગાવાતલી તી માઝી શાલા હ્યાંચ્યાત 'ઇંડિયા' વ 'ભારત' ઇતકં અંતર હોતાં . એકદમચ વેગળં વાતાવરણ ... કાહીસં સ્વૈર આણ સ્વચ્છંદીચ !! માઝ્યા હ્યા નવ્યા શાલેત અભ્યાસક્રમા બરોબરચ અજૂન ઢીગભર ઇતર ઉપક્રમહી હોતે . મુલાંચા સર્વાગીણ ગુણાંના વાવ દેણારે અસે અનેક ચાંગલે ઉપક્રમ હ્યાત મી પાહિલે . આધી વાટલં કી એકા વેગળ્યા વાતાવરણાતૂન આલ્યામુલે કદાચિત હે સગલે અગદી નવખે વાટત અસાવે . મી સ્વતઃશીચ હસલો . માઝ્યા સભોવતાલચ્યા સહાધ્યાપક આણ ઇતરાંચી કુત્સિત નજર મલા જાણવત હોતી . મલા હ્યા સગલ્યાત સામાવૂન જાયચે હોતે ... આપલા એક ઠસા ઉમટવિણ્યાસાઠી !!

હ્યા શહરી શાલેતલે વાતાવરણ મલા સોનેરી પિંજ-યાસારખે વાટાયચે . ચમચમણારે પણ તરીહી બંદિસ્ત ... ઇથે જવલપાસ ૩૦ 'હાયલી સ્પેશલાઇઝડ' મુલાંચા એક સ્વતંત્ર અસા વર્ગ હોતા . પ્રાધ્યાપકાંચ્યા મતે હી મુલે મ્હણજે કાહીતરી દેવદત્ત દેગણી લાભલેલી અસૂન ત્યાંચ્યા ગુણાંના જ્ઞાલી દેણ્યાસાઠી ત્યાંના અધિકાધિક કઠીણ તયારીચી આવશ્યકતા આહે . મલાહી આધી અસા ઉપક્રમ સ્વાગતાર્હ વાટલા કી જ્યામુલે લહાન વયાપાસૂનચ મુલાંચા વ્યક્તિમત્વાલા ચાંગલી ઘડણ મિળત જાઈલ . હ્યા વર્ગાતીલ એક વિદ્યાર્થી સ્વરૂપ માઝ્યાસાઠી એક ન સુટલેલં કોડંચ હોતા . તસં મલા ઇથે યેઉન ફારસા કાળ લોટલા નબહતા ત્યામુલે મુલાંબદ્દલ ફારશી માહિતીહી નબહતી . સ્વરૂપ હા ૪૪્યા ઇયત્તેત શિકણારા એક વિદ્યાર્થી . વર્ગાત નેહમી પહિલ્યા ૩ મધ્યે ક્રમાંક આણ વિજ્ઞાનાત તર કથીચ સ્વારી ૮૦ ચ્યા ખાલી આલી નબહતી . સ્વરૂપલા ગળિતાત બરીચ ગતી હોતી . કઠીણાતલે કઠીણ ગળિત તો બોટાંવર સોડવત અસે . શાલેત ત્યાલા 'મિની abacus' મ્હણૂનચ ઓળખલં જાત અસે . અશા પ્રકારચી પ્રગલ્ભ બુદ્ધીમત્તા ઇતક્યા લહાન વાયાત મીહી પહિલી નબહતી . પરંતુ હા મુલગા વર્ગાત નેહમીચ ઘુમ્યાસારખા રાહાયચા . આજપર્યંત મી ત્યાલા કથી હસતાના બધિતલં નાહી . કથી ત્યાલા મિત્રાંબરોબર ખેળતાના બધિતલં નાહી . કથી કાહી પ્રશ્ન વિચારલે તર એકસુરી ઉત્તર દ્યાયચા જસા કિ રટ્ટુ પોપટ ... મધ્યલી સુદૃટી હી હ્યા વયાતલ્યા મુલાંસાઠી કિતી વડીચી અસતે . પણ તેવ્હાહી સ્વરૂપ ખિડકીત બસૂન કુઠેતરી શૂન્યાત બધત બસાયચા ... એકટક ... શૂન્યવત !!

ન રાહવૂન મી સ્વરૂપશી બોલાયચા પ્રયત્ન કેલા . સ્વરૂપ મલા કસલીચ દાદ લાગુ દેત નબહતા . માઝ્યા ઇતર સહાધ્યાપકાંના વિચારલે તર તે મ્હણાયચે કી હા સ્પેશલ વર્ગાતીલ મુલગા ના ! તે સગલે અસેચ અસતાત . થોડક્યાત કાય તર સગલ્યાંચ્યા મતે સ્વરૂપચે અસે વાગણે ઠીકચ હોતે . કેવળ ૮-૧૦ વર્ષાંચ્યા ત્યા કોવલ્યા જીવાચં કરપૂન ચાલલેલં બાલપણ બધતાના માઝ્યા કાલજાત ચર્ચ ઉઠાયચં . શેવટી ઠરવલં આણ સરળ ત્યાંચ્યા ઘરી ગેલો . સ્વરૂપચે વડીલ મ્હણજે ઉદ્યોગપતી હોતે . લક્ષ્મી ત્યાંચ્યા ઘરી સુખાને નાંદત અસલેલી મલા દિસલી . કુતૂહલ મ્હણૂન મી સ્વરૂપચ્યા ખોલીત ડોકાવલો . એકા ૧૦ વર્ષાંચ્યા મુલાચી ખોલી ગળિત - વિજ્ઞાનાચ્યા અનેકવિધ આણ કદાચિત કિલષ્ટ પુસ્તકાંની ભરલેલી દિસલી . આશ્ર્ય મ્હણજે ત્યાત ગોટીચી કિના ઇતર કાહી કરમણુકીચી કાહીચ સાધને નબહતી . સ્વરૂપચ્યા અશા એકસુરી વાગણ્યાચે રહ્યસ્ય આતા કુઠે મલા ઉલઘડુ લાગલે . મી માઝ્યા મનાતલ્યા શંકા , પ્રશ્ન ત્યાંચ્યા વડલાંકડે બોલુન દાખવલ્યા તેવ્હા તેહી માઝ્યાકડે બધૂન હસલે . ત્યાંચ્યા મતે સ્વરૂપવર દેવી સરસ્વતીચા વરદહસ્ત હોતા . આણ ત્યાંચ ઘુમ્યાસારખં વાગણ , શૂન્યાત એકટક બધત રાહણ ત્યાંના મોટ્ટ્યા વિચારવંતાંચી લક્ષણે વાટાયચી . ત્યાંચ્યા અશા બોલણ્યાવર મી ક્ષીણસા હસલો આણ નિઘાલો . નિઘતાના સહજ બધિતલં તેવ્હા સ્વરૂપચી લહાનખુરી મૂર્તી કિંચિત ડોલે ભરલ્યાસારખી દિસલી .

કાહી દિવસાંની સ્વરૂપ સ્વતઃહનચ માઝ્યાજવલ આલા . ત્યાંચ્યા મૌનાત બરંચ કાહી લપલેલં હોતાં . બરાચ વેલ તો કાહીચ બોલલા નાહી . અનેકદા શાંતતેલા આવાજ અસતો અસં મ્હણતાત . આણ અચાનક તો ઢસાઢસા રડૂ લાગલા . ઇતક્યા વર્ષાંચા રાગ , ત્રાગ , અસંતોષ , ઘુસમટ , આક્રંદન સારં કાહી બાહેર પડત હોતાં . મી ત્યાલા શાંત હોઉ દિલાં . સ્વરૂપ બોલું લાગલા , "સર , ધન્યવાદ સર ! ખરંચ મનાપાસૂન ધન્યવાદ ... માઝા કોણીતરી વિચાર કેલા ; માઝા માણૂસ મ્હણૂન કોણીતરી સ્વીકાર કેલા . નાહીતરી મી મ્હણજે ફક્ત અબેકસચ બનૂન રાહિલેલો !! ખરં સાંગુ

સર , મલા કોણી માઝ્યા હુશારી બદ્લ વાહવા કેલી કી મલા સ્વતઃચીચ કીવ વાટતે . મલા હેવા વાટતો બાકીચ્યા મુલાંચા ! સાધારણ અસણે કિતી મસ્ત અસતે ના હો ! કસલા ત્રાસ નાહી . કસલાચ ભાર નાહી . કોણાચ્યાહી અપેક્ષાન્ચ ઓઝાં નાહી . સારં કસં મુક્ત , આનંદી જગાયં . હ્યા બુદ્ધિમત્તેચ્યા અભિશાપાને મલા અકાલી પ્રૌઢચ બનવલં આહે બધા ના !! જ્યા વયાત મલા કવિતા બોલાયલા હવ્યા ત્યાત મી તુમચ્યાશી ઇતક્યા અવઘડ ભાષેત બોલતોય . સર , મલાહ્યી સર્વસાધારણ જગાયં ... મિત્રાંસોબત ખેળાયં ; સારં ખૂપ ઉપભોગાયં આહે . મલા અસં કથી જમેલ કી નાહી દેવચ જાણે ! પણ મલા એકદા તરી શ્વાસ ભરુન ઘ્યાયચાય . અસો , મનાપાસૂન ધન્યવાદ સર , માઝાં એકૂન ઘેતલંત . મલાહ્યી નિધાયલા હવં આતા . બાબાંની ગળિતાચા નવા સેટ આણલાય તો સોડવાયલા ... "

આજ સ્વરૂપ પહિલ્યાંદાચ ઇતકં બોલત હોતા . ખરંચ અશા વેઠી સાધારણ હોણેચ ચાંગલે નાહી કા ? આજ અસે સ્વરૂપ આપલ્યાલા અનેક પાહાયલા મિઠત આહેત . મગ તે પાલકાંચ્યા અતિ મહત્વાકાંશેપાયી અસો કિંવા વાઢત્યા અવાસ્તવ સ્પર્ધેપોટી ... હુશાર અસણે ચુકીચે નાહી પણ ત્યાપાયી ત્યા લહાનગ્યા જીવાંચા આનંદ , ત્યાંચં સોન્યાસારખં બાલપણ હિરાવૂન ઘેણે કિતપત યોગ્ય આહે ?? હ્યા અવાસ્તવ સ્પર્ધેચી ઝલ કોવળ્યા જીવાલા બસૂ નયે હ્યાચી કાળજી આપણં ઘ્યાયલા હવી . અસીમ બુદ્ધિમત્તેચે હે વરદાન શાપ ઠરું નયે હાચ પ્રયત્ન કરાવા ...

મયુરી... 

ડૉ. એસ. મોહન રાજ દ્વારા પ્રેરિત કથા

## ◎ પૂજેચે માનસશાસ્ત્ર

વાસ્તવિક પૂજા હે પરમાર્થચા સાધન આહે. પણ આજ તે સામાજિક મોટેપણ મિળવણ્યાચે, આપલે એશ્વર્ય જગાલા દાખવણ્યાચે સાધન ઝાલે આહે. કારણ ભક્તી પેદ્ધા મી ભક્તી કરતો હે જગાલા દાખવિણ્યાચી હૌસ આપલ્યાકડે માણસાલા ફાર અસતે ત્યાતૂન સાર્વજનિક પૂજા પ્રકાર ફોફાવલા. પૂજા કરતાંના ૧૬ ઉપચાર કરાવેત અસે સાંગિતલે આહે. તે ખાલીલપ્રમાણે.

શોડશૈપચાર પૂજા ----- શોડષ મહણજે સોળા --- સુરુવાતીલા સોળા ઉપચારાંચી માહિતી દેતો. નંતર ત્યા માગીલ માનસિકતેચા વિચાર કરુ.

૧ ધ્યાન -- મનાતીલ સર્વ ઇતર ઇચ્છા દૂર સારુન ધ્યેય વસ્તુચ્યા (આરાદધ્ય દેવતેચ્યા) ઠિકાણી તદ્દૂપ હોણે

૨ આવાહન -- પ્રતીકાત્મક મૂર્તીત સપરિવાર આયુધે વ શક્તીન્યાસહ યેઊન પ્રતિષ્ઠીત હોઊન પૂજન સ્વીકારે અશી પ્રાર્થના

૩ આસન -- બસાયલા આસનં દેઊન હાત ધ્વાયલા પાણી દેણે ત્યાચ બરોબર દુધ દહી મધ ગાન્દાક્ષતાપુશપ અર્પણ કરણે

૪ આચમનીય -- મુખાપ્રક્ષયાલન યાસાઠી કપૂર મિશ્રિત સુગંધી વ પવિત્ર પાણી દેતાત (વાપરતાત)

આજચ્યા કાળાત સાંગાયચે તર ફ્રેશ વ્હા

૫ સ્નાન વ અભિષેક -- સધ્યા પાણ્યાને સ્નાન નંતર પંચામૃત સ્નાન મગ ઉણોદક સ્નાન મગ અભિષેક સુગંધી જલ તેલ ઉસાચા રસ વ દુધ યાંચા અભિષેક કરતાત.

૬ વસ્ત્ર - ઉપવસ્ત્ર -- દેવાલા વસ્ત્ર અર્પણ કરણે - દેણે.

૭ ગંધ - કપાલાલા ગંધ લાવણે

૮ અધ્યતા - હા મુખ્ય ઉપચાર નબે. પિંજર મિશ્રિત અખંડ તાંડુલાંના અખાતા મહણતાત. એખાદા ઉપચાર ઉપલબ્ધ નસેલ તર ત્યા એવજી અધ્યતા વાહતાત. અધ્યતા યા બાલ. સમૃદ્ધી વ આયુષ્ય દેણાન્યા આહેત. અસા સમજ આહે.

૯ કંકૂ -- પુરુષ દેવતેચે આવાહન કરતો તે સપત્રીક અસલ્યાને કંકૂ વાહાવે

૧૦ પુષ્પ -- સુગંધી વ ત્યા ત્યા દેવાલા આવડણારી ફુલે, દુર્વા, બેલ, તુલસ, પત્રી(હિ સર્વ ઔષધી વનસ્પતીનાંચી અસતે-- ત્યાચી માહિતી સુદ્ધા પુઢે દેણાર આહે), હે સર્વ દેવાલા અર્પણ કરાવે.

૧૩ ધૂપ -- ધૂપ હા સુગંધી અસતો પર્યાય મહણુન સુગંધી અગરવતી લાવાવી. ત્યામુલે માણસાચે મન પ્રસન્ન રાહતે.

૧૨ દીપ -- સ્વયંપ્રકાશિત વ દુસ્ન્યાલા પ્રકાશ દેણારા દિવા લાવાવા

૧૩ નૈવેદ્ય -- દેવાચ્યા આવડીચા પદાર્થ ત્યાલા અર્પણ કરણે - દેણે. તો દેવાચ્યા ઉજવ્યા હાતાજવળ ઠેવાવા .

૧૪ આરતી -- આર્તીક્ય સ્તુતી જયજયકાર હા દેવાચા કરાવા

૧૫ પ્રદક્ષિણા -- દેવાભોવતી દેવાલા ઉજવ્યા હાતાકડે ઠેઊન ગોલ ફેરી મારણે.

૧૬ પ્રાર્થના -- સર્વત મહત્વાચે - હે વર કેલેલે સર્વ ઉપચાર હે કશાસાઠી હે દેવાલા માહિત અસતેચ પણ હે પ્રાર્થના ઐકલ્યાવર તો તે હોર્સેસ માઉથ ઐકતો વ સ્મિત હાસ્ય કરત પ્રસન્નતેને આશીર્વાદ દેતો ----- વિચરાઆઆઆઆ

માગણે, વિનમ્ર હોણે, અનન્ય શરણાગત હોણે, દેવાપુઢે આપલે ઇષ્ટ અસેલ તે માગણે મહણજે પ્રાર્થના. આદર વ વિનવળી હે ભાવ અસતાત. જગાત ગુસ વ પ્રકટ અશા મહાન શક્તી વાવરતાત આપલે સામર્થ્ય તુલનેને કમી અસતે. મહણુન યા શક્તિની આપલ્યા કાર્યત વિન્ન આણ્ણ નયે, દેવાને આપલ્યા કાર્યસિદ્ધીસાઠી સહાય્ય કરાવે. અખિક બાલ દ્યાવે, આણિ કામ ક્રોદ્ધાંવર અંકુશ રાહુન બુદ્ધીચે સ્થૈન્ય વ માનસિક બલ વાઢાવે હિ અપેક્ષા પ્રાર્થને દ્વારા પૂર્ણ વ્હાવી હા પ્રાર્થનેચા હેતુ આહે આત્તાપર્યત આપણ નિવ્વળ માહિતી પહિલી આતા ત્યા માગચી માનસિકતા પાહૂયા.

આપલ્યાતીલ ગૈરસમજ કિંવા અર્ધવટ સમજ કાઢુન ટાકણ્યાસાઠી મહણુન ઇથે મલા ઇથે થોડી પ્રસ્તાવના કરણે આવશ્યક વાટતે. કારણ આપલ્યા પૂજે બદલચ્યા કલ્પના મી પુઢે દાખવુન દિલેલ્યા નક્કીચ નસાચ્યાત. સોપસ્કાર તેચ આહેત. હ્યાત નવીન કાહીચ નાહી. નવીન આહે તો દૃષ્ટીકોન. પ્રથમ પૂજા હિ ક્રિયા નેમકી કાય અસતે હ્યાચા વિચાર કરુ. વાસ્તવિક હે સર્વ આપલ્યાલા માહિત આહે. પણ અસે તુલનાત્મક વિચાર આપણ સહસા કરત નાહી. મહણુન હા પ્રપંચ. પૂજા કરતાંના ત્યાચા કાર્ય કારણ ભાવ આપલ્યાલા લક્ષ્યત યેત નાહી. પૂજા આપલ્યાપૈકી બરેચજણ રોજહી કરત અસતીલ. ત્યાતીલ મંત્ર આણિ તંત્ર બહુતેક જણાંના માહિત અસતીલ. અભાવ અસતો તો ભાવાચા.

પહિલા ઉપચાર ----- ધ્યાન---- ધ્યાન મહણટે કિ ધ્યાનાબદ્લ લોકાંચ્યા અવાસ્તવ કલ્પના આહેત. પણ હે ઇતકેહિ કઠીણ નાહી. આપલ્યા પૈકી બરેચજણ ધ્યાનાચા અનુભવ ઘેત અસતાત. પણ તે ધ્યાન આહે, હેચ આપલ્યાલા પૈકી બર્યાચ જણાંના માહિત નસતે. ધ્યાન મહણજે

એકાગ્રતા. એકાગ્રતેચ્યા      પાયાર્યપૈકી એક      પાયરી. અષ્ટાંગ યોગમાદ્ધ્યે હ્યાચે સ્પષ્ટ ઉત્તર આહે      ધ્યાન, આણ આણિ સમાધી  
 હ્યા અષ્ટાંગ યોગાચ્યા શેવટચ્યા તીન પાયરયા આહેત.----- ત્યા સર્વ મનાચ્યા એકાગ્રતેચે કાલમાપન આહે ===== સુમારે  
 ૧૨ સેકંદ એખાદ્યા ગોટીવર આપલે મન એકાગ્ર હોળે મ્હણજે ----- એક ધ્યાન ----- ૬ વી પાયરી  
 ૧૨ ધ્યાન મ્હણજેચ ૧૪૪ સેકંદ આપલે મન એકગ્ર હોળે મ્હણજે ----- એક ધ્યાન ----- ૭ વી પાયરી  
 સર્વસામાન્ય માણ્ણસ જેવ્હા આપલે શિક્ષણ ઘેતાંના મનાપાસુન અભ્યાસ કરતો તેવ્હા ત્યા પ્રત્યેકાલા આપલ્યા મનાચ્યા એકાગ્રતેચા હા અનુભવ  
 યેતચ      અસતો.      હ્યાચ પરમાર્થચ્યા અભ્યાસાલાચ આપણ સાધના મ્હણતો ઇતકેચ. હ્યા      વરુનચ આપલ્યાલા  
 માણસાચ્યા યશાપયશાચે રહસ્ય કળેલ.

આપલે મન જિતકે લવકર વ અધિક કાળ એકાગ્ર હોઈલ તિતકે યશ નિશ્ચિત. આપણ પાહતોચ કી સારખાચ વેલ કિટ્યેક વેલા જાસ્ત વેલ  
 અભ્યાસ કરણાન્યા મુલાલાહી કમી માર્ક મિળતાત કારણ હેચ કી      તો જરી જાસ્ત કાળ      વાચત બસલા અસેલ તરી ત્યાચે મન      તિતકે  
 (ઇતસ્તત: ન જાતા) અભ્યાસાત એકાગ્ર હોત નાહી. લૌકીદૃષ્ટ્યા સમાધી મ્હટલે મ્હણજે કાહીતરી અતક્રય અનપેક્ષિત ચમત્કાર નિર્માણ કરણારે  
 વગૈરે આપલ્યા ડોક્યાસમોર યેતે. વાસ્તવિક તે સર્વસ્વી ખરે નાહી. હા હે માત્ર ખરે હ્યા સમાધીચ્યા ૩-૪ પાયરયા આહેત ત્યાતીલ સુરવાતીચ્યા  
 અગદીચ કઠીણ નાહીત તરીહી જોપર્યત એખાદ્યાચી તયારી હોત નાહી તો પર્યત ત્યાલા ત્યા સમજૂ શકણારચ નાહીત પુઢ્યા  
 તર રાજયોગાચ્યા ફાર વરચ્યા આહેત. ડોંગર ચઢતાંના જસે સુરુવાતીલા ચઢાવ કમી અસતો. પુછે પુછે તો વાઢત જાતો. શેવટી સુળ્ળકા ઘોરપડી  
 સાખા ચઢાવા લાગતો. તસેચ હે આહે.

એકાગ્રતા હિ ક્રિયા માણસાચ્યા દેહાત પ્રેમાને અધિક ચટકન ઘડૂ શકતે હે વાસ્તવ આહે. તેચ પ્રેમ ઇથે ઈશ્વરાવર કરાયચે હ્યા પ્રેમાલાચ આપણ  
 ભક્તિ મ્હણતો. મ્હણૂન ભક્તિ હિ સામાજ્યાંસાઠી (મ્હણજેચ મેજોરીટી સાઠી) સોંપી આહે હ્યાત વાદ નાહી.

૨ આવાહન ૩ આસન ૪ આચમનીય ૫ સ્નાન વ અભિષેક. ૬ વર્ષ - ઉપવર્ષ ૭ ગંધ ૮ અખ્ષતા ૯ કુંકુ ૧૦ પુષ્પ ૧૩ ધૂપ ૧૨ દીપ ૧૩ નૈવેદ્ય.  
 હ્યા સર્વ

ઉપચારાંચ્યા બાવત જ્યા ગોટી દિલ્યા આહેત ત્યાચ આપણ આપલ્યા પ્રિય વ્યક્તિસાઠી નેહમી સહજ પણ કરત અસતો. ત્યાચ ગોટી આપણ  
 દેવાસાઠી કરાયચ્યા. કારણ તે કરણે આપલ્યાલા સોપે અસતે. ત્યાચે વિશ્લેષણ દિલે આહે, હ્યાત સ્વાગત, આદર, વ યેણારી વ્યક્તિ પ્રસન્ન  
 રાહણ્યાસાઠી જે જે કરયચે તે સર્વ ઉપચાર યેતાત.

આપલ્યા રોજચ્યા વ્યવહારાત      આપણ      પાહતો      આપલ્યાકડે આપલ્યા      આવડીચી વ્યક્તિ યેણાર અસેલ      વ  
 ત્યાંચ્યા આગમનાચી આપલ્યાલા આધી કલ્પના અસેલ તર આપણ કાય કરતો? આપણ આપલ્યા પ્રિય વ્યક્તીલા બોલાવતો ---- આવાહન કરતો  
 આપલી      પ્રિય વ્યક્તિ આલી      કિ તિલા યા બસા મ્હણતો આસન દેતો મ્હણજે ખુર્ચી સોફા પલંગ વગૈરે યાવર બસાયલા સાંગતો ---  
 અસન દેતો. તિલા ગુલ-પાણી દેતો --- આચમન

યેણારી વ્યક્તિ આલ્યાવર કિંબા તી વ્યક્તિ યેણ્ણા પૂર્વી સુદ્ધા તિચ્યા સાઠી કાય કાય કરાયચે? ત્યાચા વિચાર સુરુ હોતો.  
 ત્યાસાઠી ત્યા વ્યક્તીચ્યા આવડીનિવડી પ્રમાણે પદાર્થ કરાયચે ઠરતાત. મગ અર્થાત્ચ ત્યા પ્રમાણે આવશ્યક તી ખરેદી સુરુ હોતે. તિચ્યા  
 આવડીચે ખાગે. ત્યાલા અર્પણ કરાયચી (પ્રેઝેંટ દ્યાયચી) વસ્તુ, હ્યા સર્વાંચી નિવડ હોતે. હિ સર્વ પ્રક્રિયા ઘડત અસતાંના, સહજચ આપલ્યાલા ત્યા  
 વ્યક્તીચે સતત ચિંતન ઘડત અસતે. કારણ હે સર્વ આપણ ત્યાંચ્યાસાઠી કરત અસતો. હા માનવી સ્વભાવાચા સહજભાવ આહે. આપણ હે સર્વ ત્યા  
 વ્યક્તિસાઠી કરત આહોત હે ભાન માણસાચ્યા મનાત સતત અસતે. મ્હણજેચ મ્હણજેચ પર્યાયાને હ્યા ભાનાતુંચ ત્યાચે ધ્યાનહિ ઘડતે. તી વ્યક્તિ  
 આલ્યાવર આપણ તિલા બસાયલા સાંગતો, આસન દેતો. બાહેરુન આલ્યાવરોબર ગુલ-પાણી દેતો, (આચમન). સ્નાન - હે તી વ્યક્તિ ઘરી રાહણાર  
 અસેલ તર ઘડતેચ. તે સ્નાન માત્ર આપણ ત્યા વ્યક્તીલા ઘાલત નાહી. પણ મલા આઠવતે મી લહાન અસતાંના, આમચ્યા ચાલીતીલ એકા ઘરી, મલા,  
 દર વર્ષી આષાઢી એકાદશીચ્યા નંતરચ્યા દ્વાદશીલા, બ્રાહ્મણ મ્હણૂન બોલાવત અસત. તેવ્હા મલા તે અંધોલ સુદ્ધા ઘાલીત. અર્થાત મી ત્યા વેલી  
 સહા-સાત વર્ષ્યાંચા અસેન. વર્ષ-ઉપવર્ષ - આપણહી ઘરી આલેલ્યાલા આપાપલ્યા એપતીપ્રમાણે વ નાત્યા પ્રમાણે કાહી ના કાહીતરી દેતો. ત્યા  
 કાળી વર્ષ દ્યાવયાચી પદ્ધત હોતી. આતા ગંધ, અખ્ષતા, કુંકુ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, પ્રદક્ષિણા, આણ પ્રાર્થના હે માત્ર આપણ ફક્ત  
 દેવાસાઠી અર્પણ કરતો. પણ આપલ્યા ઘરી યેણારી સ્ત્રી અસેલ તર કુંકુ, ફુલ, હે આપણ ત્યાંનાહિ દેતો. યેણાંચા વ્યક્તીલા  
 આપણ ત્યાંચા આવડીચે ખાળ્યાંચે પદાર્થ કરતો. તોચ દેવાસાઠી નૈવેદ્ય અસે આપણ મ્હણત અસતો. અશ્યા રીતિને પૂજા ક્રિયેચા તૌલનિક વિચાર  
 કેલા તર હે સર્વ આપણ આપલ્યા પ્રિય વ્યક્તિસાઠી કરત અસતો. હેચ પ્રેમ વ હાચ પ્રેમયોગ. ત્યા પ્રિય વ્યક્તીચ્યા ઠિકાણી દેવ ઠેવલા, કી ત્યાચ  
 ક્રીયેલા આપણ પૂજા મ્હણતો. હીચ ભક્તિ આણ હાચ ભક્તિયોગ હોય. હ્યા વરુન પૂજા કરતો મ્હણજે નેમકે કાય કરતો તે આતા આપલ્યાલા

નન્કી લક્ષ્યાત યેઈલ. પૂજા મ્હણજે યથાસાંગ સ્વાગત, આદર, સત્કાર, કौતુક, પ્રેમાચે આપલ્યા પરીને કેલેલે પ્રકટીકરણ, આપલ્યા પ્રિય વ્યક્તિલા/દેવાલા પ્રસન્ન ઠેવણ્યાસાઠી કેલેલી એક પ્રક્રિયા. હે સર્વકાહી હ્યાત યેતે. હા જ્ઞાલા પૂજા ક્રિયેચા ઉહાપોહ.

હ્યાવરુન આપલ્યા હે હિ લક્ષ્યાત યેઈલ કિ પ્રત્યક્ષ વ્યક્તિ કિંવા દેવ જરી આપલ્યાકડે એક દોન દિવસ યેણાર અસેલ તરી ત્યાચ્યા પૂર્વ તયારી પાસુન ત્યાચે ચિંતન ઘડતે ધ્યાન ઘડતે માનસિક સહવાસ ઘડતો. અસે મનાપાસુન વાગણાન્યાચ્યા ઘરી જાણ્યાચા યોગ આપલ્યાલા આલા તર, આપલ્યાલા મી અનુભવાને સાંગતો, ત્યા ભાવનેચી જાણીવ આપલ્યાલાહી હોતે, વ તીવ્ચ ક્રિયા વરવરચી અસલ્યાસ ત્યાચીહી જાણીવ નન્કી આપલ્યાલા હોતે. દેવ તર ભાવાચા ભુકેલેલા આહે. મગ વાહ્ય ઉપચારાપેક્ષા આપુલકી વ માનસિક પ્રેમ કિંતુ મહત્વાચે આહે તે આપલ્યા લક્ષ્યાત યેઈલ. આપલ્યા રોજચ્યા જીવનાચ્યા રહાટઇશી પુજેચી તુલના કેલ્યાને આપલ્યા સર્વાચ્યા હે હિ લક્ષ્યાત યેઈલ, કિ આપણ જેવ્હા પૂજા કરતો, તેવ્હા નેમકે કાય કરતો? હ્યાચી યોગ્ય તી કલ્પના યેઈલ. હા વિષય બરાચ ખોલ આહે. આતા પૂજેતીલ પ્રત્યેક ઉપચારાચા ઉહાપોહ કરું

દેવ હ્યા ભાવનેતૂન જે કાહી વેગળે આહે. ત્યા પુઢીલ તીન પ્રકારચ્યા ઉપચારાંબદ્દ પુઢે સાવિસ્તર લિહિણાર આહે. હ્યાચે કારણ હે ઉપચાર પૂજેચ્યા માનસશાસ્ત્રાશી નિગડીત આહેત. અર્થાત હે હિ લક્ષ્યાત ઠેવાયલા હવે, હે સર્વ આપણ આપલ્યા પ્રિય વ્યક્તિસાઠી આચરણાત આણત અસતોચ. ત્યાચ માનવી સહજ સ્વભાવાચા વિચાર પૂજેચ્યા ઉપચારાત, અભ્યાસક્રમ મ્હણું કેલા ગેલા આહે

૧૪ આરતી -- આરતી મ્હણજે સ્તુતી. માણૂસ કિંતીહી રાગાવેલા અસો તો સ્તુતીય આહેચ આહે. ભલે ભલે સ્તુતીલા ભુલતાત. દેવ તર ભાવાચા ભુકેલેલા આહે, અસે આપણ મ્હણતો. ત્યામુલે ત્યાચી સ્તુતીહિ તિતકીચ મહત્વાચી આહે. સ્તુતી આપણચ કરતો. પણ માણૂસ મોઠ્યાંદા (મ્હજે સર્વાના એક જાઈલ અસે જરાસે ઓરડૂન) બોલતો, તેવ્હા, મનાત એક વ બાહેર એક હે રાહત નાહી મ્હણુંનચ દેવાચી હિ સ્તુતી મોઠ્યાંદા કરાયચી અસતે. હા અનુભવ આપલ્યા સર્વાના અસેલચ કિંવા યેઈલ.

૧૫ પ્રદક્ષિણા ----- પ્રીયાતામાભોવતી પ્રિયકર / પ્રેયસી સહજચ ઘોટાળત રાહતાતચ સહજ સ્વભાવ તસે દેવા ભોવતી ફિરત રાહાયલા હવે તેવ્હા ત્યાચ્યા જવળ માનાને જાત યેતે. ગોન્દાવેલેકર મહારાજાંની પ્રપાન્ચ્યત રાહુન નિષ્કામ કર્મ યોગ કસા સાધાલ યાચે ઉત્તર દેતાંના સાંગિતલે કિ જાત્યાચે દોન દગડ અસતાત ત્યાતીલ એક સ્થિર વ એક ફિરતા અસતો મ્હણુંનચ સંસારાચે પીઠ દલ્લે જાતે પણ મહત્વાચે હે આહે કિ મન હે ત્યા ખાલચ્યા સ્થિર દગડાસારખે પાહિજે આણ શરીર સંસારાસાઠી ફિરલે પાહિજે મ્હણજે પરમાર્થાચે પીઠ ચાંગલે દલ્લે જાતે આપલે ઉલટે આહે મન ભિર ભિર ફિરતે આણ શરીર સ્થિર બસતે હા આળસ યોગ હોતો હ્યાચ્યા અર્થ દેહ ત્યાચ્યા ભોવતી ફિરવાયચા કસા તર મન ત્યાચ્યા રૂદાયાવર કેંદ્રસ્થાની સ્થિર ઠેવુન મ્હણજે પરમાર્થ સાધતો. આપલા દેહ દેવાભાવતી ફિરતો પણ મન અકબ્યા જગભર ફિરતે ત્યાચે કાય ઉત્તર પુન: પુન્હા પ્રયત્ન હ્યાચેચ નાવ અભ્યાસ આણ હ્યાચેચ નાવ સાધના મલા આધી વાટલે હોતે કિ તિન્હીહી એકા દિવસાત દેતા યેઈલ પણ તે શક્ય નાહી મ્હણ પ્રાર્થના વ અભિષેક હ્યાંચી માનસં પ્રક્રિયા ઉદ્યા દેતો.

૧૬ પ્રાર્થના ----- પ્રાર્થના, વિનંતી, અર્જ, સ્વતઃચી અગતિકતા, હ્યા સર્વાતૂન જે કાહી શબ્દરૂપ ઘેવૂન પ્રકટ હોતે, તી આણ તીવ્ચ ખરી પ્રાર્થના. પાઠ કરુન મ્હણતો તી પ્રાર્થનાચ નહ્વે. એખાદે શાસ્ત્ર મ્હણું જ્યા વેલી લિહિલે જાતે, ત્યાવેલી ત્યાત મૂળ વસ્તુસ લાગણારે સર્વ સાહિત્ય દિલે જાતે.      ત્યાનુસાર ઉપચારાંબરોબર, નિરન્નિરાલ્યા      લોકાંની લિહિલેલ્યા આરત્યા,      સ્તુતીપર વચને, આણ      પ્રાર્થના સુદ્ધા, દિલ્યા જાતાત .ત્યાચ પ્રમાણે, પ્રથેલા અનુસરુન, પૂજેબરોબર ત્યા દેવાલા કોણતી વ કશી પ્રાર્થના કરાવયાચી? તે હે દિલેલે અસતે. હે કા દિલેલે અસતે? કારણ પ્રાર્થના થોડક્યાત પણ પરિપૂર્ણ ક્વાબી. આવાહનન ન જાનામિ, ન જાનામિ કદાચન, હે પ્રાર્થના આપલ્યા સર્વાનાચ માહિત આહે. ત્યાચા ભાવાર્થ જર પહ્લિલ તર અસે લક્ષ્યાત યેઈલ, કિ, સર્વ કરુનહી મલા હે કસે કરાયચે તે નીટ મહિત નાહી, અસ આપણ મ્હણતો. કારણ તો ઈશ્વર ઇતકા સૂક્ષ્મ આહે. કિ તિથે અશુભ, અપવિત્ર, અશુદ્ધ, અપૂર્ણ, પોહોચૂચ શકત નાહી. હ્યાચી મલા પૂર્ણપણે જાણીવ આહે. કારણ ભૌતિક આણ ભૌતિકાતીલ વસ્તુ વાપરુન કેલેલી કોણતીચ પ્રક્રિયા, તુદ્યાપર્યંત પોહોચૂ શકત નાહી. માઝી બુદ્ધી મર્યાદિત આહે, હ્યાચી મલા જાણીવ આહે. તરીહી મી મલા સ્વતઃલા મલા સુચેલ ત્યા પ્રમાણે મી સ્વતઃલા, તુલા અર્પણ કરત આહે. હા ત્યા પ્રાર્થનેચા આશય આહે. પણ ખર સાંગુ કા માણૂસ ખરોખર લીન જ્ઞાલા, કિ, ત્યાચ્યા તોંડાતૂન સહજચ યોગ્ય શબ્દરચના યેતે, તીવ્ચ ખરી ત્યાચી પ્રાર્થના હોય. અનન્ય ભાવ મ્હણજે, ત્યા ભગવંતાચ્યા પ્રસ્તીખેરીજ દુસરે કાહીહી ન માગણે કિંવા દિલેસ તરી ઠીક નાહી દિલેસ તરી ઠીક તૂ ઠેવશીલ તસા મી રાહીન, હા ભાવ, કાયમ સ્વરૂપી નિર્માણ હોણે. હ્યા પુજેચી ખરી સાંગતા આહે. પૂજા આણ ત્યા માગચે માનસશાસ્ત્ર હા ભાગ આજ પુરા જ્ઞાલા. સમારોપ અભિષેકાની કરુ મ્હણજેચ અભિષેકામાગાચે માનસશાસ્ત્ર. સ્ત્રાન આણ અભિષેક કાહીજણ એકચ માનતાત. કાહી વેગળે માનતાત. સ્ત્રાનચા વિચાર પૂર્વી જ્ઞાલા આહે. તી ક્રિયા માનવી સ્ત્રાનપ્રમાણેચ આહે. અભિષેક કસા કરતાત હે આપલ્યા સર્વાના માહિત આહેચ. દેવાચ્યા મસ્તકાવર અભિષેક      પત્રાને      શુદ્ધોદાકાચી/દુધાચી સંતત ધાર સુરુ      ઠેતાત. ત્યા      વેલી બર્યાચ વેલા દેવાચે સ્તોત્ર મ્હણતાત, કિંવા ત્યા ત્યા દેવાચી વિવિધ નામ ઘેતાત. હ્યા માગચી ભૂમિકા અશી આહે માણસાચે મન ત્યા અભિષેક

પત્રાતીલ પાણ્યાચ્યા ધારેસારખે અખંડ, ત્યા ભગવંતાકડેચ રાહો. લાકૂડ, ધ્યાતૂ, વગૈરે વસ્તુ એકસંધ અસતાત. પણ પાણી કથીચ એકસંધ નસતે. કારણ તે પ્રવાહી આહे. માણસાચે મનહી પાણ્યાપ્રમાળેચ પ્રવાહી આહે. ત્યામુલે તે અખંડ ભગવંતાકડે કસે લાવા? તર ત્યા અભિષેક પત્રાતૂન યેણાંયા પાણ્યાચ્યા અખંડ ધારેસારખે. નિબ્બલ મનાચે કેંદ્રીકરણ, હિ ક્રિયા રાજાયોગાત સવિસ્તર વર્ણિલેલી આહે. મનાચ્યા સંપૂર્ણ કેંદ્રીકારણાચા અભ્યાસ કરાવા લાગતો. તી ક્રિયા સર્વસામાન્યાંના મ્હણજે વિશેષત: સંસારિકાંના કઠીણ અસતે, ત્યાસાઠી આણિ પૂજે મદ્દ્યે બદ્ધયું સાધને અસતાતચ. ત્યા પૈકીચ હે સાધન. ઈશ્વરાચે ધ્યાન, હ્યા ધારે સારખે અખંડ કરાવે. પૂજે વિષયીચી માહિતી ઇથે પુરી જ્ઞાલી.

આત્માર્યત આપણ પૂજેચ્યા સોળા અંગાંચી માહિતી ઘેતલી આતા મૂલ પૂજાચ કા કરયચી ત્યામાગચે માનસશાસ્ત્ર

અભ્યાસૂન

પૂજા હા ભાગ પૂર્ણ કરુ શુભમ ભવતુ પૂજા વિધી

પૂજેલા પર્યાય નાહી. પ્રત્યેક ધર્માતિલા માણૂસ વેગવેળ્યા પ્રકારે પૂજા કરતચ અસતો. જસા પ્રત્યેક પ્રિયકર આપલ્યા પ્રિયતામાચી જ્યા પ્રકારે આરાધના કરતો. તીચ પૂજા. પૂજા હે પ્રેમ વ્યક્ત કરણાચે એક સાધન આહે. પ્રીયતામાલા આપલેસે કરણાચી પ્રક્રિયા. ત્યા પ્રિયતામાચ્યા જાગી પરમેશ્વર ઠેવલા કિ તીચ ભક્તી. ભક્તી હે મુક્તીચે સાધન આહે. મુક્ત હોણે મ્હણજે પ્રિયકરાને પ્રીયતામાત વિલીન હોણે. એકરૂપ હોણે. વિભક્ત નાહી તો ભક્ત. હા પૂજેચ્યા માનસશાસ્ત્રાચા શેવટચા ભાગ પુઢે દિલા આહે. આત્માર્યત આપણ પૂજાવિધીચા સંપૂર્ણ કાર્યકારણ ભાવ પહિલા. આતા મુલાત પૂજા પ્રકારચ કા હ્યાચ્યા માગીલ માનસશાસ્ત્રાચા વિચાર કરુ. માણસાચે મન કથીહી સ્થિર નસતે. અતિ હલ્લબ્યા માણસાંમદ્દ્યે તે ડચમઠલેલે અસતે. અશા માણસાલા આપણ ચિત્ત ઠિકાણાવર નાહી અસે મ્હણતો. સર્વસામાન્ય માન્સામાદ્દ્યે તે આંદોલન ઘેત અસતે. જુન્યાકાલ

ઘંઘાલાચા

લંબક અસાયચા તો જસા ડાવીકડૂન મદ્દ્યે

યેઊન ઉજવીકડે વ પુન્હા પરત ડાવીકડે અસા સતત આંદોલને ઘેત અસાયચા? તસેચ માણસાચે મન, ભૂત, વર્તમાન, વ ભવિષ્ય, કાળાત સારખે ફિરત અસતે. ભૂતકાળાતીલ વિકલ્પ આણિ ભવિષ્યાતીલ સંકલ્પાત માણસાચે મન વર્તમાનપેશા જાસ્ત રમતે. મગ વર્તમાનાત તે કથી રાહતે? તર અભ્યાસ કરતાંના વ બૌદ્ધિક કામ કરતાંના. મ્હણજેચ મનાલા જર સ્થિર ઠેવાયચે અસેલ, તર, ત્યાલા અભ્યાસાત કિંવા બૌદ્ધિક કામાત રમાવિલે પાહિજે. પણ ત્યાસાઠી ત્યા ગોટીચી આવડ પાહિજે નાહીતર શક્ય નાહી પણ મનાચા એક સહજ ભાવ આહે તો મ્હણજે સતત સંકલ્પ કરીત રાહણે. મી હે કરીન તે કરીન m મગ મલા હે કિંવા તે મિઠેલ આણિ હા ભાવ ઇતકા સહજ આહે કિ ત્યાલા સાંગાયલા, શિકવાયલા, સક્તી કરાયલા, લાગત નાહી.

સર્વસામાન્યંચા મનાચ્યા હ્યા સ્વભાવાચાચ નેમકા વિચાર વ ઉપયોગ કરુન પૂજા હિ સંકલ્પના જન્માલા આલી. જાગેપણી કેલેલી સંકલ્પના મ્હણજેચ શાસ્ત્રીય ભાષેત દિવા સ્વપ્ર. માણૂસ તે નેહમી પાહતચ અસતો. ત્યાચ્યા ત્યા દિવા સ્વપ્રતાંલ પ્રિયતામાચ્યા ઠિકાણી ભગવંતાલા ઠેવલે આણિ ત્યાચ્યા પ્રિયતામાચ્યા ઠિકાણી ભગવંતાચ્યા સ્વાગતાચી સંકલ્પના કેલી કિ હીચ પૂજા. પ્રત્યેક માણૂસ કથી ના કથીતરી પૂજા કરીતચ અસતો. પૂજેલા પર્યાય નાહી. ફક્ત પ્રત્યેકાચા પૂજા કરણાચા પ્રકાર વેગવેગઠા અસતો. માણસાચ્યા મનાચા આણખીન એક ભાગ આહે, તો મ્હણજે ત્યાલા લાવાવી તી સવય લાગતે. મગ હિ ભગવંતાચ્યા અરાધાનેચી સવય લાવણે, મ્હણજે પૂજા કરયચી સવય લાઊન સહજ પરમાર્થ સાધણે. હા પૂજેમાગાચા દુસરા હેતુ આહે. સવય દીર્ઘ કાલ રાહિલી કિ સહજ ભાવ હોતો. ચાંગલી કિંવા વાઈટ પણ સવય મનાલા લાવતા યેતે. મ્હણૂનચ ચાંગલી સવય લાઊન વાઈટ સવયી કાઢુન ટાકયચ્યા જસે સોન્યાચ્યા કાઠ્યાને બાભીચા કાટા કાઢુન ટાકાયચા. પણ સોન્યાચા કાટા જ્ઞાલા તરી તો કટાચ મ્હણૂન તો હિ ટાકુન દ્યાયચા હાચ ખરા પરમાર્થ. શબરીચી ગોષ્ઠ આપલ્યાલા માહિત આહે. પણ તી પૂર્ણ સાંગતો કારણ તી સર્વાના માહિત નાહી. શબરી રામાલા ઉણી બોરે દેતે. હેતુ હા કિ રામાલા ચાંગલી બોરે મિળવીત. વાઈટ મિળુ નયેત. હા તિચા ભાવ રામચંદ્ર જાણતાત. ત્યામુલે તી બોરે જરાસાહી વિકલ્પ ન યેતા તે પ્રેમાને ખાતાત. પણ શેવટી શબરીલા સાંગતાત, કિ તી વાઈટ બોરે કુઠે આહેત? તી મ્હણતે મી તી બાજૂલા ઠેવલી આહેત. ત્યાવર પ્રભૂ રામચંદ્ર વિચારતાત, તી કોણી નિર્માણ કેલી? શબરી મ્હણતે તૂચ. ત્યાવર રામ મ્હણતાત મગ તી પણ મલા દેવૂન ટાક આણિ મુક્ત હો કારણ તી હિ મીચ નિર્માણ કેલી આહેત ના. હે ઐકલ્યાવર શબરી રામાલા બાજૂલા કાઢલેલી વાઈટ બોરે હિ રામાંના દેતે આણિ ખર્યા અર્થને મુક્ત હોઊન જાતે અનંતાત વિલીન હોઊન જાતે. રામરૂપ હોતે. પૂર્ણ મુક્ત હોતે. હા ભાવ જાણૂન, આપણ હિ મુક્ત હોઊયા. મુક્ત હોણે મ્હણજે પ્રીયતામાત પૂર્ણપણે વિલીન હોણે. વિભક્ત ના રાહણે મ્હણજેચ ભક્ત હોણે.

વિનાયક પ્રભાકર ફડકે ...



## ◎ શ્રી શાંતાદુર્ગા- મંગેશી

યંદા દિવાળીચ્યા સુદૃટિત કુઠે જાયચ?? આઈ મ્હણાલી અરો જાઉયાત કિ ગોવ્યા લા , સમોરચ્યા દેસાઈ કાકિંચા ઘર આહે તિથે , દરવર્ષી તે ત્યાંચે કુળાચાર કરાયલા ગોવ્યાલા જાતાત . મલા પ્રશ્ન પડલા એરવી ત્યાંચ્યા કામાત ગર્ક અસલેલે દેસાઈ , ન ચુકતા ગોવ્યા સારખ્યા ઠિકાણી કુળાચાર કરાયલા જાતાત. શાંતાદુર્ગા-મંગેશી લા ભેટાયલા જાતાત !!! મલા કુતુહલ વાટલા આણિ હ્યા કુતુહલા પોટી હ્યા દેવતાંચી માહિતી ગોલ કરાયલા સુરુવાત કેલી. ગોવ્યાચે ભૂષણ અસણારે શાંતાદુર્ગા મંગેશી મંદિરા વિષયી હ્યા લેખાત આપણ માહિતી ઘેણાર આહોત, ગોવ્યાત આલો કિ શાંતાદુર્ગા મંગેશી ચી મંદિરે પહાયલાચ હવીત, કાહીશી પોર્ટુગીસ ધારણીચી હિ દેવાલયે , વાહેરુન ચર્ચ સારખી દિસતાત .

હિ શાંતાદુર્ગા આધી કેળોશી લા હોતી , સન ૧૫૬૪ મધ્યે પોર્ટુગીસાંચ્યા આક્રમણાત મૂળ મંદિર નષ્ટ ઝાલે , ત્યાવેળી દેવી લા કવળેમ લા હલવણ્યાત આલં. અધી લહાનસ માતીચ્યા બાંધકામાચ દેવૂળ હોતા. સન ૧૭૩૦ સાલી , છત્રપતી શાહૂ મહારાજ હ્યાંચ્યાકડૂન , આર્થિક સાહાય્ય ત્યાંચે મંત્રી "નારોરામ શેણવી રેગે" હ્યાંની મિળવૂન મંદિરાચે બાંધકામ ચાલૂ કેલે, આણિ ગાવાતીલ મહાજનાન ચ્યા સાહાય્યાને આત્તાચે મંદિર ઉભે રહિલે.

હા ઝાલા મંદિરાચા ઇતિહાસ, આત્તા દેવી બદ્લ ચી માહિતી જાણૂન ઘેવ્યા ,  
શાંતાદુર્ગા હિચ્યા ઉત્પત્તીચી કથા ખૂપ ચ વેગળી આહે, એકદા ભગવાન વિષ્ણુ આણિ ભગવાન શંકર હ્યાંચ્યાત ભાંડણ ચાલૂ ઝાલે, બરાચ કાળ હે ભાંડણ ચાલૂ હોતે . તેન્હા બ્રહ્મ દેવાને આદિમાયા પાર્વતીલા સાકડં ઘાતલં , આણિ દેવી ને ઉજવ્યા હાતાત ભગવાન વિષ્ણૂલા આણિ ડાબ્યા હાતાત ભગવાન શિવાલા ધારણ કેલં આણિ દોઘાંચા ભાંડણ શાંત કેલં , હ્યાંચ કથેચે પ્રતિક મ્હણૂન દેવીચ્યા હાતાત દોન સર્પ દાખવલે આહેત . અશી હિ શાંત કરણારી શાંતાદુર્ગા

મ્હણૂનચ હિચ્યા કપાળાવરીલ માલ્વટાત કુંકવાચી "ચિરી" ઓઢલી જાતે . કુંકવાચી "ચિરી" ફક્ત દોન ટોકાચ્યા શક્તી / વિરુદ્ધ શક્તી એકા ઠિકાણી અસણાર્ય દેવિનાચ ઓઢલી જાતે, ઇતર દેવતા હ્યા પ્રામુખ્યાને તમો ગુણ કિંવા રજો ગુણ કિંવા સત્વ ગુણ પ્રધાન અસતાત , પણ શાંતાદુર્ગા હિ ઉગ્ર આણિ શાંત હ્યા દોન્હી વિરુદ્ધ ગુણાંના સમાનપણે ધારણ કરણારી દેવી આહે.

શાંતાદુર્ગેલા સાંતેરી / સાંતેરી અસ સુદ્ધા સંબોધલા જાતં , પણ ગોવ્યાતીલ લોક માત્ર તિલા "સાયબિણી" મ્હણતાત. અજૂન એક દંતકથા સાંગિતલી જાતે કિ દેવિ જેન્હા કેળોશી લા હોતી , તિથૂન તી સાંખવળ લા આલી , તેથીલ બ્રામ્હણાંના ત્રાસ દેણાન્યા "કાલાંતક" નાવાચ્યા રાક્ષસાલા દેવીને મારલે , તેન્હા તિથે તિચી વિજયદુર્ગા નાવાને સ્થાપના કરણ્યાત આલી.

સંગોલ્દ્યા લા સ્થાપન ઝાલી મ્હણૂન સાંગોડકરીણ ,તર કુંકલી લા સ્થાપન ઝાલી મ્હણૂન કુંકલીકરીણ . શાંતાદુર્ગા હિ ગૌડ સારસ્વતાનચી કુલદેવતા આહે. હ્યા દેવી લા કૌલ લાવાયચી પદ્ધત આહે.

દેવીચ્યા મૂર્તી લગતચ એક શિવલિંગ અસૂન તિચ્યા પાયા જવળ ૩ પિતલી સર્પ આહેત , કપાળ વર મલ્વટ આણિ ત્યાત કુંકવાચી ઠસઠશીત "ચિરી" ઓઢલેલી આપલ્યાલા બધાયલા મિળતે, નઊવારી પાતલ, કાનાત મત્સ્યાકૃતી કુંડલ , આણિ ડોક્યાવર મુકુટ, ત્યા મુકુટાલા જોડલેલી કેવડ્યાચી પ્રભાવળ ,આણિ લોંબણાર્ય દિવ્યાંચ્યા પ્રકાશાત આઈંચં અસં વિલોભનીય દર્શન ઝાલા કિ ખૂપ પ્રસન્ન વાટતા.

શાંતાદુર્ગેચે ઉત્સવ વર્ષભર ચાલૂચ અસતાત , ત્યાત મુખ્ય ઉત્સવ મ્હણજે માઘ પંચમી મ્હણજે જત્રોટ્સવ , ચૈત્ર આણિ અશ્વિન નવરાત્ર , ભાદ્રપદાતીલ અનંત આણિ મુક્તાભરણી રથોટ્સવ . પંચમી હા શાંતાદુર્ગેચ્યા ઉપાસનેતીલ પ્રમુખ દિવસ અસલ્યા કારણાને, વેગ-વેગલે ઉત્સવ પ્રત્યેક મહિન્યાતીલ પ્રત્યેક પદ્ધતાચ્યા પંચમી લા સાજરે હોતાત.

જત્રોટ્સવાત દેવીચે નૌકારોહણ કરણ્યાત, દેવીચા રથ ખાંદ્યાવર ઘેવૂન મિરવલા જાતો ત્યાલા "ખાંદ્યાવરીલ રથ" મ્હણતાત , તર રથોટ્સવ સુદ્ધા કરણ્યાત યેતો ત્યાનંતર લાલખી સુધા કાઢણ્યાત યેતે . નવરાત્રીત દેવીચા મખરોટ્સવ બાંધલા જાતો, હ્યાત દેવીચે વાહન બદલૂન ફુલાંચી આરાસ કેલી જાતે , લલિતા પંચમીલા ખાસ સજાવટ અસતે, તી પાહણ્યાસાઠી મુંબઈ પાસૂન , કારવાર ઇત્યાદી ઠિકાણચે સારસ્વત બાંધવ જમતાત સોન્યાચી પાલખી અર્થાત સ્વર્ણ શિબિકેતૂન આઈ ભક્તાંચ્યા ભેટીલા નિઘતે .

वसंत पंचमी हा सुद्धा महत्वाचा दिवस आहे. असे बरेच उत्सव मंदिरात साजरे होत असतात प्रत्येकाचा तपशील लिहला तर लेख जास्तच लांबेल.

वर लालखी असा शब्द आलाय, शांतादुर्गेची लालखी आणि पालखी काढण्याची पद्धत आहे, लालखी आणि पालखी हे विधी एकसारखेच असले तरीही ह्यात फरक आहे तो म्हणजे, पालखीत देव भक्तांच्या भेटीला जातो, हा नवविधा भक्तीतील सामिप्य भक्तीचा प्रकार आहे, पण शांतादुर्गा तिच्या मंदिर परिसरातील परिवार देवतांना सुद्धा भेटायला जाते त्यालाच लालखी म्हणतात. शांतादुर्गेच्या लालखी आणि पालखीतील अजून एक फरक म्हणजे, पालखी च्या वेळीस "सरदेसाई" नंची हजेरी असण्याला खूप महत्व आहे, त्यांच्या उपस्थिती शिवाय पालखी काढली जात नाही.

अशी हि कवळेम ची शांतादुर्गा, हिच मंगेशी शी असलेलं नात त्या विषयी बोलूया, शांतादुर्गा सायबीण, तर मंगेशी म्हणजे देवांचा देव म्हणून तो साईब, आणि ह्या साईबाची बायको म्हणून हि सायबीण, एकदा भगवान शंकर, पार्वती माते कडून सारीपाठ खेळताना हरले, भगवान शंकर कैलास सोडून गोमंतक भूमीत दाढी मिश्या वाढवून तपस्या करीत बसले, भगवान शिवांना शोधूत पार्वती माता राना-वनात हिंदू लागली, अचानक तिला वाघाच्या डरकाळ्या ऐकू आल्या आणि घाबरलेल्या पार्वतीच्या तोंडून "त्राही माम गिरीश" असे उच्चार घाई घाईत उच्चारताना "त्राही मांगरीश" असे उच्चार झाले, भगवान शिवांनी तिथे येवून, पार्वती ला अभय दिले आणि त्या ठिकाणी एक शिवलिंग उत्पन्न झाले, पुढे देवशर्मा ह्या मूळ पुरुषाने तिथे उपासना चालू केली कालांतराने मांगरीश चे मंगेश झाले. अजून एका दंत कथेनुसार ब्रह्म देवाने भागीरथी नदीच्या तीरावर एका मांगरीश नावाच्या पर्वतावर श्री मंगेशाचे शिवलिंग स्थापन केलेले, तिथून ते सारस्वत ब्राह्मणांनी त्रिहोत्रपुरि (सध्याचे बिहार) आणले, तिथून पुढे जेव्हा सारस्वत ब्राह्मण कुशस्थळी ला स्थायिक झाले तेव्हा हे शिवलिंग त्यांनी इथेच स्थापन केले कुशस्थाली म्हणजे आत्ताचे गोव्यातील कोटीलिम. पोतुगीसांच्या आक्रमणामुळे हे शिवलिंग सन १५४३ - १५६० च्या दरम्यान आत्ताच्या प्रियोळ येथे हलवण्यात आले. मंदिराचे बांधकाम मराठ्यांच्या राज्य काळात झाले पेशव्यांचे सरदार श्रीरामचंद्र सुकथनकर ह्यांच्या सल्ल्याने मंगेशी गाव मंदिराला दान करण्यात आले. काही वर्षांनी प्रियोळ चा भाग पुन्हा पोतुगीसांच्या ताब्यात आला होता पण, काहीसे मवाळ झालेल्या पोतुगीसांनी मंदिर-वास्तू ला पुन्हा छेडले नाही !!!

मंदिर अत्यंत प्रशस्थ असून, मंदिरा समोर ७ मजली दीपमाळ आहे आहे, मंदिराच्या परिसरात एक छोटासा तलाव सुद्धा आहे. मंदिरात आल्यावर आपला लक्ष वेधून घेतो तो मंगेशीचा मुखवटा, शिवलिंगा वर रेशमी सोवळे नेसवून, त्यावर सोन्याचा श्रीमंगेशीचा मुखवट्या वर अतिशय धीर गंभीर भाव जाणवतात, डोक्यावर पगडी आणि त्याला शिरपेच आणि मुखवट्या ला जोडलेली सोनेरी ध्वजांची प्रभावळ मागे असलेल्या चांदीच्या प्रभावळी मुळे अजूनच खुलून दिसते. मंगेशी म्हणजे शंकर ह्याच्या प्रमुख उत्सवान पैकी महाशिवरात्र आणि माघ पौर्णिमा हे महत्वाचे सन, माघ शुद्ध सप्तमी पासून पौर्णिमे परंत मंगेशीचा खूप मोठा उत्सव साजरा केला जातो, पौर्णिमेला रथोत्सव करून ह्या उत्सवाची सांगता होते.



श्री मंगेश देवस्थान, मंगेशी, म्हार्दोळ - गोवा



श्री शांतादुर्गा देवस्थान, कवळे, फोंडा - गोवा



॥ શ્રી શાંતાદુર્ગા વિજયતે॥ કવલે દેવસ્થાન, કવલે, ફોંડા-ગોવા

ગોવ્યાલા ગેલાત કિ શાંતાદુર્ગા મંગેશી લા લોક હટકૂન જાતાત પણ ત્યા વિષયી ચી માહિતી સગળ્યાંનાચ નસતે , હ્યા પવિત્ર દેવતાન વિષયી ચી માહિતી તુમ્હા સર્વ શ્રોતે જણાંની વાચુન લાભ ઘ્યાવા હિ વિનંતી, આણ હા લેખ શાંતાદુર્ગા મંગેશી ચ્યા ચરણી અર્પણ કરુન રજા ધેતો.

(ફોટો સાભાર : [પ્રથમેશ સુરેશ શિરસાટ](#))

સંકેત ભંડારી... ✓

## ◎ ભાવ આણિ હાવભાવ

ભારતીય શાસ્ત્રીય સંગીતાચં એક ખાસિયત મ્હણતી યેઈલ અસં લક્ષણ મ્હણજે ગાયકાંચે હાવભાવ. પરદેશાતીલ કાહીના તે વિચિત્ર વાટતાત તર કાહીના તે મુદ્રામ કેલેલે નખરે વાટતાત. ગાણ્યાચા આણિ હાવભાવાંચા કાહી સંબંધ અસતો કા? મલા હે હાવભાવ ઇતકે મહત્વાચે વાટતાત કી ત્યાંવર એક પુસ્તક લિહાયચી ઇચ્છા આહે.



ભારતીય સંગીતાત અસલેલે ગમકાંચે, તાનાંચે, આલાપાંચે પ્રકાર પાહિલે કી હે લક્ષ્યાત યેઈલ કી સ્વરાંનાહી આકાર અસતાત. કાહી તાના યા જિન્યાવરુન ઉતરણ્યાચઢ્યાસારખ્યા અસતાત. તર કાહી લેઝિમચ્યા સ્ટેપ્સ સારખ્યા અસતાત. કાહી આલાપ નિવાંત ઝોક્યાંસારખે અસતાત, તર કાહી આલાપ સંથ નદીચ્યા પાત્રાસારખે અસતાત. પાયરીવરુન ડૌલદાર પણ ઉતરણ, ત્યાચ પાયન્યાવરુન આનંદાચ્યા ભરાત ઉડ્યા મારત મારત ખટક્યાંસારખં ઉતરણ, આણિ ઘસરંગુંડીવરુન ઉતરણ યા તિન્હીત સાંદર્ય આહે. અગદી તસંચ ખટકે ઘેત ઘેત ઉતરણારે સ્વર આણિ ગોલાકારાત યેણારી મીંડ યાંના ગાતાના ગાયકાચ્યા હાતૂન આપોઆપ તે આકાર યેત અસતાત. જેબ્હા જબડ્યાચી તાન ચાલુ અસતે તેબ્બા ગાયકાચા હાતહી થરથરા ફિરત અસતો. યા ઉલટ જેબ્હા સ્વરાંચં સંથ આંદોલન ચાલુ અસતં તેબ્બા ગાયકાચી માન આણિ હાતહી ડોલત અસતાત. ઝોપાળ્યાવર ઝુલત અસતાત. જેબ્હા કુમારજી પદ્ધા સૂર પકડતાત તેબ્બા ત્યાંચી મૂઠ પહા આણિ મગ તે પતંગસારખે ત્યા સ્વરાલા હલકેચ હવેવર સોડૂન દેતાના પહા. કિંવા ભીમસેનજીંચા વરચા સૂર જેબ્હા મંડપાલા ભેદૂન, આભાલાચ્યા છતાલા ઓલાંડૂન “ત્યા”ચ્યાશી ભિડતો તેબ્બા ત્યાંચ્યા ચેહન્યાવરચા બ્રહ્માનંદ બધા. શોભા ગુર્દી સ્વરાંશી લડિવાલપણે ગુલગુલુ ખેલતાના દિસતાત. તર રાશિદ ખાન સૂરાંશી ગંમતીદાર ચેષ્ટામસ્કરી કરતાના દિસતાત. ઉસ્તાદ જ્ઞાકિર હુસેન જેબ્હા ગાયકાલા તાલાચ્યા માત્રાંચ્યા જંગલાત નેઝન સોડતો આણિ રંગાત યેતો તેબ્બા ત્યાચ્યા ચેહન્યાવર યેણારા ખટ્યાલપણા મ્હણજે કૃષણલીલાચ. હરિપ્રસાદજી, પં. શિવકુમારશર્મા આણિ જ્ઞાકિર હુસેન યાંચ્યા જુગલબંદીત એખાદ્યા સ્પોટ્સરખી મજા યેતે તી નુસં બધત રહાવી. તે આપાપલ્યા વાદ્યાદ્વારે એકમેકાંના કોંડીત પકડત આહેત કી કાય અસા ભાસ હોતો. યાને ત્યાલા આતા ખોપચ્યાત ઘેતલં અસં વાટતં આણિ દુસન્યાચ ક્ષણી દુસન્યાચા અસા કાહી પૈતરા દિસતો કી આપણ ગાર હોતો. હરિજી એખાદી અત્યંત ગુંતાગુંતીચી તાન ઘેઊન પખાવજવરચ્યા ઇશારા કરુન આબ્ધાન દેતાત આણિ તેબ્બદ્યાચ તાકદીને પખાવજાતૂન તેચ આણિ તસેચ સૂર કાઢૂન દાખવતાત તેબ્બા ત્યા દોઘાંચ્યાહી મિશ્કીલ ચેહન્યાકડે બધૂનંચ પૈસે વસૂલ હોતાત. શાસ્ત્રીય સંગીતાચી મૈફલ હી કેવળ કાનાંના મેજવાની નસતે તર પ્રેક્ષણીયહી અસતે.

આલાપ ઘેતાના હાત સ્વરાંચ્યા જાગેનુસાર ફિરત અસતાત. તાર સ્વરાંચ્યા વેલી હાત ઉંચાવલે જાતાત તર ખર્જાચ્યા વેલી તે (આપોઆપ) ખાલી યેતાત. હે હાવભાવ ગાયક મુદ્રામ કરત નસતો. તર ત્યાચ્યા તન્મય અવસ્થેત તે આપોઆપ ઘડૂન યેત અસતાત. જેબ્હા સ્વરાંમાગૂન સ્વર યેત અસતાત તેબ્બા હાત ત્યા જાગેવરુન ખાલીવર હોત જાતાત. યા ઉલટ જેબ્હા એકાચ સ્વરાશી ગાયક થાંબતો તેબ્બા હાતહી એક જાગી સ્થિર હોતો. કધી ચિમટી, કધી તાઠ બોટ, કધી મૂઠ અશા તન્હેને હા નેમકા સૂર ત્યાંચ્યા હાતાચ્યા મુદ્રાંતૂન દિસતો. યા ઉલટ જેબ્હા ગાયકાલા સ્વરાંતૂન એખાદા ત્રિમિતી આકાર જાણવાયલા લાગતો તેબ્બા ત્યાચા હાતહી ત્યા આકારાચા વેધ ઘેત જણૂ ત્યા આકારાવરુન ફિરત અસતો. ત્યાંચી બોટ ત્યા આકારાલા સ્પર્શ કરત અસતાત. કધી સૂર ચિમટીત અસતો. તર કધી એખાદ્યા ફડફડણાંચા પક્ષાપ્રમાણે નિસ્તંત અસતો. યા તન્મય અવસ્થેત, ધૂંદીત, ગાયકાલા સ્વતંત્રાંના આપણ કાય હાવભાવ કેલે યાચા અનિબાત અંદાજ નસતો. ગાયકચ કા ? અનેકદા એખાદા શ્રોતાહી ત્યા સુરાંચ્યા નશેત તસેચ હાવભાવ કરતાના દિસતો.

પં વીણા સહખ્યબુદ્ધે મ્હણતાત “મી સંગીતાચે આકાર બધતે આણિ કસલેહી વિશેષ સાયાસ ન કરતા મી તે આકાર પૂર્ણ કરત જાતે”. પં અરુણ કશાળકર યાંની તર મ્હટલંય કી “હે આકાર નૃત્યાસારખે અર્થપૂર્ણ નસતાત તર abstract અવસ્થેત નજરેલા દિસત અસતાત. માત્ર abstract ચિત્ર પ્રમાણે તે કાયમ અમૂર્ત નસતાત તર ત્યાંના હલ્લ હલ્લ આકાર યેત જાતો. તોહી ત્રિમિત. એખાદ્યા અમીબાપ્રમાણે નિરંતર બદલણારા, ત્રિમિત આણિ તરીહી સાકાર.”

માત્ર યાચા અર્થ સા મ્હટલં કી પોટાસમોર આણિ રે મ્હટલં કી છાતીસમોર અસં તે ઢોબળ ઠોકલ નસતં. પણ કાહી પ્રમાણાત પ્રત્યેક ગાયકાચ્યા હાવભાવાંતૂન ત્યાંચ્યા ગાયનાચા અંદાજ યેઊ લાગતો. ઉદાહરણાર્થ હૃષિકેશ રાનડે ખર્જાચ્યા સ્વરાલા જાતાના હાતાત વીટ ધરલ્યાપ્રમાણે પંજા ઘટુ કરુન માગે ઘેતો. ભીમસેનજી વરચા સા લાવતાના ડોળે વર કરુન દોન્હી હાતાંની અર્ધ દિલ્યાસારખં કરીત. પંડિત જસરાજ એખાદી નવીન

ખાસ હરકત પેશ કરતાના મુઠી મુઠીને રંગ ઉધળલ્યાગત કરતાત. તર કુમારાંચી એખાડી સુંદર હરકત પૂર્ણ ઝાલ્યાવર હાત અસે ઉંચાવતાત જેસે તીન પત્તીત તીન એકે આલેલ્યા જેત્યાને સમોર તે પત્તે સ્ટાઈલમધ્યે ટાકાવેત. ઘ્યા !....



જણું યા ગાયકાંસમોર નિસર્ગચે રંગાંચે આણિ આકારાચે સોહળેચ ચાલુ અસતાત આણિ ત્યાંચ્યાત રંગું જાત અસતાના ત્યાંચ્યા તોંડૂન નિઘણારે અનાદૂત ધ્વની આપણ એકત અસતો. ત્યાંચ્યા ગાણ્યામાગે ઇતકા રિયાઝ અસતો કી ત્યા ક્ષણી એકા સૂરામાગે દુસરા સૂર પ્રતિક્ષિસ યેત અસતો, સહજ ઉમટત અસતો.

દૂસરં મ્હણજે ગાણ મ્હણજે સૂરાંચં શુષ્ક ગણિત નાહી ના વંધો. ત્યાતલા રસ, ત્યાતલા ભાવ હાચ તર ત્યાચા આત્મા. ગાયકાંચ્યા યા હાવભાવાંતૂન, મુદ્રાંતૂન, ત્યાંચ્યા મનાતલે ભાવ, ત્યાંના ત્યા ક્ષણી દિસણારે “સત્ય” જાણું ઘ્યાયચા આપણ પ્રયત્ન કરાયચા અસતો. ત્યા રસાત આપણાં ત્યાંચ્યાસહ ભિજાયચં કિંવા પ્રસંગી બુડાયચં અસતં.

પંડિત મલ્લિકાર્જુન મન્સૂર ના એકદા કોણીતરી વિચારલં “ ગાણ મ્હણજે કિતી કષ્ટ કરાવે લાગતાત, નાહી ? ” ... ત્યાવર તે ઉદ્ગારલે “ત્યાત કસલે કષ્ટ ? તો તર આનંદ”. ત્યા આનંદાચી દોન ચાર છીંટં જરી આપલ્યાવર ઉડાલી તરી આપણ ધન્ય વ્હાવં. સુફી ગાયકાંચ્યા વાઠ્યાલા યેણારં વેડ. ગંગલ ગાયકાંચ્યા તોંડી શબ્દાંના હોણારા પરીસસ્પર્શ. કીર્તનકારાંચ્યા વાઠ્યાલા આલેલાં સૂરાંચં સ્વર્ગીય સુખ. પોવાઢ્યાત હોણાન્યા સુરાંચ્યા તલવારી આણિ ભાલે. આણિ અંગાઈત હોણારે સૂરાંચે રેશમી તલમ વચ્ચ. યા સાંચ્યાંચા આનંદ જ્યાંની ભોગલા તે નશીબવાન. જ્યાંની જિતકા ભોગલા તે તિતકે શ્રીમંત. હી સારી દૌલત આપલ્યા સમોર ઓતલેલી અસતેચ. કાહી કરંટે ત્યાતલ્યા કવડ્યા ઉચલતાત. કાહીંના ત્યાતલી અસ્સલ હિરે માણકં ઓળખતા યેતાત. એવઢાચ કાય તો ફરક.



અજૂન એક મહન્ત્વાચા ભાગ આહે જો મોઠ મોઠે ગાયક આણિ મહાન ગાયક યાંચ્યાત ભેદ દાખવતો. તો મ્હણજે શ્રીમંતીચં દર્શન. અત્યંત જોરદાર તયારી આણિ ભરપૂર રિયાઝ યાંચ્યા આધારાને સર્વચ મોઠે સંગીતકાર સંગીતિક શ્રીમંત હોતાત. પણ યા શ્રીમંતીચી માંડણી કરાયલા ઉમજ અસણ્યાબરોબરચ સમજ અસાયલા હવી. એખાદ્યા અચાનક ધનલાભ ઝાલેલ્યા નવશ્રીમંત સ્વીલા સગળે દાગિને ઘાલૂન મિરવાયચી હૈસ અસતે. માત્ર ખાનદાની શ્રીમંત સ્વી પ્રસંગાનુરૂપ શોભતીલ એવઢેચ નિવડક દાગિને ઘાલૂન યેતે. ભારતીય સંગીતાતલે હે અલંકાર આભુષણ હાતી આહેત મ્હણૂન વાટેલ તશી, વાટેલ ત્યા પ્રકારાને ભરમાર વાપરણ્યાને એક વિભત્સ દિખાઊપણા ડોકવાયલા લાગતો. ઇથેચ યા શતકાતલે “શ્રેષ્ઠ” સંગીતકાર આણિ ઇતર “જ્યેષ્ઠ”

સંગીતકાર યાંચ્યાતલા ફરક દિસાયલા લાગતો. શ્રોત્યાને જાણકાર અસણ્યાબરોબરચ પ્રગલ્ભ અસણ્યાચી ગરજ નિર્માણ હોતે તી ઇથેચ. પ્રચંડ આભુષણાચી આતષબાજી ઝાલી કી જાણકાર અસલેલા પણ પ્રગલ્ભ નસલેલા શ્રોતા ભારાવુન આણિ દિપૂન જાતો. અશા શ્રોત્યાંસાઠી મગ મંદ સમર્ઝિસારખા તેવણારા એખાદા રાગહી કાહી ગાયક વાદક ફુલબાજ્યાંસારખા પ્રદર્શિત કરતાત. ટાલ્યાંચા કડકડાટ હોતો. જ્યાંચ્યા ત્યાંચ્યા તોંડી યા સંગીતકારચે નાંવ ગાજત રહ્યાંતે. યા આતષબાજીચ્યા પલિકડે જાઊન ગાણ્યાચા આત્મા ઓળખણાન્યા શ્રોત્યાંચી વાઢ વ્હાયલા હવી અસં મલા વાટંતં તે યાસાઠી.

ત્યાસાઠી પ્રત્યેક રાગાતલા, બંદિશીતલા રસ, ભાવ સમજૂન તી પેશ કેલી જાયલા હવી આણિ શ્રોત્યાંની તી તશી સમજૂન ઘ્યાલા હવી. રાજન-સાજન મિશ્રાંચ્યા એકા બૈઠકીત ત્યાંની “ભવાની દયાની” હી ભૈરવી કાર્યક્રમાંચ્યા શેવટી સાદર કેલી. તી સાદર કરણ્યાપુર્વી ત્યાંની એક અનોખી વિનંતી કેલી. શ્રોત્યાંની યા ગાણ્યાલા એકહી આવાજી દાદ દેઊ નયે. ટાલ્યા વાજવુન નયેત. હી ભૈરવી અશીચ મનાત રિચુ દ્યાવી. યા કાર્યક્રમાંચ્યા શેવટી જે સ્વર્ગીય વાતાવરણ નિર્માણ ઝાલે ત્યાત શ્રોતે તરંગતચ આપાપલ્યા ઘરી ગેલે.

ગાણ્યાત ભાવ હવા તો અસા.

નામ ગુમ જાયેગા (નામકાકા) ...

## ◎ માંજર આડવી ગેલ્યાને અપશકૂન હોતો કા ?

૬ મે ૨૦૧૩ પાસુન 'યશવંતરાવ ચબ્હાણ મહારાષ્ટ્ર મુક્ત વિદ્યાપીઠ (YCMOU) નાશિક' ચ્યા વાર્ષિક પરિક્ષા સુરૂ જાલ્યા હોત્યા. ૦૭ મે પાસુન માઝ્યા કલા શાખેતુન પદવીચ્યા દ્વિતીય વર્ષાચ્યા (SYBA) પરિક્ષા સુરૂ જાલ્યા. ત્યાચાચ ૦૮ મે રોજી 'આધુનિક જગાચા ઇતિહાસ' (HIS221) યા વિષયાચી પરિક્ષા દેણ્યાસ ઘરચ્યા 'હિરો હૌંડા- સ્પ્લેન્ડર પ્લસ' યા દુચાકીને નિધાલો હોતો.

કિંડગીપાર રેલ્વેચૌકી ચવળ અસતાના અચાનક મી જાત અસલેલ્યા રસ્ત્યાહૂનચ એક કાળી માંજર આડવી ગેલી. કાળી માંજર આડવી જાતે ન જાતે તો ચ માઝી દુચાકી દેખીલ માંજરીને કાપલેલ્યા રસ્ત્યાચ્યા પુઢે નિઘૂન ગેલી. માઝ્યા મનાત આલં- માઝ્યા માગેહી ભરપૂર વાહને હોતી. કાય મી ગાડી થાંબવૂન અગોદર ત્યાંના પૂછે જાઊ દ્યાયલા પાહિજે હોતં.! ખરંતર તિતકા વેલ કુણાજવળ હોતા! મી આમગાવહૂન જેમતેમ ૪ તે ૫ કિમી પુછે હોતો વ મલા અજૂન ૨૨ તે ૨૩ કિમી પુછે ગોંદિયા યેથેલ એન. ઎મ. ડી. મહાવિદ્યાલય યા અભ્યાસ વ પરિક્ષાકેંદ્રાવર પરિક્ષા દેણ્યાસ જાણે હોતં. દુપારી અડીચ વાજતાપાસુન પેપર હોતા. પરિક્ષેચ્ચી વેલ અગદી જવળ યેઊન ઠેપલી હોતી. પરિક્ષેચ્ચા વેળેચા માઝ્યા મનગટી ઘડ્યાલાત્તચ કાંટાંડાંડન (ઉલટી ગણતી) સુરૂ જાલેલી હોતી. આણિ માઝ્યા ડોક્યાત એક ભલતાચ વિચાર ભ્રમણ કરું લાગલા. આણિ તો સ્વાભાવિકહી હોતા. કાય હા અપશકૂન સમજાયચા? કાય આતા માઝા ઇતિહાસચા પેપર વિઘડણાર!!!

અગદી બાલવયાપાસુન આપલ્યા ઘરાતુનચ આપલ્યાવર કાહી બરે-વાઈટ સંસ્કાર કેલેલે અસતાત. આણિ ત્યાતલંચ એક મ્હણજે જર આપલ્યા રસ્ત્યાને માંજર આડવી ગેલી તર તિથેચ થાંબૂન આધી દુસર્યા કુણાલાતરી તિથૂન પુછે જાઊ દ્યાયચં આણિ મગચ સ્વત: ત્યા રસ્ત્યાને જાયચં. પણ કા? તર અપશકૂન હોતં આણિ મગ આપલ્યાઆધી કુણી ગેલં તર ત્યાલા?? ત્યાલા કાહી નાહી હોત કારણ ત્યાને માંજરીલા પાહિલેં નસતં. આણિ યા માંજરીલા રસ્તા ઓલાંડાના તર મીચ ચક્ક પાહિલેં હોતં. કિંબહુના સર્વાત પુછે મી અસલ્યાને તીને માઝાચ રસ્તા ઓલાંડલા હોતા. મગ હા અપશકૂન સમજાયચા કા???

તર પહીલી ગોષ્ટ મી તર અસલ્યા સમજૂતીના માનતચ નાહી વ અંધશ્રદ્ધાવર વિશ્વાસહી ઠેવત નાહી. પણ મલા ઇથે એક ગોષ્ટ નમૂદ કરણે અગત્યાચે વાટતે કી મી નાસ્તિક નાહી તર મી આસ્તિક આહે. પણ મી જરી હિંદુ ધર્માત જન્મલ્યાને વ હિંદુ ધર્માય અસલ્યાને માઝ્યા હિંદુ ધર્માબિદ્લ આદર અસલા તરી યા ધર્માતીલ અસલ્યા અંધશ્રદ્ધાંના થારા દેણાંયા ગોર્ટીંવર માઝા અજિબાત વિશ્વાસ નાહી. આણિ માઝ્યા મતે તરી અસલ્યા ગૈરસમજૂતી ફક્ત હિંદુ ધર્માતચ અધિક અસાચ્યાત. દુસરી ગોષ્ટ મ્હણજે મી સર્વધર્મસમભાવ તત્ત્વાચા અસલ્યાને વ ઈસ્લામને અધિક પ્રભાવિત અસલ્યાને સ્વધર્માઇતકાચ આદર અન્ય સર્વ ધર્મ વ વિશેષત: ઈસ્લામચા આહે. અસો મલા ઇથે કોણત્યા નવીન વાદાલા જન્મ ઘાલાયચા નસૂન માઝે મત માંડાયચે આહે. અસાહી ટિવટૃરયા સામાજિક સંકેતસ્થળાવરીલ એકા દેશભક્ત વ ધર્મભક્ત તરૂણીલા માઝે અંધશ્રેદ્વેવરીલ વ વિશેષત: હિંદુ ધર્માતીલ અંધશ્રેદ્વેવરીલ વિચાર વ સત્યતા પટવૂન દેણ્યાસાઠી ભવિષ્યાત એક સ્વતંત્ર લેખ લિહિણ્યાચે નિયોજન આહેચ. આણિ ત્યાદિવશી માંજર આડવી ગેલ્યામુલે યા લેખાંચ્યા લેખનપ્રાંચાદ્વારે સમજા હી ત્યાચીચ સુરૂવાત!

તરી કાહી ના કાહી પ્રમાણાત બાલવયાતચ ઠસલેલ્યા અસલ્યા કાહી ગૈરસમજૂતીંચા થોડાફાર કા હોઈના પણ પ્રભાવ માઝ્યા મસ્તિષ્કાવરહી હોતાચ. પણ મગ યા માંજરીચા વિચાર સોડૂન જે હોઈલ તે પાહૂ અસા વિચાર કરુન હા કિસ્સાચ વિસરલો. આણિ એકદાચા માઝા ઇતિહાસ ચા પેપર સુરૂ જાલા.

માંજર આડવી ગેલ્યાચા પહીલા દુષ્પરિણામ તર પેપર સુરૂ હોતાચ જાણવલા તો મ્હણજે વર્ગાતીલ પર્યવેક્ષક કડક હોતે. પણ હા અપશકૂન તર અભ્યાસ કરુન 'ન' આલેલ્યાંસાઠી હોતા. મી અભ્યાસ કરુન ગેલેલા અસલ્યાને તી તર માઝ્યાસાઠી આનંદાચીચ બાબ હોતી. આતા અજૂન કુણ્યા અભ્યાસ કરુન ન આલેલ્યા પરિક્ષાર્થ્યાચા પણ રસ્તા એખાદ્યા કાળ્યા માંજરીને ઓલાંડલા મ્હણાયચા કા? પેપર સુરૂ હોણ્યાપૂર્વીહી માઝ્યા દૃષ્ટીને એક ચાંગલીચ બાબ ઘડલી માઝે માગીલ બાકાવર આસન ક્રમાંક અસલેલી પહીલ્યા પેપરલા અનુપસ્થિત વિદ્યાર્થીની યા પેપરલા ઉપસ્થિત હોતી. આતા આપલ્યા માહિતીસાઠી સાંગુ ઈચ્છિતો કી ત્યા દિવશીચા ઇતિહાસ ચા દુસરા પેપર વિઘડણાએવજી ઉલટા ઉત્તમચ ગેલા. શિવાય પેપર સંપલ્યાનંતર ગોંદિયાહૂન આમગાવલા પરત યેતાના દેખીલ કોણતીચ અનપેક્ષિત ઘટના ઘડલી નાહી. આણિ ઘડલી અસતી તરી તિચા સંબંધ ત્યા માંજરીચ્યા રસ્તા ઓલાંડણ્યાશી લાવતા આલા નસતા.

આતા મલા એકચ ગોષ્ઠ વિચારાવિસી વાટે કિ શુભકાર્યાસ જાત અસતાના કુણાચી પ્રેતયાત્રા મિઠાલ્યાસ અથવા માંજર આડવી ગેલ્યાસ અશુભ માનલં જાતં. માંજર રસ્તા ઓલાંડણાર નાહી તર કશાને જાણાર? આણિ શહરાંમધ્યે પાછલેલી વ ખેડ્યાંમધ્યે રાહણારી માંજર ઘરાતીલ સદસ્યાંપુઢૂન કિત્યેક વેલા જાતે તર અપશકૂન હોત નાહી. કિંવા કુણાચા મૃત્યુ જ્ઞાલ્યાસ સ્મશાનભૂમીકડૂન જાણાન્યા રસ્ત્યાને પ્રવાસ કેલ્યાસ પ્રેતયાત્રા વા અંત્યસંસ્કાર દિસણાર નાહી તર તે કુઠે જાણાર?? મગ સત્કર્મી જાતાના માંજર આડવી ગેલ્યાસ વા પ્રેતયાત્રા દિસલ્યાસ અપશકૂન હોણં કસં કાય શક્ય આહે? આણિ જર એખાદી અનુચ્ચિત ઘડના ઘડલીચ તર ત્યાચા એકચ અર્થ મ્હણજે તો કેવળ એક યોગાયોગ આહે. કારણ યાવરૂન એકચ ગોષ્ઠ નિષ્પન્ન હોતે તી મ્હણજે માંજર વ પ્રેતયાત્રેમુલે અપશકૂન હોત નસૂન હા કેવળ માનવાચ્યા મન વ મસ્તિષ્કાત બાલપણાપાસૂન ભરણ્યાત આલેલા ભ્રમ વ યાવર વિશ્વાસ મ્હણજે કેવળ અંધથરદ્વા આહે .!!!

રાજેશ હજારે ... 

## ◎ સ્વિટ્ઝર્લ્યાંડચી સફર

◇ કખી અલવિદા ન કહના!

પ્રવાસાલા નિઘતાના મલા નેહમી મ્હણાવેસે વાટટે " જહા પે બસેરા હો સવેરા વહી હો". આપલા મુંકામ જિથે અસેલ -મગ તો દોન દિવસાચા અસો કિ મહિના ભરાચા આપલે મન તિથેચ ગુંતલેલે અસાવે. તીવ્ર ભૂમી આપલી કર્મભૂમી અસેલ. અર્થાત ત્યા જાગેતહી તશીચ જાડુ અસલી પાહિંજે.સ્વિટ્ઝર્લ્યાંડ લા જાયચી તયારી કરતાના માઝ્યા હ્યા આવડત્યા ગાણ્ય પ્રમાણે માઝા ઉત્સાહ અગદી ઉત્ત જાત હોતા. પણ નિઘતાયચા દિવસ આલા આણિ પાય અગદી અચાનક જડ જાલે. અસે વાટલે આપલા દેશ સોડ્ન સર્વસ્વી નવીન અશા યુરોપ ખંડાત જાયચે મ્હણજે તિથલે આચાર, વિચાર, સંસ્કૃતી , ખાણે પિણે સગળેચ વેગલે. થોડ્યા દિવ્સાસાઠી કા હોઈના આપલ્યા માતેચી નાલ સોડ્ન જાયલા કાહીતરી નિરાલેચ વાટલે. યા આધીહી મી અનેકદા બાહેર પરદેશી ગેલે હોતે પણ યુરોપ મધ્યે પ્રથમચ વારી અસલ્યામુલે નિઘતાના જરા પાઊલ અડખલલે ઇતકેચ.

◇ સ્વિટ્ઝર્લ્યાંડ લા પોહોચાયલા કુઠેહી halt ન ઘેતા ગેલાત તર વિમાનાને આઠ સાડે આઠ તાસ લાગતાત. આણિ વિમાનાતૂન બાહેર પડતા ક્ષણી અહાહા સ્વર્ગચે દારચ ઉઘડ્યાસારખે વાટુ લાગતે. બાહેર જાતાક્ષણી સુંદર, સ્વચ્છ , મોકલી હવા નાકાતૂન છાતીત શિરતે આણિ ત્યાક્ષણી તુમચ્યા મનાત આણિ શરીરાત નવીન ઉત્સાહ ભરાયલા સુરુવાત હોતે. સસેન્સ મહિના હા આપલ્યાલા સ્વીત્ઝેર્લ્યાંડ લા જાણ્યાસાઠી યોગ્ય ઠરતો કારણ તેબ્બા તિથે થંડી કર્મી હોડુન સમર સુરુ જાલેલા અસતો. ત્યામુલે જાતાના થોડેચ ગરમ કપડે નેલે તરી ચાલતાત.

◇ મેહનત આણિ શિસ્ત !

સ્વિસ મધ્યે લોક ચક્ક ખૂપ ચાલતાત. સ્વતાચે સમાન સ્વતાચ ઢકલત કિવા ખાંદ્યાવર ઘેઊન જાતાત. હલ્લી બહુતેક bags વ્હીલ લાવલેલ્યા અસલ્યા મુલે ઢકલણે સોપે જાતે. વિમાનતલા હૂન બાહેર આલ્યા પાસું આપલ્યાકડે હાત દાખવૂન સેવા ઘ્યાયચી આપલ્યાલા સવય જાલેલી અસતે. ઇકડે માત્ર મુલાટચ લોકસંખ્યા કર્મી.એક માણૂસ અક્ષરશા દહા માણસાચી કામે કરતો. માણસે મેહનતી આણિ અગદી મન લાવૂન કામ કરતાના દિસતાત. હસતમુખ આણિ મદત કરાયલા તયાર ! ઝુરિક લા જાયલા રેલ્વેને જાતાના હિ આમ્હી આમચ્યા bags સ્વતાચ ઘેઊન ગેલો. ઝુરિક વરુન હિ સ્ટેશન તે હોટેલ અક્ષરશ ચાલત ચાલત રહ્યારીચા અનુભવ ઘેત મજેત ગેલો. ફક્ત સામાન ઘેઊન ચાલત જાણે સવય નસલ્યા મુલે જરા કઠીણ ગેલે. પણ ત્યામુલે ઝુરિક ચે રસ્તે અગદી પાયાખાલચે જાલે. ઇતકે સુંદર, સ્વચ્છ આણિ આરથાં સારખે નિર્મિલ રસ્તે , અગદી કુઠેહી બસૂન ત્યાવરુન હાત ફિરવાવાસા વાટલા.

સકાળચી વેલ જાલી કિ ઔફિસલા જાણાર્યા લોકાંચી ધાવપદ દિસૂ લાગતે ઇથે. બહુતેક જન ટી શર્ટ, paants , જાકેટ કિવા વરુન લાંબ ગુઢ્યાપર્યંત પોચણારા ! બહુતેક સર્વાનીચ ગરમ કપડે ઘાતલેલે ! તાપમાન ૧૨-૧૩ ચ્યા દરમ્યાન. એન્ફ્રી બોચરી થંડી મી પહિલ્યાંદાચ અનુભવત હોતે. માઉંટ તીલ્લીસ તર ઉણે નજી તાપમાન હોતે. તાપમાનાચે અચૂક નિદાન દરરોજ TV વર દિલે જાતે. આણિ તે અગદી બરોવર અસતો. મ્હણજે અસે કિ પડણાર મ્હણજે પડણાર ત્યા નિદાના મધ્યે થોડીહી ઢિલાઈ નસતે.

◇ નિસર્ગ આણિ રેલ્વે પ્રવાસ !

સામાન સાંભાકૂન આમ્હી ટ્રેન મધ્યે આમચ્યા આસનાવર સ્થિર સ્થાવર જાલો તેબ્બા મોઠાલ્યા કાચેચ્યા ખિડક્યાતૂન બાહેર નજર ગેલી આણિ અહાહા સગળ્યા શ્રમાચે પરિહાર જાલ્યા સારખે જાલે.બાહેર નિસર્ગચે સૌંદર્ય ઉત્ત ચાલલે હોતે. હિરબે,નિલે રંગ અગદી બેમાલૂમ પણે એકમેકાત મિસલ્લુન ગેલેલે..મધૂનચ પાંદર્યા શુભ્ર નદ્યા વલ્લણે ઘેત ચાલલેલ્યા. ગવતાવર ધષ્ટ પુષ્ટ ગાયી ચારત અસલેલ્યા. સગળ્યાંચ્યા ગલ્યાત ભલ્યા મોઠ્યા ઘંટા કિણકિણ આવાજ કરીત હોત્યા. અરે હો હે સગળે આવાજ ખિડક્યા ઉઘડ્યા તરચ યેતાત બરે કા? કારણ સંપૂર્ણ ગાડી વાતાનુકૂલીત.પ્રત્યેક આસન સુંદર મખમલી કાપડાને બનલેલે . પ્રત્યેક ડબ્બા અગદી પ્રવાશાંચ્યા સોયી પ્રમાણે બનવલેલા. સાયકલી ઠેવાયલા જાગા, સામાન ઠેવાયલા વેગવેગલે ખણ, સ્ટેશન યેણ્યા પૂર્વી સૂચના દિલી જાતે. દરવાજે અપોઆપ ઉઘડતાત, બંદ હોતાત. પ્રવાસી શિસ્તીત ઉત્તરતાત, ચઢતાત. કોઠેહી ગડબડ ગોંધલ નાહી. સુરવાતીલા મી ચુકૂન દુસર્યાંચ્યા માર્ગત ઉભી રાહલે તર થોડ્યા વેલાને માઝ્યા લક્ષ્યાત આલે કિ માઝ્યા માગે લોક રાંગ લાવૂન ઉભી હોતી પણ કોણીહી મલા ટોકલે નાહી. મલા ઇથલ્યા લોકાંચી રક્તાત ભિનલેલી શિસ્ત બધૂન અગદી ભરુન આલે. ઝુરિક લા ગાડીત વર્તમાન પત્રેહી ઠેવલેલી હોતી. પ્રવાસી તે વાચત હોતે પરત જાતાના ઘડી કરુન જાગેવર ઠેવૂન જાત હોતે. વેલોવેલી TC યેઊન તિકીટ તપાસૂન જાત હોતા. સહસા લવાડી, ચોરી કોણી કરત નાહી હે કૌતુકાસ્પદ આહે.આમ્હાલા પાસ મિલાલા અસલ્યામુલે આમ્હી કોઠેહી કથીહી પ્રવાસ કરુ શકત હોતો. Swiss મધીલ પ્રત્યેક ગાવ ટ્રેન ને જોડલેલે આહે.પ્રત્યેક સ્ટેશન વર સકાળી ૧૨ તે રાત્રી ૧૨ પર્યંત સુટ્ટણાંચ્યા ગાંધ્યાંચી વ્યવસ્થિત

માહિતી દિલેલી ઇતકી કિ કોણીહી નવખા માણુસ સહજ પ્રવાસ કરું શકત અસેલ . અસો. ઇથળ્યા રેલ્વે બદ્દલ તર એક સ્વતંત્ર લેખ ચ લિહાવા લાગેલ.

### ◇ બાજાર!

આપલ્યાપૈકી પ્રત્યેકાલાચ બાજારાત સ્વત જાઉન ખરેદી કરાયચી હૌસ અસતે. મગ તી તાજી પાલેભાજી , ફળ ભાજી અસો કિ ફળે અસોત. મી હ્યા ગોષ્ટીલા અપવાદ કશી બરે અસેલ? માર્ગી શોધક નજર અશા ખાસ બાજારાચ્યા શોધાત હોતી. આણિ લુઝેર્ન લા શનિવાર રવિવાર ભરણાન્યા અશા ખાસ બાજારાત જાણ્યાચી સંધી મલા મિલાલી. તરુણ, વૃદ્ધ સાયકલી , ગાડ્યા ઘેઊન યેતાત આણિ ભરપૂર ઉત્સાહાત ફળે, ભાજ્યા, ફુલે ખરેદી કરતાત. ચીજ, પાવ , હમ, અંડી, કેક હે ત્યાંચે પ્રમુખ અન્ન. ત્યાબરોબર ખાયચે jams , કસલી કસલી માર્માલિદસ, મુબલક પ્રમાણાત વિકાયલા હોતી. સ્વચ્છ , સુંદર બાજાર. ઇથેહી ઉત્સાહાચા અભાવ નાહી પણ સગળે કાહી શિસ્તીત. કચર્યાચે નામોનિશાન નાહી. ખાણ્યા વ્યતિરિક્ત ઘરાત લાગણાન્યા નિત્યોપયોગી વસ્તુહી વિક્રીસ ઠેવલેલ્યા હોત્યા. સ્વિસ કાકા , કાકૂ અગદી ભરભરુન સગળે વિકિત ઘેત હોત્યા. લહાન મુલે ત્યાંચ્યા છોડ્યા ગાડીત બસૂન મોકળ્યા ઉન્હાત આનંદ લુટીત હોતી.ઇથે જેવણાત માસે, પોર્ક, બીફ, સોસાજેસ આણિ ચિકન હે પદાર્થ ખૂપ મોઠ્યા પ્રમાણાત ખાલ્લે જાતાત. સફરચંદ, પેર, કિવી આણિ કેઠી હિ પ્રમુખ ફળે. આણિ લાલ ભોપળા, સલાડસ હેહી જેવણાત સૂપ બરોબર ખાલ્લી જાતાત. શુક્રવાર હા કાહી જણાચા પગારાચા દિવસ. ત્યામુલે સોમવાર તે શુક્રવાર ભરપૂર કામ કરાયચે આણિ શનિવાર ,રવિવાર મસ્ત એશ આરામાત જગાયચે હા ઇથળ્યા લોકાંચા શિરસ્તા આહે.

### ◇ મહત્વાચી શહરે

રાજધાની : જેનેબ્હા  
લુસેર્ન, ઝુરિક, ઇંટરલાકેન, શાફોઝાન

### ◇ મહત્વાચી ઠિકાણે

mount તીતલીસ, હર્ફિન river fall , જુન્પ્રાવ

◇ શેતી : પ્રવાસાત મક્યાચી આણિ સૂર્યફુલાચી શેતે અગદી દોન્હી બાજૂલા ફુલલેલી દિસત હોતી.ઇથે શેતીલા ખૂપ પ્રાધાન્ય દિલે જાતે. નવીન અવજારે આણિ અધિનિક મશીન્સ વાપરુન શેતી કેલી જાતે. આધુનિક ફવાર્યાની પાણી દિલે જાતે. ઠરાવિક વેછેલા તે ફવારે ચાલૂ હોતાત આણિ બંદ હોતાત ત્યામુલે શેતાત માણસે દિસત નાહીત પણ કામ માત્ર વ્યવસ્થિત ચાલૂ અસતે. બારાહી મહિને વાહણાન્યા ભરપૂર નદ્યાંચે વરદાન લાભલે આહે ત્યામુલે માસેમારી વ્યવસાયહી ઉત્તમ ચાલતો. ઉંચ , નિમુલ્ટી કરડી કિવા હિરવી ઝાડે. મધુન મધુન બર્ફ વૃદ્ધી હોત અસલ્યામુલે પ્રાણી આણિ પક્ષીહી બર્ફ આણિ થંડી પાસૂન બચાવ કરણ્યાસાઠી બદલલેલે. ત્યાંચા રંગ ,રૂપ આણિ પિસે થંડીત ટિકૂન રાહાવે મ્હણુન ભરપૂર આણિ કરડ્યા રંગાચી.

### ◇ લોકાંચી માનસિકતા

ઇથળ્યા લોકાંમધ્યે એક વેગળા ઉત્સાહ આહે, લગન આહે. વિશેશ મ્હણજે મન લાવૂન કામ કરણ્યાચી માનસિકતા આહે. મગ તો તરુણ અસો વ વૃદ્ધ . જીવન ભરભરુન જગણ્યાચી ઉર્જા હ્યા લોકાંમધ્યે દિસૂન યેતે. "આતા કાય આમચે દિવસ સંપલે " અસે મ્હણુન કપાઠાલા આઠ્યા ઘાલૂન નવીન પિઢીલા ફક્ત નકારત્મક દૃષ્ટીને બધણ્યાચી માનસિકતા ઇથે કણભરહી આઢળત નાહી. મ્હતારપણ હે કસે સકારાત્મક દૃષ્ટીને , સહજ સુંદર પણ પેલતા આણિ ઝેલતા યેતે હે હ્યા લોકાંકડૂન શિકણ્યા સારખે આહે.

### ◇ ભાષા

સર્વત્ર જર્મન કિવા ફ્રેંચ બોલલી જાતે. ઇંગ્લિશ ચા ગંધ હિ નસલેલી માણસે સુધા વ્યવસ્થિત વ્યવહાર કરતાના આઢળતાત. પુસ્તકે, સૂચના ,ઉપહારગૃહે સર્વ વ્યવહાર હ્યાચ ભાષેત ચાલતો. સ્વિસ ડોલ્લર હે યેથલી ચલન વળન ચી ભાષા તર જર્મન/ફ્રેંચ હિ બોલી ભાષા.

### ◇ mount titlis /rhyne ધ્રબધ્વા /નિસર્ગ સૌન્દર્ય

પૃથ્વીવર જ્યા થોડ્યા દેશાંના નિસર્ગનિ મુક્ત હસ્તાને નદ્યા આણિ ડોંગર બહાલ કેલે આહેત ત્યાપૈકી એક દેશ મ્હણજે સ્વિલ્ફાર્લંડ. સુંદર નિલે હિરવી આણિ કરડી કિનાર અસલેલે દેખણે ડોંગર. અગદી સુપ્રસિદ્ધ ચિત્રકારાને કાઢલ્યા સારખે. આણિ હ્યા સગળ્યાવર કળસ મ્હણજે પાંદર્યાશુભ્ર

બર્ફને આચ્છાદ લેલે બર્ફને લગડલ્યા સારખે ચાંદીચા વર્ખ ઠીક ઠિકાણી લ્યાલેલે નજર ગુંતવૂન ઠેવણારે ડોંગર. mount તીલ્લીસ બઘતાના નિસર્ગાંચા અવિસ્મરણીય નજરા ડોલ્યાત સાઠવૂન ઠેવાવાસા વાટતો. તેથા હિ સગળી ઠિકાણે આયુષ્યાત એકદા તરી ભેટ દ્વારી અશી આહેત હે સાંગળે નલગે.

ઇંટરલાકેન, Luzern હી શહરે અગદી હ્યા બર્ફિચ્યા ડોંગરાચ્યા કુશીત વસલેલી. એકદા વાટલે હ્યા લોકાંના dibetis તર હોત નસેલ ન નુસેટે બર્ફાળ બર્ફી સારખે ડોંગર નજરેત સાઠવૂન .

અવખળ, સુંદર નદ્યાંચા ઉગમ હ્યા અદ્ભુત ડોંગરાચ્યા કુશીતૂન ઝાલેલા. નિતળ કાંતી લ્યાલેલ્યા , દુલ્ઘદુલ્ઘ મુરડત દુડક્યા ચાલીને ચાલણાર્ય હ્યા સુંદર યુવતી ( હ્યાંચી વયે નક્કી માહિત નાહીત). હ્યા નદ્યાંચા આત્માહેર કાહી વેગલે નાહી . યાંચે અંતરંગ અગદી સ્વચ્છ. . મ્હણૂનચ હ્યા ઇતક્યા આરસ્પાની સુંદર દિસત અસાચ્યાત.આપલા તળ અગદી થેટ દાખવણાન્યા હ્યા નદ્યા. શાફોઝાંચા ન્હાઈન ધ્વબધબા તર હ્યા સર્વાંચ્યા ખુબ્સુર્તીલા ચાર ચાંદ લાવણારા. ન્હાઈન નદીતૂન ઉત્સુર્તપણે આપલ્યા અચાટ સામર્થ્યને વરુન સૂર મારત હા થેટ ખાલી ભૂમીચ્યા છાતીવર કોસળતો તેથા

ધન્ય ધન્ય તો પ્રપાત

ધન્ય ધન્ય તી rhyane નદી

મ્હણાવેસે વાટતે. હ્યા પ્રપાતાચે રાંગડે સૌન્દર્ય બઘતાના અગદી ખિલૂન જાયલા હોતે. ગાવકર્યાનીહી ત્યાલા અગદી પ્રેમાને , કોડકૌતુકાને આપલ્યા ખાંદ્યાવર વાઢવલા આહે. સ્વચ્છ આણિ હિરબ્યાગાર વનરાઈને વેઢલેલ્યા હ્યા પ્રપાતાચે મર્દની દેખણે રૂપ ડોલ્યાત સાઠવત મી હ્યા જાગેલા મનોમન સલામ ઠોકલા.

શેવટ મલા એવ્હદેચ મ્હણાવેસે વાટતે કિ

પ્રવાસ મ્હણજે અનુભવ. આયુષ્ય મ્હણજે અનુભવાંચે પુસ્તક. જન્મલ્યાપાસૂન આપલા પ્રવાસ સુરુ હોતો. ત્યાલા પૂર્ણ વિરામ મિલતો તો મરણ નંતરચ.

(કાહી જણ અસેહી માનતાત કી ત્યાનંતરહી આપલા પ્રવાસ ચાલુચ અસતો. )અસો .આયુષ્યાચા પ્રત્યેક ટપ્પા મ્હણજે સ્ટેશનાવર ઘેતલેલી વિશ્રાંતિ. કાહી સ્ટેશનાવર આપણ થોડે જાસ્તચ રેંગાળતો ખરે ,અસે વાટતે હે ઠિકાણ સોડૂન કથ્થી જાઊચ નયે. પણ પુઢે સરકણારા કાળ આપલ્યાલા તસે મુલીચ કરુન દેત નાહી. મનાત અસો વા નસો પુઢીલ સ્ટેશન ગાઠાયલાચ લાગતે. વાટેવર યેણાન્યા પ્રત્યેક સ્ટેશનાચે સ્વાગત તેવ્હબ્યાચ આનંદાને આણિ ઉત્સુર્તપણે કેલે તરચ આયુષ્યાચા પ્રવાસ સુખકર હોતો.

મોહના કારખાનિસ ... 

## ◎ ૧૫ ઑગસ્ટ વ ૨૬ જાનેવારી 'નાવાચે' રાષ્ટ્રીય સણ

પ્રિય ભારતીય બહિણી વ ભાવાંનો ! અલિકડેચ ૧૫ ઑગસ્ટ ૨૦૧૩ ગેલા યા દિવશ આપણ ભારતાચા ૬૭ વા સ્વતંત્રતા દિવસ સાજરા કેલા. ભારતાલા સ્વાતંત્ર્ય મિલ્બૂન ૬૬ વર્ષે જ્ઞાલીત આપણ ૬૬ વર્ષાંપાસૂન મોઢ્યા થાટાત સ્વાતંત્ર્ય દિન સાજરા કરતો .. અવધા ભારત દેશ અગદી દેશભક્તિચ્યા ઉલ્લાસાત યા દિવશી ઊર્માત યેતો. ૧૫ ઑગસ્ટ જાતો આણ મગ દેશાચી પરિસ્થિતી વ ભારતીયાંચી દેશભક્તિ પહાવયાસ મિલતે તી 'જૈસે થે!' અશીચ દેશભક્તિ આમ્હા ભારતીયાંમધ્યે વર્ષાત પરત જાગૃત હોતે તી ૨૬ જાનેવારી રોજી આણ યાનંતરહી જર કથી તી નિર્માણ જ્ઞાલીચ તર કુણ્યા સમાજસેવકાને ક્રાંતીચી મશાલ પેટવિલ્યાસ; પણ આતા તર તે હી કમી જ્ઞાલંય .. આપણ ખરંચ રાષ્ટ્રીય સણ (સ્વાતંત્ર્ય વ પ્રજાસત્તાક દિન) સાજરે કરતો ?

રાષ્ટ્રીય સણાંચા અર્થ કાય? કશાસાઠી સાજરે કેલે જાતાત રાષ્ટ્રીય સણ? ભારતાલા સ્વાતંત્ર્ય મિલ્બૂન દેણ્યાસાઠી બલિદાન દેણાચ્યા કિતીતરી થોર-મહાપુરુષાંના સલામ, ત્યા અવિસ્મરણીય વ ક્રાંતીકારી દિવસાચી આઠવણ વ ભવિષ્યાત ભૂતકાળામધ્યે ભારતીયાંની જગલેલી પારતંત્રકાલીન પરિસ્થિતી પુન્હા નિર્માણ હોઊ નયે મહણૂન.

આજચ્યા અભ્યાસક્રમાત મૂલે, તરુણ કિતીહી શિકત અસલે ૧૫ ઑગસ્ટ વ ૨૬ જાનેવારી ચે મહન્ત્વ તરી ત્યાંના રાષ્ટ્રીય સણાંબદ્દુલ અધિક વિચારલ્યાસ બાલકાંપાસૂન તર વૃદ્ધાંપર્યત સવાંકડૂન એકચ ઉત્તર મિલેલ કી રાષ્ટ્રીય સણ મહણજે પૂર્વતયારી, રંગરંગોટી, શુભેચ્છા-સંદેશ, ઎સએમએસ, તોરણ-પતાકા લાવૂન સજસજાવટ કેલેલ્યા વાતાવરણાત કુણ્યા પાહૂણ્યાચ્યા ઉપસ્થિતીત નવિન/સ્વચ્છ ડ્રેસ પરિધાન કરુન ડૌલાત માન વ શાનેને ઉંચાવર ફડકત અસલેલ્યા ધવજાલા (તિરંગી ઝેંડા) સલામી દેણે, રોજચ્યાચ રાષ્ટ્રગીતાસહ નિવડક દેશભક્તિગીતાંમાર્ફત નિવ્વળ 'મનોરંજન' કરુન ઘેણે, મોજક્યા ઠિકાણી બદ્ધિસ વિતરણ વ મિઠાઈ વાટપાચા કેવળ એક સણ! ફક્ત ઐકણ્યાચ્યા ઉદેશાને 'ટાઇમપાસ' કરવૂન ઘેણ્યાસાઠી વ્યાસપઠાવરીલ પાહૂણે વ નિવડક વિદ્યાર્થીંચી ભાષણે (તે હી આજ કુઠે ઘેતલી/દિલી જાતાત)... આઠવડાભરાચ્યા વર્તમાનપત્રે, સાસાહિકે વ નિયતકાલીકાંમધૂન રાષ્ટ્રીય સણાંબદ્દુલચી નાનાવિધ માહિતી વ દેશભક્તિસાઠી રાષ્ટ્રીય પ્રતીકાંચા (વિશેષત: ધવજ) માન રાખ્યાસાઠી જનજાગરણપર સંદેશ વ મોહિમા ... આણ તરી લહાનગે તર લહાનગે સોડાચ પણ દેશાચ્યા મોઠ-મોઢ્યા જાણત્યા લોકાંકડૂન વ સલ્લસલ્લત્યા રક્તાચ્યા તરુણ યુવાંકડૂન દેખીલ પ્લેસ્ટીકે ધવજ રસ્ત્યાવર ફેકલે જાતાત આણ જાતાત પાયાખાલી તુડવલે દેખીલ (અર્થાત યાલા કાહી અપવાદ આહેત મહણા) !!

મહણૂન સર્વપ્રथમ રાષ્ટ્રીય સણ સાજરા કરણ્યામાગીલ મુખ્ય ઉદેશ, રાષ્ટ્રીય પ્રતીકાંચે મહન્ત્વ સાંગતાનાચ ત્યાંચા માન કસા રાખતા યેઈલ યાચેહી જ્ઞાન દેણે આવશ્યક આહે, શિવાય રાષ્ટ્રીય પ્રતીકાંચા (પરિહાર્યને દેશાચા) અવમાનચ કરતા યેઝ નયે અશી કાહી વ્યવસ્થા કરતા યેઈલચ કિ ગત ૧૫ ઑગસ્ટપુર્વી તીન દિવસાંપાસૂન મી જવલપાસ સર્વચ વૃત્તપત્રાત વાચત હોતો "પ્લેસ્ટીકે તિરંગી ધવજ વાપરણે ટાઠા." અશી વર્તમાનપત્રાત સૂચના દેણ્યાએવજી પ્લેસ્ટીકચ્યા ધવજાંવરચ બંદી આણલી તર ચાલણાર નાહી કા?

કાહી જણ મલા વેઢ્યાત કાઢીલ તર કાહી પ્લેસ્ટીકે ધવજ વિક્રેત્યાંચ્યા ઉદરનિર્વાહાચા પ્રશ્ન ઉપસ્થિત કરતીલ, અસે ધવજ વાપરણારે તર મહણતીલ કી હે રાષ્ટ્રપ્રેમ આ, પણ ધવજ વિક્રેત્યાંના ૨૬ જાનેવારી વ ૧૫ ઑગસ્ટ સોડુનહી પોટા-પાણ્યાચા પ્રશ્ન અસતોચ કિ! આણ ખરં રાષ્ટ્રપ્રેમ હે હૃદયાત અસાવં લાગતં ત્યાસાઠી પ્લેસ્ટીકે ધવજ વાપરણાચી સ્વતંત્ર ગરજચ તી કાય?? આણ જર વાપરલેચ જાતાત પ્લેસ્ટીકે ધવજ તર ત્યાંચી સન્માનપૂર્વક યોગ્ય વિલ્હેવાટ દેખીલ લાવતા યેણે ગરજેચે આહે.

આજ કાંન્હેંટપાસૂન તર કાંલેજપર્યેત દેશભક્તિચે ધડે દિલે જાતાત પણ આજપર્યેત મી સ્વતઃચ્યા ડોળ્યાંની નિરીક્ષણ કેલ્યાનંતર આપણાસ એક પ્રશ્ન વિચારુ ઈચ્છિતો કી, કિતી શિપાઈ, કર્મચારી શાલા-વિદ્યાલયાત રાષ્ટ્રગીત સુરૂ અસતાના સાવધાન સ્થિતીત ઉભે રાહતાત? વ કિતી પ્રાચાર્ય/મુખ્યાધ્યાપક ત્યાંના ૫૨ સેકંદ સાવધાન રાહ્યાચી સૂચના દેત સાવધ કરતાત? આમ્હી એકિકડે બાલ-ગોપાળાના રાષ્ટ્રભક્તિચે બાલકડૂ પાજત અસતો વ દુસરીકડે ત્યાંચાચ ડોળ્યાસમોરીલ કર્મચારીવર્ગાલા રાષ્ટ્રગીતાચ્યા વેલી સાવધાન ઉભે રાહ્યાસાઠી સાધા ૫૨ સેકંદાંચા અવધી નસતો તર કુઠુન છોટ્યા વિદ્યાર્થ્યાવર રાષ્ટ્રીય પ્રતીકાંચા માન રાખ્યાચે સંસ્કાર હોણાર આણ મગ તે તિરંગા ધવજ ચિખલાત ફેકત વા પાયાખાલી તુડવત અસતીલ તર ત્યાંચં ચુકતં તરી કુઠે !! અર્થાત યાલા આપણ મોઠેચ સર્વસ્વી જબાબદાર આહોત મગ તે સુશિક્ષિત તરુણ અસતીલ પાલક, કર્મચારી, શિક્ષક,

પ્રાચાર્ય વા આણખી કુણી! આજ ભારતીયચ તિરંગયાસ પાયદળી તુડવતાત અન્યથા ઈશ્વર/અલ્લાહ ન કરો પણ એક દિવસ અસા યેરેલ કિ કુણીહી પરકીય દેશાતૂન યેરેલ વ તિરંગા તુડવત જાઈલ મ્હણું આતાતરી સાવધગિરી બાળગણે આવશ્યક આહે યાકરિતા સર્વપ્રથમ આપણ સ્વતઃચ અંતર્મનાતૂન વેળ જાણ્યાઅગોદર બદલલે પાહિજે .

મી જાણતો આજ દેશાપુઢે બન્યાચ સમસ્યા આહેત. નક્ષલવાદ, દહશતવાદ, શેજારી દેશાંચી ઘુસખોરી, ભ્રષ્ટાચાર, યાંવરીલ અમાનવી અત્યાચાર, મહાગાઈ આણિ બરંચ, બરંચ, બરંચ કાહી.વર્ષાંચી સુરુવાતચ 'નિર્ભયા'વરીલ અમાનૂષ અત્યાચાર વ તીચ્યા નિધનાનંતર દેશભર પસરલેલ્યા દુઃખાચ્યા સાવટાને, ઝાલી આણિ આજહી સ્વિયાંવરીલ અત્યાચારાંચ્યા ઘટનેત માત્ર ઘટ ઝાલેલી નાહી. નક્ષલવાદ્યાંની સત્તાધારી પક્ષાચ્યા વરીષ વ સત્કર્મી નેત્યાંના છૃત્તીસગઢ રાજ્યાત ઠાર કેલ્યાચી ઘટના તાજીચ અસતાના ૧૩ ઓંગસ્ટલા ત્યાચ રાજ્યાત આણખી તીન જવાન નક્ષલવાદ્યાંશી લઢતા-લઢતા શહિદ ઝાલેત. ઓંગસ્ટ મહિન્યાત શેજારી રાષ્ટ્રાચ્યા સૈન્યાને ભારત-પાક સીમેવરીલ નિયંત્રણ રેષેવર (LOC) શસ્ત્રસંધીચે ઉલ્લંઘન કરુન વારંવાર ભારતાત ઘુસખોરી કરત ગોલીબાર કેલા (વ આતાહી સુરુચ આહે) જ્યાત ભારતાચે ૫ જવાન શહિદ ઝાલે.

"કા જવાનાંની મિટલે ડોળે  
સીમેવરતી લઢતાના  
શેવટી મી શ્રદ્ધાંજલી દેતો  
અમુચ્યા શહિદાના  
૫ ઓંગસ્ટલા દિલી સૈન્યાંની  
પ્રાણાચી કુર્બાની  
ઘુસખોર તે હોતે સગલે  
સગલે પાકિસ્તાની  
યા ભારત દેશામધલી  
'એલઓસી' ચી કહાણી  
ઘુસખોર તે હોતે સગલે  
સગલે પાકિસ્તાની"

દેશાત ગત ૬૬ વર્ષાંપાસૂન સંપુષ્ટાત યેઊ ન શકલેલા ભ્રષ્ટાચાર આતાહી વાઢતચ આહે. જાગતિક બાજારપેઠેઠ ડૉલરચ્યા તૂલનેત ભારતાચે ચલત 'રૂપયા' (₹) ચે દિવસુંદિવસ અવમૂલ્યન હોઊન રૂપયા ઘસરતચ આહે. પરિહાર્યાને રોજચ્યા રોજ મહાગાઈ વાઢત આહે.

રાષ્ટ્રીય સણાંબદ્ધલચ્યા લેખાત યા આણિ અશા અનેક દેશાસમોરીલ સમસ્યા વ આબ્હાનાંચા સમાવેશ હોણેહી આવશ્યકચ આહે પણ અશા સમસ્યાંવર ફક્ત સંસદેત (ગદારોળ ઘાલત) કાયદે નિર્માણ કરુન વા અશા આબ્હાનાંના સામોરે જાણ્યાસાઠી સરકાર વારંવાર કા અપયર્શી ઠરતંય યાચા જાબ વિચારણાસાઠી સત્તારૂઢ વ વિરોધી તસેચ ઇતર પક્ષા-પક્ષાંની, નેત્યા વ મંત્ર્યાંની પરસ્પરાંવર ટિકા-ટિપ્પણી વ આરોપ-પ્રત્યારોપ કરુન કાહીહી સાધ્ય હોણાર નસલ્યાચે તે ખુદેખીલ જાણતાત. દેશાસમોરીલ સંકટે/સમસ્યા કશા સંપુષ્ટાત આણતા યેતીલ યાવર સર્વ પક્ષાંની એકજૂટ હોઊન ચિંતન કરણ્યાચી ગરજ આહે.

અખેરીસ મી એક સાંગ્ર ઈચ્છિતો કિ સદર લેખ લિહિણ્યામાગે માઝા હેતુ કોણત્યાહી વૈયક્તિક વા સંઘટિત વ્યક્તી, નોકરદાર, નેતા, મંત્રી, વ્યવસાય, વા પક્ષાચ્યા ભાવના દુખાવણે વા ત્યાંચ્યાવર ટિકા-ટિપ્પણી કરણે હા મુશીચ નાહી. તરીહી કુણાચ્યા ભાવનાંના ઠેચ પોહચત અસેલ તર 'ક્ષમસ્વ!' હા આપણાપર્યત રાષ્ટ્રીય પ્રતિકાંચ (વિશેષત: પ્લેસ્ટિકચ્યા ધવજાચ) ૧૫ ઓંગસ્ટ વ ૨૬ જાનેવારી રોજી રાષ્ટ્રીય સણ 'સ્વાતંત્ર્ય દિન' વ 'પ્રજાસત્તાક દિન' સાજરા કેલ્યાનંતર પ્રત્યેકચ વર્ષી દિસણારં વાસ્તવદર્શી આણિ તિતકંચ ચિંતાજનક અપમાનાસ્પદ વાટણારં ચિત્રણ વ્યક્ત કરણ્યાસાઠી માઝા 'લહાન તૌંડી બરાચ મોઠા ઘાસ' ઘેતલ્યાપ્રમાગે હા છોટાસા લેખનપ્રપંચ. સદર લેખ વાચલ્યામૂલે એક જરી રસ્ત્યાવર વા વાટેચ્યા કડેલા ધૂલ ખાત ખિતપત પડૂન અસલેલા તિરંગા સન્માનપુર્વક ઉચલલા ગેલા તરી મી માઝા હા ઇવલાસા પ્રયત્ન સાર્થક ઝાલ્યાચે સમજેન!

જય~હિંદ..!!

રાજેશ હજારે ... 

## ◎ તૂ, મી આણિ પાઊસ

તૂ ગેલ્યાવર માઝી આણિ પાવસાચી મૈત્રી જ્ઞાલી. મી આણિ પાઊસ તુઝ્યાબદ્દલચ્યા ગપ્પા મારતો. આજવર આપણ દોઘહી ખુપ પાવસાલે એકત્ર ભિજલો. આપલ્યા "ત્યા" ક્ષણાંચા સાક્ષીદાર માઝા મિત્ર પાઊસચ. ત્યાનેચ આપલ્યાલા જવઠ આણલં, ત્યાનેચ તર પ્રેમ શિકવલં. મગ, મગ કાય? પાઊસ મ્હણજે તૂ, પાઊસ મ્હણજે પ્રેમ, પાઊસ મ્હણજે કવિતા, પાઊસ મ્હણજે હલુવાર સ્પર્શ, પાઊસ મ્હણજે મનાને સુધ્દા ચિંબ ભિજણ, પાઊસ મ્હણજે અજુન ખુપ કાહી.... ઢગ દાટુન યેતાત, પાઊસ યેણાચી વર્દી દેતો; મી ગપ્પાંચી મૈફિલ જમવાયલા સજ હોતો. પુન્હા આઠવણી જાગ્યા હોતાત. તુઝે માર્ગે સારેચ પાવસાલે માઝ્યા મનાત ભિજુન જાતાત. પાઊસ પરત ખુપ ઐકતો, પાઊસ પરત ખુપ બોલતો, આમચ્યા યા ગપ્પાંમથ્લે તુઝે થેંબ મી અલગદ ઝેલતો. આમચી મૈફિલ સજત જાતે. તુઝ્યા માઝ્યા આઠવણીંચે થેંબ પરત ત્યાલાચ માગતો મી. આપણ પાવસાચે સગળેચ્યા સગળે થેંબ ઝેલાયચો, ચિંબ ભિજાયચો. તુ, મી, કિનારા આણિ પાઊસ બસ્સ.... આપલ્યાત બાકી કોણીચ નસાયચે, શબ્દહી નસાયચે. મુક્યાનેચ આપણ ખુપ બોલાયચો. આપણ આપલે હાત અગદી ઘર્ટુ પકડાયચો, હા હાતાચા સ્પર્શહી ખુપ કાહી બોલાયચા. તુ મ્હ્લાયચીસ, પાઊસ શાંત જ્ઞાલા, ખરં તર દોન મન એકમેકાંત ભિજુન શાંત જ્ઞાલેલી અસાયચી ત્યાતપુરતી! મી કિના-યાવરુનચ દૂરસ્સ્સ્સ્સ્સ્સ નજર ટાકાયચો પાવસાચે થેંબ ક્ષિતીજાચ્યા વાટેને પાણ્યાવરુન રંગત ત્યાંચ્યા ઘરી જાયચે, પણ આપણ તસેચં બસુન રાહાયચો. પક્ષયાંચી કિલબિલાટ ઐકુન ઘરી જાણ્યાસાઠી નિધાયચો. જાતાના કોપ-યાવરચ્યા ચહાચ્યા ટપરીકડે પાવલે અપોઆપ વલાયચી. ગરમા ગરમ વાફાલલેલ્યા આલ્યાચા ચહાચા સુગંધચ તિકડે ખેચુન ન્યાયચા. ખરંતરં આપલ્યાલા ઐકમેકાંબરોબર અજુન થોડાસા વેલ ઘાલવતા યાવા મ્હણુન ચહાચં નિમિત્યં! દોન કટિંગ સાંગાયચી વેલચ નાહી યાયચી, ચહાવાલ્યાલા દેખિલ આપલી આણિ ત્યાચી હિ સવય માહિત હોતી. આલ્યાચા વાફાલલેલ્યા ચહાચે ગ્લાસ આપલ્યાસમોર પોરાને ધરલે કી માત્ર આપલ્યા હાતાંચ્યા બોટાંચા ગુંતા સુટાયચા આણિ હાતાત ચહાચે ગરમ ગ્લાસ યાયચે. ગ્લાસ ગરમ આહે; તુઝ્યા નાજુક બોટાંના ચટકા સહન હોણાર નાહી, મ્હણુન અનેકવેલા વાટાયચં કિ તુલા માઝ્યા હાતાનેચ ચહા પાજાવા આણિ મી માઝા હાતાતલા ગ્લાસ ખાલી ઠેવણાર તેવફ્યાત તુ તુઝ્યા ગ્લાસ ઓઢણીમથ્યે પકડુન ચહાચે ઘોટ ઘાયચીસ આણિ તુઝે ડોળે સાંગાયચે કિ ભિજલ્યાવર આલ્યાચા ગરમ ચહા કિતી જ્ઞાન લાગતો. આણિ માઝા ચેહરા "ભ્રમનિરાસ હોણે" યાચા વાક્યાત ઉપયોગ કેલ્યાસારખા વ્હાયચા. ચાર પાણ્યાંચી વરાત બસસ્ટાઉપકડે નિધાયચી, વાટાયચં કિ આપલ્યાલા હવી તી બસ થોડી ઉશીરા યાવી પણ નેમકી તીચ બસ પટકન યાયચી. યા બસલા ખુપ ગર્દી આહે નંતરચી બસ પકડુ, તૂ મ્હણાયચીસ, ઘરી વાટ બધત અસતીલ મગ મલા કલાયચં કિ હવં હવં અસુનહી નકો નકો મ્હણણં મ્હણજે કાય(?) મગ ત્યાચ બસમથ્યે આપણ ચઢાયચો ફાર ગર્દી નસાયચી માઝાં આપલં ઉગીચ કાહીતરી. પણ પ્રત્યેક સ્ટાંપલા થોડી ગર્દી વાઢાયચી મગ મી તુલા કોણાચા ધ્રંકા લાગુ નયે મ્હણુન તુઝ્યાભોવતી માઝાં વેટોળ્ણ કરાયચો, ખરંતરં તુલા મિઠીત ઘ્યાયચા કેવિલવાણા પ્રયત્ન અસાયચા. પણ મગ તુ માઝ્યાકડે અશીકાહી બધાયચીસ કી મી થોડાસ્સ્સ્સ્સ્સ સાચ લાંબ વ્હાયચો. આપણ ઘરી પોહચાયચો. તૂ ખોલીત જાયચીસ આણિ ખિડકી ઉઘડાયચીસ પાઊસ ધો-ધો કોસળતંચ અસાયચા તુલા પરત ભિજાયચી હુંકી યાયચી મગ તુ સરળ ગંધીત ધાવ ઘ્યાયચીસ આણિ દોનહી હાત લાંબ કરુન ચિંબ ભિજાયચીસ પાવસાચે થેંબ તુઝ્યા સર્વાંગાલા સ્પર્શ કરાયચે કેસાંના, કેસાંવરુન કાપાલાવર, કાપાલાવરુન પાપળાંવર, પાપળાંવરુન ગાલાવર, ગાલાંવરુન ઓઠાંવર, ઓઠાંવરુન ગાલ્યાવર, છાતીવર, પોટાવર બેંબીવર. અચાનક ખુદકન લાજાયચીસ આણિ ખુપ જ્ઞાલાં ભિજણ આતા, મ્હણુન આડોશ્યાલા જાયચીસ. તલહાતાવર પાવસાચે પાણી ઘ્યાયચીસ આણિ પાવસાવરચ ઉડવાયચીસ. ખોલીત યાયચીસ આણિ સરળ આરશ્યાસમોર જાઉન ઉભી રહાયચીસ. સ્વતંત્રાલા આરશ્યાત બધુન પરત ઓલીચ લાજાયચીસ. આણિ મી બધિતલં કી ખટ્ટાળ નજરેને બધાયચીસ આણિ આત જાઉન કપડે બદલુન આલીસ તરી ઓલેચં કેસ ખુપ વેલ પુસ્ત બસાયચીસ. તેચ્છા તુ તર મલા અસ્સરાંચ વાટાયચીસ. થોડ્યા વેલાને તૂ તુઝ્યા કામાત વિઝી વ્હાયચીસ આણિ મી આપલા ઉગીજચં ટિન્હીચે ચનલ્સ બદલત બસાયચો. સારખા તુઝ્યાં ચેહરા સમોર દિસાયચા. રાત્ર વ્હાયચી, સગળે એકત્ર જેવાયલા બસાયચો. તૂ કેલેલી ભાજી આણિ આમટી મલા લગેચ ઓળખુ યાયચી. ભાજીચ્યા આણિ આમટીચ્યા પ્રત્યેક ઘાસાલા તુઝ્યાકડે કટાક્ષ જાયચા. જેવણ કરુન મી આપલ્યા ખોલીત જાયચો. રાતરાણીચા મોહક સુગંધ મન અજુન ઉલ્હાસીત કરાયચા. તુ યેઉન મલા ઝુંક્યુ મ્હણાયચીસ, કશાવદદલ? તુમ્હાંલા ભાજી આણિ આમટી આવડલ્યાબદ્દલ!! મી કાહીહી ન બોલતા તુલા માઝ્યા મનાતલં સમજલં હોતં; મલા ખુપ આવડલં હોતં. નવરા-વાયકો મથ્યે ભાંડણ હોતાંચ, ભાંડત નાહીત તે નવરા વાયકો કસલે? પણ આપલ્યાત કથી ભાંડણ જ્ઞાલીચ નાહીત. ભાંડાયલા કારણ મિઠાલં નાહી કિ વેલ મિઠાલા નાહી માહિત નાહી. પણ તુ માઝ્યાવર કથીચ ચિડુ નયેસ, રૂસ નયેસ અસંચ વાટાયચં. વેલ બદલલી, કાલ બદલલા, માણસ બદલલી આણિ આપલં પ્રેમ લોણચ્યાસારખં અજુનચ મુરત ગેલં, આપલં નાતં અધિકચ દૃઢ હોત ગેલં. મી તુઝ્યાત ઇતકા ગુંતત ગેલો કિ આયુષ્યાચા પ્રત્યેક ક્ષણ તુઝ્યાબરોબર જગાવાસા વાટાયચા, પણ નિયતીચ્યા મનાત કાહી વેગલં હોતં, અસો. તુલા આઠવતયં તુ ગરોદર અસતાના માહેરી ગેલેલીસ આણિ મલા તુઝ્યા વિરહ સહન જ્ઞાલા નાહી. મી તુલા પહ્લિં પ્રેમપત્ર લિહીલં હોતં. તુ જેચ્છા તે વાચલસં તેચ્છા તુ રડાયલા લાગલીસ આણિ તાબડતોબ મલા ફોન કરુન બોલાવુન ઘેતલસં આણિ મી યેર્દ પર્યંત રડતચ હોતીસ. મી ભેટલ્યાવર માઝ્યા મિઠીત યેર્દેન અજુન રડલીસ, મી હી તુલા રડુ દિલં. શાંત જ્ઞાલ્યાવર, તુ મ્હણાલીસ, "મી તુમ્ચ્યાવર ખુપ પ્રેમ કરતે." તુઝે હે શબ્દ ઐકુન મલા પ્રચંડ, ખુપ, ભરપુર,

જાસ્ત, અતોનાત આનંદ જ્ઞાલા હોતા. આપલ્યા પ્રેમાચી નિશાણી આપલી મુલગી. પરી મ્હણતો મી તિલા. પરીચ આહે તી અગદી તુઝ્યાસારખી. પ્રેમ મ્હણજે કાય? અસા પ્રશ્ન પડલા કિંવા કોણી વિચારલાચં તર પ્રેમ મ્હણજે આદર, વિશ્વાસ, સમજુતદારપણા, સમર્પણ, ત્યાગ. "એખાદ્યા વ્યક્તિબદ્દલચી નાજુક ભાવનાંચી અતિઉચ્ચત્યેચી પાતળી મ્હણજે પ્રેમ." અસચં મી સાંગાયચો. મી તુલા સમજાયલા લાગલ્યાપાસુન મી પ્રેમ મ્હણજે ફક્ત "તૂ" અસંચ સાંગતો. કાહી ગોઢી સાંગાબ્યા લાગત નાહીત, ફક્ત સમજુન ઘેતલ્યા જાતાત. આપલ્યાત અસંચ હોતં. આયુષ્યાત અનેક બિકટ પ્રસંગ આલેત, પણ પ્રત્યેક ક્ષણી તૂ માઝ્યા માગે નાહીસ તર માઝ્યાબરોબર હોતીસ. તુંણં અશા પ્રસંગી માઝ્યાબરોબર અસણ મલા નેહમીચ સુખાવુન જાયચં. તૂ માર્ઝી પદ્ધી આહેસ આણિ તુંણં કર્તવ્ય આહે મ્હણુન તુ ખંબીરપણે માઝ્યાબરોબર આહેસ અસં મલા કથીચ વાટલં નાહી, તર એક મૈત્રીણ મ્હણુન તુ મલા સાથ દિલીસ આણિ હિ મૈત્રીણ માર્ઝી પદ્ધી આહે યાચા મલા પ્રચંડ ગર્વ આહે. પણ માર્ઝી તુઝ્યાબદ્દલચી તકાર આહે, તુઝ્યાબદ્દલ તકાર કરાયચી વેલ યેઈલ અસં કથીચ વાટલં નબહતં ગ. પણ આતા સહનચ નાહી હોત. આપણ એકમેકાંના ફક્ત યાચ જન્માત નાહી તર પુઢ્યા અનેક જન્માત એકમેકાંના અશીચ સાથ દ્યાયચી અસં ઠરલં અસતાનાહી તુ મલા સોડુન ગેલીસ. કા? તુ આધી કા ગેલીસ? તુઝ્યા મૃત્યુનંતર મલા મૃત્યુ રોજ હવાસા વાટતો પણ મી જગતોય તે ફક્ત આપલ્યા પરી સાઠી. તુંણ નસણ મલા સહનચ હોત નાહી. ગાત્ર થકલેલી આહેત, તુઝ્યાબદ્દલચી ઓછ પ્રચંડ, ખુપ, ભરપુર, જાસ્ત, અતોનાત વાઢલેલી આહે. તુઝ્યા વિરહાને માઝ્યા આયુષ્યાલા સ્વલ્પવિરામ લાગલાય, આતા મલા ફક્ત પૂર્ણવિરામ દ્યાયચા આહે. બધ ના પાવસાચી બોલણાર હોતો, પણ તુઝ્યાપાશી યેઉન થાંબલો.

રાહ્લ આરાધ્યે ... 



## ◎ “હિ”ચી ગોષ્ઠ

“આજ દુપારી સારે સિનેમાલા જાતીલ.... તુઝી આઈ, દાદા, આણિ લહાન બહિણ. માજા લહાન ભાડ આણિ બહિની. તૂ રાહશીલ ઘરી માઇયાસોબત ?? ૧૨વીત ૪-૫ વેલા નાપાસ જ્ઞાલેલા દત્તાકાકા યા ચિમુરડીલા બોલલા. હી પટકન “હો” મહણાલી. આવડાયચા હિલા ત્યાચા સ્પર્શ. હિચા ફ્રાંક કાઢુન સર્વાગાવર ફિરણારે ત્યાચે ઓઠ... કરકચૂન હિલા કુરવાળણ. હિચા અંગાવરુન ફિરણારં ત્યાચં શરીર... ત્યાચ્યા અંગાવર હિચં હુંડણં સારં સારં તિલા યા વયાતહી હુરળવુન ટાકાયચં.

આઈન કુઠલ્યા વયાત સાંગાયચં અસતં આપલ્યા છ્કુલીલા હે સારં?? લૈંગિક શિક્ષણ – લૈંગિક શિક્ષણ મહણતાત તે કથીપાસું દ્યાયચં ?? “અ” “આ” “ઈ” શિકવાયચ્યા આધીચ ?? કિ લેક ગર્ભાત અસતાંનાચ હે પાઠ દ્યાયચે અસતાત ??

ઇયત્તા પહિલી તે તિસરી અશી તીન વર્ષે હા દત્તા અસાચ ખેળત હોતા તિચ્યાશી... આણિ તિલાહી ખેલવત હોતા...

હી ચૌથીત આલી આણિ હિચા વડિલાંચી બદલી જ્ઞાલી. દુસરે ગાવ. પણ શેજારી તસેચ.... તસેચ કુંદું આણિ કુંદુંબાત બિના લગ્નાચા એક દીર..... બાદ્ય....લપંડાવ ખેલતાંના યા બાદ્યને નકો તિથે હાત લાવલા... આણિ હિ શહારલી....અન મગ સુરુ જ્ઞાલે ખેલતા ખેલતા હિચે ગાયબ હોણે ત્યાચ્યાસોબત..... મિલેલ ત્યા ખોલીત.... મિલેલ ત્યા કોપન્યાત.... ઘરી આઈ, આજી.... પણ કુણાલાહી કસલીહી ભનક નાહી. યા સર્વ પ્રકારાત પકડલે ગેલો કિંબા નાહી ગેલો તરી હિચે કાય હોઈલ ??? હિલાહી કલ્પના નાહી. આતા હિ કાહી અગદીચ લહાન રાહિલી નન્હતી. મैત્રિણિંચ્યા ગપ્પા એકૂન પ્રેમા – બિમાબદ્દલ હિલા કલૂ લાગલે હોતે. ૫-૬ વીત સર્વાનાચ કલતે તસેચ.. તરીહી તિચ્યા આણિ બાદ્યચ્યા પ્રકરણાલા પ્રેમાચે વૈગરે નાવ નાહી દ્યાવેસે વાટલે તિલા કથીચ.. પણ હે કાહીતરી “વાઈટ” આહે હિ ભાવના હલ્દ હલ્દ તિચ્યા મનાત ઘર કરુ લાગલી.... આણિ તી બાદ્યલા ટાદ્ય લાગલી... તરી તો કુઠુનસા સ્પર્શ કરાયચા આણિ હિ જોકૂન દ્યાયચી.. મધ્યે ખુટુ જ્ઞાલે કિ ભેદરાયચી.

હી સાતવીત આલી ...વડિલાંચી પુન્હા બદલી.. નવીન ગાવ... મોટું શહર..ઇથે કોણીચ કુણાલા ઓળખત નાહી. કુણીચ કુણાચ્યા અધે મધ્યે નાહી. કુણીચ કુણાલા કોપન્યાત ખિચત નાહી કિંબા પલંગાવર ઝોપવુન દારાચી કડી લાવત નાહી. હિલા હે મનોમન આવડલે..... ફાર છાન વાટલે.. ત્યા આવડણાન્યા સ્પર્શાપેશાહી છ્ઘાન.... એક મોકળા શ્વાસ ધેવું શકતોય યા સમાધાનાને તી બાગડૂ લાગલી.. ફુલુ લાગલી.. બુદ્ધીને, સાંદર્યાને, વ્યક્તિમત્વાને.

હિને આતા મનાશી એક ખુણગાઠ બાંધલી. માગચં સારં વિસરાયચં. પણ ત્યા ચિત્ર વિચિત્ર આઠવણી પિચ્છા સોડેનાત. સકાળી હિ પેપર વાચત બસલેલી... અચાનક લક્ષ એકા બાતમીવર..... કોર્ટાચા નિર્ણય... “અઠરા વર્ષાખાલીલ મુલીવર તિચ્યા ઇચ્છેને જરી શારરીક સંબંધ પ્રસ્થાપિત કેલેત તરી તો બલાત્કાર અસતો.”

બ – લા – ત્કા – ર.....નુસત્યા શબ્દાંનીચ હિ હાદરલી. ... મહણજે...મહણજે.... આજપર્યત મી જ્યા ગોષ્ઠીલા માજા ગુન્હા માનત હોતી ઇતકી વર્ષે જ્યા ઓઝ્યાખાલી જગત હોતી.... તો ગુન્હા કિંબા ફસવણૂક નન્હતીચ.... તર તો હોતા બલાત્કાર... સતત સહા વર્ષે માઇયાવર બલાત્કાર હોત હોતા... ડોકે ગરગરાયલા લાગલે.... હિને દોન હાતાત તે ગઢ્ઢ ધરલે... માન ગુઢધ્યાત ઘાતલી આણિ હિચા મનાને આક્રોશ કેલા.... અજૂન કોણ કોણ આણિ કિંતી ચિમુકલ્યા અસતીલ માઇયાસારખ્યા... જ્યાંચ્યાવર વર્ષાનુવર્ષે અસલે બલાત્કાર હોત અસતીલ... કસે થાંબવણાર આપણ હે સર્વ ??? શિક્ષણ, કાયદે, કિ સંસ્કાર ????

વિશાખા સમીર મશાનકર ... 

## ◎ સ્મરણયાત્રા

મિત્ર હો આઠવણી આપણ લક્ષ્યાત ઠેવતો, સતત મનાત અસલ્યામુલે હે ક્ષણ મનાત રેંગાળત અસતાત . અશીચ એક આઠવણ "શિક્ષક દિન ૫ સપ્ટેમ્બર ૧૯૯૫" યા દિવસાચી આહે. મી માઝયા પદ્ધતીને યા દિવશી અંશત: "ગુરુ ઋણ " ફેડૂ શકલો , હી ભાવના માઝયા મનાત કાયમ આહે. ૧૯૬૪ સાલી મી નૂતન વિદ્યામંદિર (મોઠી શાળા ) જિંતુર રોડ પરભળી , યા શાલેત ઇયત્તા નવવીચા વિદ્યાર્થી. હે એકચ વર્ષ યા શાલેત શિકલો મી , યા વર્ષી આમચ્યા શાલેચે મુખ્યાધ્યાપક કે.ગોપાળરાવ કાળે સર હોતે. નવવીચ્યા વર્ગાવર એક નવીન શિક્ષક મ.મ.શર્મા યાંની ત્યાંચ્યા શિક્ષકી જીવનાચા આરંભ કેલા ત્યાંચ્યા "પહિલ્યા તાસાચે પહિલે વિદ્યાર્થી ",હી આમચી આઠવણ શર્મા સરાંના પુઢે અગદી ૧૯૫ સાલી સુદ્ધા આમ્હી અનેક માજી વિદ્યાર્થી કરુન દેત અસુ.

સ્ટેટ બેંક આફ હૈદ્રાબાદ મધીલ નોકરીચ્યા નિમિત્તાને પરભાણીસ વાસ્તવ્ય હોતે. યા દરમ્યાન લેખક હોણયાચા યોગ માઝયા વાટ્યાલા આલા. અશા સાહિત્યિક ઉપક્રમાત શર્મા સરાંચી ભેટ હોત અસે.. માઝયા સારખ્યા વિદ્યાર્થીચી હી પ્રગતી પાહૂન, ત્યાંના ખૂપ આનંદ હોતે અસે, આમચ્યા પાઠીવર શાબાસકીચી થાપ "હે કૌતુક સાંગ્રન જાઈ.

૧૯૯૫ મધીલી ગોષ્ઠ આહે હી સાકેત પ્રકાશન આણિ જેષ લેખક શ્રી બાબા . ભાંડ સર , યાંની માઝી પહિલી "બાલકાદંબરી " ચંદર " પ્રકાશિત કેલી. આતા પહિલ્યા વહિલ્યા બાલકાદંબરીચે પ્રકાશન મોઠ્યા થાટાત કરુ યા અસે ઠરલે. ગંમત મ્હણજે ૧૯૯૫ સાલી નૂતન શાલેચે મુખ્યાધ્યાપક હોતે આમચે શર્મા સર. મી ઔંગસ્ટ મહિન્યાત ત્યાના ભેટૂન મ્હણાલો , "સર, મી તુમચા , યા શાલેચા વિદ્યાર્થી , માઝી અશી ઇચ્છા આહે કી માઝયા પહિલ્યા બાલકાદંબરીચી પ્રકાશન તુમચ્યા અધ્યક્ષ્યતે ખાલી સંપન્ત વ્હાવે તે શિક્ષક દિની ૦૫ સપ્ટેમ્બર ૧૯૯૫ રોજી." સકાળી શાલેચી પ્રાર્થના જ્ઞાલ્યા વર મોઠ્યા હાલ મધ્યે, શાલેચે સગલે શિક્ષક આણિ વિદ્યાર્થી યાંચ્યા સમોર . આણિ યા નિમિત્તાને "તુમચા સત્કાર કરણ્યાચી ઇચ્છા આહે, નવ્યા પુસ્તકાચે પહિલી પ્રત તુમ્હાલા દેઊન." ગુરુદક્ષિણા સમજા તુમચ્યા વિદ્યાર્થ્યાંચી.

શાંત સૌન્ય સ્વભાવાચ્યા શર્મા સરાંની સંકોચ કરીત નકો મ્હટલે, પણ તુમચ્યા આનંદસાઠી મી કાર્યક્રમાત સહભાગી હોઈલ " અસે મ્હણુન આશીર્વાદ દિલા. મિત્ર હો ૦૫ સપ્ટેમ્બર ૧૯૯૫ સકાળી ૦૮ વાજતા ૧૫૦૦ મુલેમુલી આણિ શિક્ષક વૃંદ , નિમંત્રિત મિત્ર સાહિત્યિક , માન્યવર , શાલેત ઉપસ્તીથ હોતે. વ્યાસપીઠાવર પ્રમુખ પાહુણે શ્રી બાબા ભાંડ સર., અધ્યક્ષ્ય મ્હણુન મ.મ.શર્મા સર, આણિ રાષ્ટ્રપત્રીંચા આદર્શ શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત જેષ લેખક ભા.દો. પાટીલ સર,

યાંચ્યા હસ્તે માઝયા પહિલ્યા બાલ કાદંબરીચે "ચંદર " ચે થાટાત પ્રકાશન જ્ઞાલે, ભા.દો પાટીલ સર.,. મ્હણાલે "ઇતક્યા પહાટે શાલેત પ્રકાશિત જ્ઞાલેલે હે એકમેવ પુસ્તક અસેલ. ખરેચ મિત્રાંનો "ચંદર" યા લેખનાને માઝી લેખન વાટ્ચાલ ખન્યા અર્થને પ્રકાશમય કેલી આહે. સુપ્રસિદ્ધ લેખક આણિ સનદીઅધિકારી વ માર્ગે સ્નેહી શ્રી . લક્ષ્મીકાંત દેશમુખ , યાંની યા

બાલ કાદંબરીચી અતિશય ઉચ્ચિત શબ્દાત પાઠરાખણ કરુન, માઝયા લેખનાચે મોલ વાઢવલે હોતે. સાકેત પ્રકાશનાને ૧૯૯૫ ચ્યા યા બાલકાદંબરીચી નવી આવૃત્તી ૨૦૦૯ મધ્યે પ્રકાશિત કેલી. આજ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૩ "ચંદર " હા ગુણી નાયક ૧૮ વર્ષાંચા જ્ઞાલા આહે. ત્યા "સુરમ્ય લેખન ક્ષણાંચી " હી સ્મરણયાત્રા .

તુમચી સોબત માઝયા વાટ્ચાલીલા પ્રેરક આહેચ.

અરુણ વિ. દેશપાંડે ... 

## ◎ માનસિક અર્થકારણ

સર્વસામાન્ય માણસાલા અર્થશાસ્ત્ર હા તસા કિચકટ વિષ્ય વાટું શકતો પણ ખરંચ અર્થશાસ્ત્રાલા સમજાં ઇતકં કઠિણ નાહી. અર્થકારણ હે કથીહી નિબ્વલ ગુંતવણુક મ્હણુનંચ પાહિલં ગેલંય યાચં કારણ અસં કી અર્થ મ્હણજે શેઅર્સ, બૉડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વિમા ઇત્યાર્દિંપુરતંચ મર્યાદિત અસતં. અગદિચ અર્થશાસ્ત્રાચા સંબંધ આલાચ યાંઆધી ફક્ત શાલેય આણિ મહાવિદ્યાલ્યીન કાલખંડાત નિબ્વલ અભ્યાસક્રમ મ્હણુન ફક્ત અભ્યાસ કરણારે આણિ ત્યા જોરાવર ભરપૂર ગુણ સંપાદન કરુન પાસ હોણારે બરેચ 'હુશાર' આહેત. અર્થશાસ્ત્રાચા ઇતિહાસ પ્રચંડ જુના આહે મ્હણજે જિથે વ્યવહાર તિથે 'અર્થ' આણિ હે અર્થ હાતાળણ્યાચે શાસ્ત્ર મ્હણજે અર્થશાસ્ત્ર. યા અર્થશાસ્ત્રામધ્યે માનસિકતેલા એક અગ્રગણ્ય સ્થાન આહે, અર્થશાસ્ત્રાચે બહૃતાંશી નિયમ હે માનસિકતેશી પ્રત્યક્ષ કિંવા અપ્રત્યક્ષરિત્યા જોડલે ગેલે આહેત મ્હણુનંચ હે અર્થશાસ્ત્ર જાણુન ઘેતાનાચ અર્થતજ્જાંની ત્યાંચે સિદ્ધાંત હે માનસિકતેશી જોડલેલે આઢળતાત. યા લેખાત સર્વચ બાબી માંડતા યેણે હે શબ્દમયર્દિમુલે શક્ય નસલ્યાકારણાને મી ફક્ત મહત્વાચ્યા બાબતીંવરચ દૃષ્ટીક્ષેપ ટાકણ્યાચા પ્રયત્ન કરણાર આહે.

ગુંતવણુક કિંવા બચતીચ્યા નિર્ણયાબદ્દલ આપણ હે માનસિક અર્થશાસ્ત્ર કાય આહે હે થોડક્યાત જાણવૂન ઘેઊ. અર્થશાસ્ત્રાચ્યા નિયમાપ્રમાણે આપલે આય મ્હણજેચ ઉત્પન્ન વાઢલે કી ગુંતવણુક વાઢતે, હાચ અર્થશાસ્ત્રાચા નિયમ માનસિકતેવર કસા નિર્ભર હોऊ શકતો હે પાછુ. મિળણારે ઉત્પન્ન હે બચત ન કરતા જર તસેવ સ્વતઃક્રે ઠેવલે ગેલે તર સહાજિકંચ ગુંતવણુક હોણાર નાહી, પણ બચત માત્ર નક્કી હોઈલ. અર્થશાસ્ત્રાચાચ એક નિયમ અસે સાંગતો કી ઉત્પન્ન વાઢલે કી આપલા ખર્ચહી તુલનાત્મકરિત્યા વાઢત જાતો. પરંતુ એખાદ્યા વ્યક્તિ હા હાતંચ રાખુન ખર્ચ કરંત અસેલ તર માત્ર ત્યાચા ખર્ચ વાઢણાર નાહી તસેવ તો માણૂસ ગુંતવણુક કરણ્યાચ્યા મનસ્થિતીત નસેલ તર ત્યાચ્યા હાતાત ઉરલેલે અધિકતમ ઉત્પન્ન તો સ્વતઃક્રે ઠેવણે પસંત કરેલ પરિણામી ગુંતવણુક આણિ બચત હી અર્થશાસ્ત્રાચ્યા દૃષ્ટીને હોણાર નાહી પરંતુ ત્યાચ્યા માનસિકતેનુસાર તો જે કરત આહે ત્યાંસ બચત મ્હણતા યેઊ શકેલ.

દુસરં ઉત્તમ આણિ આપલ્યા સાચ્યાંચ્યાચ પરિચયાંચ અસેલેં ઉદાહરણ મ્હણજે શેઅર બાજારાતીલ ગુંતવણુક ! શેઅર બાજારાત ગુંતવણુક કરતાના તુમ્હાલા ફક્ત અર્થશાસ્ત્રંચ માહિતી આસેલ મ્હણજે ઉદાહરણાર્થ, કમી દરાત શેઅર ખરેદી કરણે કિંવા જાસ્ત દરાત વિક્રી કરણે ઇત્કીચ સામાન્ય માણસાપુરતી શેઅર માર્કેટચી વ્યાખ્યા મર્યાદિત અસલી તરી મત્ર જેબ્હા શેઅર માર્કેટમધ્યે ખરે વ્યવહાર હોતાત તેબ્બા માનસિકતા કશી આડ યેઊ શકેલ યાચે ઉત્તમ ઉદાહરણ મ્હણજે સટ્ટેવાજી. અમૂક એખાદા શેઅરચે બાજાર ભાવ ઘરસણાર અસલ્યાચે સંકેત મિળાલે કી સટ્ટેવાજ આધીચ શેઅર વિક્રીસ કાઢાયલા સુરુવાત કરતાત કિંવા જર આત્તાચ્યા શેઅરચે બાજારભાવ વાઢણાર અસ્તીલ તર તે વિક્રીસ તયાર હોત નાહીત. યાચ્યાચ ઉલટ બાબ શેઅર ખરેદિચ્યા બાબતીત આહે. મ્હણજે સમજા પુછે એખાદ્યા શેઅરચ્યા કિંમતીત જર વાઢ હોણાર અસલ્યાચે સંકેત સટ્ટેવાજાંના મિળાલે તર તે આત્તાચ બાજારાતૂન તો શેઅર વિકંત ઘેતીલ તે નિબ્વલ નફા કમવળિયાસાઠી. મી તુમ્હાલા જે ઉદાહરણ દિલંય તે અતિશય લહાન આહે શેઅર બાજારાત યાદુન અધિક લપંડાવ ખેળલે જાતાત મ્હણુનંચ સામાન્ય માણુસ આપલા પૈસા વાચવા મ્હણુન યા શેઅર બાજારાપાસુન ચાર હત લાંબ રહાણે પસંત કરતો પણ હે ચિત્ર હલ્લી બદલત ચાલલે આહે. આતા યા માગચી માનસિકતા સમજૂન ઘેઊ કિંવા માનસિકતા યા છોટ્યાશા વાટણાંચા પણ મોઠી વ્યાપી અસેલ્યા અર્થકારણાવર કસા પરિણામ કરું શકતે હે સમજૂન ઘેઊ. વર મહટલ્યાપ્રમાણે સમજા ભવિષ્યાત અમૂક એખાદ્યા શેઅરચે ભાવ વાઢણાર અસે સ્પષ્ટ સંકેત મિળાલ્યાવર દેખીલ એખાદા માણૂસ આત્તા ચાલુ અસેલ્યા બાજાર ભાવાને શેઅર વિક્રી કરું શકતો યાં માગચે માનસિક કારણ મ્હણજે ત્યાલા માર્કેટબાબત અસેલી ભિત્તી અસૂ શકતે કિંબ પુર્વનુભવાનુસાર ત્યાચી માનસિકતા તશી ઘડલી અસેલ. મ્હણજે માગિલ વ્યવહારાત ત્યાલા અશા વ્યવહરાતૂન તોટા ઉદ્ઘ્વબલ્યામુલે તો ભવિષ્યાતીલ નફયાચા વ્યવહાર ટાળુન સધ્યા તોચ્યાત વ્યવહાર કરણ્યાસ ઉત્સુક અસેલ.

અર્થકારણાચા મહત્વાચા પૈલૂ મ્હણુન માનવી માનસિકતેલા અગ્રગણ્ય સ્થાન આહે. યાચીચ ઉકલ આપલ્યાલા વિવિધ આર્થિક સિદ્ધાંતામધૂન દિસતે. અર્થકારણ આણિ માનવી માનસિકતા યાચે અજૂન એક ઉદાહરણ મ્હણજે મહાગાઈ અર્થતંચ inflation. આત્તા બાજારાત સર્વાધિક મહાગ કાય અસેલ તર ત્યા દોન ગોટી આહેત એક મ્હણજે કાંદા આણિ દુસરં મ્હણજે પેટ્રોલ. સરકારને કાંદ્યાચે દર નિયંત્રણાખાલી આણણાચે પ્રયત્ન યુદ્ધપાત્રીવર અસલ્યાચે આશ્વાસન દિલેલે અસે તરીહી કાંદા ખરેદી હી મ્હણજે સામાન્યાંસાઠી સોનેખરેદી ઝાલી આહે. એખાદા ગરિબ માણૂસ જ્યાચે દૈનંદિન ઉત્પન્ન શંબર રૂપયાંદૂન જાસ્ત નાહી અશી વ્યક્તી કાંદા ખાણે સંપુર્ણપણે બંદ કરેલ અસા અંદાજ ચુકીચા સિદ્ધ હોऊ શકતો જર કાંદા ત્યા વ્યક્તિસાઠી અવિભાજ્ય ઘટક અસેલ તર, મ્હણજેચ થોડક્યાત સાંગાયંચ ઝાલં તર કાંદા હી ગરજ અસૂ શકતે કિંવા કાંદા હા પર્યાયી હોऊ શકતો. જૈન સમાજામધ્યે કાંદા હા વર્જ આહે પરંતુ ત્યાંની કાંદ્યાલા પર્યા કોબીચા ઉત્તમ વાપર કેલાય ત્યામુલે ત્યાંના યા કાંદા દરવાઢીચા ફટકા

બસલા અસેલંચ અસે નાહી, ત્યાતલ્યા ત્યાત જર ત્યાંચ્યાપૈકી કોણી ધાર્મિક પરિક્રમેબાહેર જાઉન કાંદા ખાણારા અસેલ તર ત્યાલા યા કાંદે દરવાઢીચા ફટકા બસૂ શકતો. આતા વલ્યૂ પેટ્રોલ યા ઉત્પાદનાકડે જ્યા માણસાકડે બાઈક આહે કિંવા કાર આહે અશાંનાચ કેવળ જર પેટ્રોલ દરવાઢીચા ફટકા બસતો અશી જર તુમચી માનસિકતા અસેલ તર તી સપશેલ ચુકીચી આહે, તર અપ્રત્યક્ષરિત્યા પેટ્રોલ દરવાઢીચા ફટકા ફળે, અન્ધાન્ય, ભાજ્યા આણિ દુગધવ્યવસાય યાંચ્યા બાજારપેઠેલા બસૂ શકતો. પરિણામી પેટ્રોલચે દર વાઢલે કી જનજીવનાવર ત્યાચે થેટ પડસાદ ઉમટતાત. આતા તુમ્હી મ્હણાલ યાત તૂલા કાય ડોંબલાચી માનસિકતા દિસતે? તુમં મ્હણણં કદાચિત બરોબર અસેલ પણ અલ્પસંખ્યાંક ઉત્પન્ન ગટાચા વિચાર કરતા તે યા સમસ્યેવર કસા તોડગા કાઢુ શકતાત? ભાજીચ્યા કિંવા અન્ધાન્યાચ્યા થેટ બાજારપેઠેત જાઉન ઘાઉક ખરેદી કેલ્યાસ દરવાઢીચા હોણારા ફટકા હા તુલનાત્મક રિત્યા કમી બસેલ હી ગ્રાહકાંચી માનસિકતા આહે. પણ સમજા યાચ બાજારપેઠેત જર વિક્રેત્યાંની નફા કમવિણ્યાચી માનસિકતા દાખવલી આણિ ધ્યાન્યાંચે આણિ ભાજ્યાંચે ભાવ વાઢવલે તર ગ્રાહક પેચાત પડતીલ આણિ એકંદરીતંચ કૃત્રિમ ટંચાઈંચ ભીષણ ચિત્ર આપલ્યાલા ડોલ્યાંસમોર દિસેલ.

આતાપર્યત આપણ સર્વસામાન્યજીવનાતીલ આણિ દૈનંદિન આર્થિક વ્યવહરાંમાગચી સંબંધિત માનસિકતા પહાણ્યાચા પ્રયત્ન કેલા. આપલ્યા કાહી ગરજા યા દૈનંદિન નસતાત પણ ત્યા પુર્ણ કરાવ્યા લાગતાત. સોને ખરેદી હે યા આશયાચે એક ઉત્તમ ઉદાહરણ હોઉ શકતે. અસં પહા, માણૂસ હા સંસ્કારાંચા આણિ રૂઢી પરંપરાંચા કૈવાર ઘેઊન વાવરત અસતો જ્યા રૂઢી પરંપરા તો સ્વતઃલા હવ્યા તશા કાહી ઠિકાણી બદલતોહી પણ જેબ્હા શકૂન આણી અપશકૂન યા કાલ્પનિક બાબીંચા પ્રશ્ન યેતો તેબ્બા માત્ર તો સંભ્રમાત પડતો. પિતૃપક્ષ હા આપલ્યા સાન્યાંનાચ અભિપ્રેત આહે. કાહીહી નવીન ખરેદી કરણે કિંવાસોને ખરેદી કરણે યાંસાઠી હા પિતૃ પંધરવડા અનુકુલ માનલા જાત નાહી વાસ્તવિક કોણત્યાહી શાસ્ત્રાત તસા જાહિર ઉલ્લેખ નસલા તરી આપલ્યા પિતરાંચે સ્મરણ મ્હણૂન પંધરા દિવસ સુત્ક પાછણે અશી ત્યામાગચી એક તથાકથિત ધારણા આહે. યાચ ધ્યાનધારણેમુલે યા કાળાત સોન્યાચે દર ઇતર કાલાવધીપેક્ષા સ્થીર અસતાત કારણ યા કાલાવધીત સોને ખરેદી કરણારે ખૂપ કમી અસતાત. યાંત માનસિકતા કશી પરિણામ કરુ શકતે હે સાંગતો. એખાદ્યા વ્યક્તીલા સોને ઘ્યાયચેય પણ તો પિતૃપક્ષ વગેરે કાહી માનણારા નાહી તર ત્યાચ્યાસાઠી હા વ્યવહાર ફાયદાચા હોઉ શકતો પરંતુ એખાદ્યા માણસાલા પૈશાંચી ગરજ અસતના ત્યાને ત્યાચ પંધરવડ્યાત જર સોને ગહાણ ઠેબલે તર ત્યા બિચાન્યાચ્યા હાતી યેણારી રક્મ હી ઇતર કાલાવધીતલ્યા રકમેપેક્ષા નંકીચ કમી અસેલ. પણ જર સમજા હાચ વ્યવહાર નેમકા દિવાળી કિંવા દસન્યાલા ઝાલા વરીલ ઉદાહરણાતીલ પહિલી વ્યક્તિ તોષ્યાત આણિ દુસરી વ્યક્તિ નફ્યા ચ્યા વ્યવહારાત ગણલી જાઈલ.

ઘર ખરેદી હા સર્વસામાન્ય માણસાસાઠી આર્થિક પ્રપંચ અસતો. જાગા કુઠે ઘ્યાયચી, ત્યાચે ચાર્ટિં ક્ષેત્રફળ કાય અસેલ, સોઈ સુવિધા કાય અસતીલ, આપલા પગાર કિંતુ ત્યાતીલ આપણ કિંતુ પૈસે ઘરાસાઠી દેઊ શકતો આપલ્યા ચૈનીચ્યા બાબીંવર આપલે કિતપત નિયંત્રણ આહે, આપણ આપલ્યા દૈનંદિન આયુષ્યાત લહાન ખર્ચાવર કિતપત વંધનં ઠેબુ શકતો યા સર્વ બાબી સંપુર્ણત: આપલ્યા માનસિકતેવર અવલંબલૂન અસતાત. એખાદા વ્યક્તિ અમાપ પૈસા અસૂનહી અપ્રગત વિભાગાત કમી પૈશાંત ઘર ખરેદીકરૂન ઉર્વરિત રક્મ ગુંતવૂ શકતો કિંવા સર્વ રક્મ એકાચ જવળ અસલેલ્યા પ્રોપર્ટીમધ્યે ગુંતવૂ શકતો.

અર્થવ્યવસ્થેતીલ માનવી માનસિકતા કાહી બાબતીત ઉદાસીન અસૂ શકતે, પરિણામી હી વૃત્તી ત્યા વ્યક્તીચ્યા વૈયક્તિક અર્થકારણાવર વિપર્િત કિંવા અવિપરિત પરિણામ કરુ શકેલ, યાલાચ અર્થશાત્રાચ્યા ભાષેત micro economy મ્હણતાત પણ અશી સમવિચારાંચી માણસે જર પ્રત્યેક ઠિકાણી (મ્હણજે ગાવ, દેશ, પ્રાંત યા ઠિકાણી) યાચ સ્વભાવાને વાગુ લાગલી આણિ ત્યાંચા અર્થકારણાવર વિપરિત કિંવા અવિપરિત પરિણામ ઝાલા તર માત્ર હે અર્થકારણ સંપુર્ણ પરિક્રમેલા છેદ દેऊ શકતે. યાલાચ અર્થશાસ્ત્રાત macro economy અસે મ્હણતાત.

હા લેખ વાચુન મલા નંકી કાય સાંગાયચે આહે હે બન્યાચ જણાંચ્યા લક્ષ્યાત યેણાર નાહી. પરંતુ આર્થિક માનસિકતા કિંવા માનસિક અર્થકારણ હે સંપુર્ણપણે નાહી તરીહી કાહી અંશી નિશ્ચિતંચ આપલી માનસિકતા આણિ અર્થવ્યવસ્થા યાચા એકમેકાંશી સંબંધ આહે. જ્યાઅર્થી આપણ આપલ્યા હાતાતીલ પૈશાચા યોગ્ય નિચરા કિંવા કચરા કરણે જાણતો કિંવા કોણત્યા વસ્તુસાઠી કિંતુ પૈસા ખર્ચ કરાવા યાચે વેલ, કાળ આણિ ઉપલબ્ધ સાધને યાંચ્યા આધારે સમિકરણે બાંધત બસતો ત્યાઅર્થી અર્થ આણિ ત્યામાગચી માનસિકતા યાંચા એકમેકાંશી દૃઢ સંબંધ આહે હે નિશ્ચિત હોતે. શબ્દમર્યાદિ અભાવી યા લેખાચી વ્યાસી આણિ યા લેખાતીલ માહિતી તિતકીશી પૂરક નસલી તરી યા લેખાંદ્વારે માંડલેલ્યા ઉદાહરણપર દાખલ્યાંતૂન આપલ્યાપર્યત માઝે મ્હણણે નંકીચ પોહોચેલ યાચી મી ખાત્રી બાળગતો.

પ્રથમેશ સુરેશ શિરસાટ ...

## ◎ અવિસ્મરણીય ચાર ધામ પ્રવાસ

અવિસ્મરણીય ચાર ધામ પ્રવાસ સુરુ જાલા. કુણાશીચ ઓળખ નસલ્યાને સગળં અગદી રટાલ વાટત હોતે. કાહી મજા નબહ્તી. હરિદ્વાર પોહોચણ્યાસાઠિચ દોન દિવસ લાગતાત. ત્યા દોન દિવસાત તર આમચ્યા કડે એકમેકાંચે તોંડ બઘણ્યાશિવાય ખરચ કાહી કામ નબહ્તે. રેલ્વેટલી દુસરી રાત્ર ભરતપૂર (રાજસ્થાન) મધ્યે. અચાનક ચક્કીવાદળ સુરુ જાલે. ઇતકે મોઠે કિ રેલ્વે સુદ્ધા જવલજવલ અર્ધા તાસ થાંબુન હોતી. પાઊસ હો સુરુ જાલા. પાઊસ રાત્રી કથી થાંબલા ઠાઊક નાહી થેટ સકાળી ચ મલા જાગ આલી. તિસન્યા દિવશી દુપા પારચ્યા સુમારાસ આમચે હરિદ્વાર મધ્યે આગમન જાલે. મુંબઈ સારખંચ તિથેહી ગરમ હોત હોતે. સંધ્યાકાળી ગંગા આરતી પહાવયાસ ગેલો મી તી ગર્દી એકદા ટીન્હી વર પહીલી હોતી તેબ્બા વિચાર કેલા હોતા હિ લોકં કા મહણૂન એવદ્યા ગર્દિત જાતાત; કાય મિલત હે કરુન પણ જેબ્બા પ્રત્યેકાત મી ગંગા આરતી પહીલી તેબ્બા ત્યાચે ઉત્તર મિલાલે જે સમાધાન મિલતે તે શબ્દાત નાહી સાંગતા યેત અપ્રતિમ !

હરિદ્વાર મધ્યે રાત્રીચા મુંકામ કરુન સકાળી બડકોટસાઠી નિઘાલો. માદ્યા આયુષ્યાતીલ પહિલ્યા adventure લા સુરવાત જ્ઞાલી હોતી. ખરંચ, તોપ્રવાસ પૂર્ણપણે પહાડી પ્રવાસ એક બાજૂલા ડોંગર જ્યાંચી દગ દગડ કથી પડતીલ તે હિ સાંગતા નાહી યેણાર આણ દુસન્યા બાજૂલા મોઠ મોઢ્યા દન્યા સમોર ફક્ત એક વાહન મુશ્કીલીને જાઈલ ઇતકા છોટા વલણા વલણાચા રસ્તા. પૂર્ણ દિવસ બસ પ્રવાસાત ગેલ્યા નંતર બડકોટલા રાત્રીચા મુંકામ કેલા. ૨૪ મે લા યમુનોત્રી દર્શના સાઠી નિઘાલો (યમુના નરીચે ઉગમસ્થાન) યમુનોત્રી ચી ઉંચી ૧૦,૮૦૦ ફુટ આહે. ૫ કિ.મી. ચઢણ ચઢૂન યમુના માતેચે દર્શન ઘેતલે. પણ ખરંચ યમુના નરીચ્યા શિતલપ્રવાહાચે ખલ્ખલ વાહને બઘૂન ૫ કિ.મી ચાલલ્યાચા થકવા અગદી નાહીસા હોઊન જાતો. પુન્હા ૫ કિ.મી. ખાલી ઉત્તરુન બડકોટ મધ્યે મુંકામ કેલા. અજૂન તરી કુણાશી ઓળખ જ્ઞાલી નબહ્તી ત્યામુલે ખૂપચ કંટાલા યેત હોતા. ઘરાચી આઠવણ યેત હોતી. ૨૫ મે લા બડકોટ મધ્યે અસણાન્યાકાહી નામવંત મંદિરાંચે દર્શન ઘેતલે શર્કી મંદિર, શિવ મંદિર ઇત્યાદી. ચાર ધામચ્યા યા પ્રવાસાત પ્રત્યેક પર્વત, નરી, નાલે યાંચા સંબંધ કોણ એક ઋષીદેવતાંશી જોડલા ગે ગેલા આહે આણ ત્યાંચે મહાત્મ્ય વિવિધ અંગાંની નિર્દર્શનાસ યેતે.

૨૬ મે લા ગંગોત્રી દર્શનાસાઠી નિઘાલો. ગંગેચે ઉગમસ્થાન ગંગોત્રી મંદિરા પાસુન ૧૮ કિ. મી. દૂર અસૂન ગોમુખ મહણૂન વિખ્યાત આહે, પ્રચંડ થંડી .....પણ આશ્ર્ય કરણ્યાસારખી ગોષ્ઠ હોતી તે, કુંડાતીલ ગરમ પાણી તે હિ એવદ્યા થંડીત . જિથે બાદલીતીલ ગરમ પાણી હિ ૫ મિનિટાંત ગાર હોત હોતે. ગંગોત્રી દર્શન કરુન ઉત્તરકાશી મધ્યે રાત્રીચા મુંકામ કેલા. ૨૮ મે કેદારનાથ દર્શનાસાઠી નિઘાલો સર્વાત ખડતર ધામ પંધરા તાસાંચા પ્રવાસ. જાતાના વાટે ટિહેરી dam લાગતે. આશિયા ખંડાતીલ સર્વાત મોઠે dam . જ્યાચ્યા પ્રવાહામુલે આણ વિશાલ ખોલી મુલે બત્તીસ ગાવં પાણ્યાત વિલીન જ્ઞાલી . તે પાહૂન ખરંચ નિયતીચ્યા તાકદીચી જાણીવ હોતે .

સંધ્યાકાળી સીતાપુર મધ્યે મુંકામ કરુન દુસન્યા દિવશી ગૌરીકુંડ કડે નિઘાલો. જિથે સ્ત્રાન કેલ્યાને સારે પાપ નષ્ટ હોતે અસે મ્હટલે જાતે. તિથૂન પુઢે કેદાર નગરી ૧૪ કિ.મી. વર આહે. જાણ્યાસાઠી ડોલી, કુંડી, ઘોડા કિંચા પાયી અસે પર્યાય આહેત. આમ્હી ઘોડ્યાને ગેલો. ૧૧૭૮૫ ફુટાવર વસલેલી કેદારનગરી હે પાંડવાંણી બનવલેલે સ્થાપત્ય હોતે. હે એક પ્રાચીન મંદિર અસૂન બારા જ્યોતિર્લિંગાં પૈકી એક આહે. જિથે જાતાના જસે વર જાઊ તસે વિલોભનીય દૃશ્ય બધાવયાસ મિલતાત. અતિશય સુંદર આણ ઉત્સાહદાયી. દુપારચ્યા સુમારાસ કેદારનગરીત આમ્હી પોહોચલો. ડોળે દિપતીલ અસે સુંદર દૃશ્ય શબ્દાત માંડતા ન યાવે ઇતકે સુંદર પણ ખાલી પાહિલ્યાવર જિવંત રાહૂ કિ નાહી

અસા વિચાર સુદ્ધા મનાત ડોકાવતો. કેદારનાથ ચે દર્શન ઘેઊન રાત્રીચા મુંકામ હિ તિથેચ હોતા. ભયંકર થંડી ચારહી બાજૂને બર્ફને માખલેલે ડોંગર. પાણ્યાત હાત વિચાર કરુન ઘાલાયચો. કુડકુડત તી રાત્ર કાઢુન દુસન્યા દિવશી પાયથ્યાશી જાણ્યાસાઠી નિઘાલો. ખાલી જાતાના આમ્હી મ્હી સાવકાશ ગેલો નિસર્ગાચા આસ્વાદ ઘેત. રાત્રી ગુસ્કાશી યેથે મુંકામ કેલા. તિથે માત્ર સોસેલ ઇતકી થંડી હોતી. આમચ્યા રૂમ સમોરચા નજરા તર અજૂનહી ડોળ્યાંસમોર ઉભા રાહતો. ખૂપચ સુંદર.

દુસન્યા દિવશી બદ્રીનાથ દર્શનાસાઠી નિઘાલો ટો હિ પૂર્ણ દિવસ બસ મધ્યે. સભોવતાલચા નજારા ઇતકા રમ્ય હોતા કિ હાતાતલા કેંમેરા ખાલી ઠેવાવા અસંવાટત્ત નબહ્તં. અગદી નિસર્ગાચ્યા સાનિધ્યાત ગેલ્યાચાચ જણ ભાસ હોતો. તેબ્બા માત્ર ઘરી પરતણ્યાચા વિચાર અજિબાત મનાત યેત નાહી. ફક્ત નિસર્ગ આણ તુમ્હી ...

અલકનંદા આણ મંદાકિની નરીચા સંગમ તર દોન નદ્યા સવંગડી (ઉનાડ) સૈરાવૈરા પછતાહેત. બદ્રીનાથ પુરી લા પોહોચલ્યાવર સંધ્યાકાળી આમચે અગદી વ્યવસ્થિત દર્શન જાલે. ત્યા મંદિરાત બદ્રીનાથાચે શામલ, વિલોભનીય અશ્યા સ્વરૂપાત વિશાલ

બહુમુલ્ય અશ્યા વન્નાલંકારાની મંડિત અશી મૂર્તી શોભાયમાન દિસત હોતી . બદ્રીનાથ પુરીતચ મુક્કામ કરુન માના ગાવાત ગેલો . ભારતાતીલ (આશિયા ખંડાતીલ ) સર્વાત શેવટચે ગાવ જ્યાંચા પુઢે ૨૦ કિ. મી . ચીન બોર્ડર સુરુ હોતે .માના ગાવ નાવ પ્રમાણેચ દ્વોટ આહे . તિથલી રાહણીમાન ઘર સગળંચ વેગળં. એક ગંમત સ્હણજે તિથે એકા ચહાંચા ટપરીચં નાવ “ India's last tea stall” અસ હોતાં .માના ગાવાચી સૈર કરુન આમચ્યા પરતીચા પ્રવાસ સુરુ ઝાલા હરિદ્વાર કડે . યેતાના ઋષિકેશ કડે લક્ષ્મણઝૂલા ,રામઝૂલા , તપોવન સ્વર્ગાશ્રમ આદિ પહાવયાસ મિળાલે.

એવળ્યા દિવસાંચ્યા પ્રવાસા મધ્યે આમચા સંબંધ હોતા તો ફર્ત નદી , નાલે , ડૉંગર , ઝરા ઇ .મી નવ્યાંચે ખૂપ ફોટો કાઢલે પણ તેબ્બા માઝ્યા ઇયા એક ગોષ્ઠલક્ષ્યાત આલી , સ્વદ્ધ શિતલ નદીકડે સગળ્યાંચાચ લક્ષ આકર્ષિત હોતાં પણ ગઢૂલ પાણ્યાચે નદીચે કોણી photo સુદ્ધા કાઢત નબ્હતાં તં . ત્યાતૂન એક ગોષ્ઠ શિકાયલા મિળાલી આપણાંહી આપલે મન સ્વદ્ધ આણિ માથા થંડ ઠેવલા તર જગાવે , ઇતરાંચે પ્રિય હોઊ નન્કીચ .

ચાર ધામ ચ્યા યા પ્રવાસાત છાન માણસં ભેટલી ,ચાર ચાંગલ્યા ઓળખી ઝાલ્યા . રોજ ધ્રાર્મિક પરમાર્થ વિષયી ચાંગલે શબ્દ એકાયલા મિળાયચે.

ખરંચ ! આયુષ્ય પણ કસં અસતાં ના ; અશી ચાંગલી માણસં ભેટલ્યાવર તે એક ન એક દિવસ સોડૂન જાણાર યાચી જેબ્બા જાણીવ હોતે ના . તેબ્બા કુઠે તરી મનાત વાટટાં .અશી માણસં આયુષ્યાત યેતાત તરી કશાલા જર ત્યાંચ્યા વિયોગાને દુઃખ હોણાર અસેલ . બરોબર ના !

તરીહી આઠવણી સાઠવૂન ઠેવાયલા માણસાંચ્યા સ્મરણશક્તી એવઢે પ્રભાવી દુસરં સાધન નાહી . કેંમેરા ક્ષણાર્થીત દૃશ્ય પકડતો ,પણ ત્યાતૂન તો ક્ષણ નિસટલા કિ કાયમચા નિસટતો ,માત્ર અસે ક્ષણ ડોક્યાત પંક્તે બસતાત .અગદી કાયમચે

સ્વામિની લોખંડે - કોળેકર ... 

# પદ્ધ વિભાગ

◎ આઈ

તુઝ્યા ગભર્તિલા  
મી અંકુર  
વીજ રૂજેલ ...।  
તુઝ્યા અંગા ખાંદ્યાવર  
ખેળેલ માઝી વેલં

ગભર્ત તુઝ્યા મી  
ધડે મમતેચે ગિરવિલ ....  
અલગદ તુઝ્યા સ્પર્શના  
મી કુશીત માઝ્યા કુરવળેલ

તુઝ્યા રાક્તામાસાચા  
મી એક જીવ .....।  
તુઝ્યા સોબત  
છપારાત રાહીન  
પાવસાત ભિજણ  
ઉન્હાત તાપલ્યા  
વાટેને ચાલન ...

તેબ્બા આઈ  
કાળજાતીલ મમતા તુઝી ....  
અશ્રુતહી વાહુ લાગેલ  
હૃદયાતીલ પ્રેમ તુઝે  
માઝ્યા ઓંજલીત સાચેલં

જિથં પેટલં માઝી જ્યોત  
કાળોખ દૂર હોઈલ તિથં  
વંશાલા દિવા ભેટેલ  
જેબ્બા માઝી જ્યોત પેટેલં

સ્વાતી ઠુબે - ખોડદે ...

◎ દીપોત્સવ

દિપોસ્તવાચા હા સોહળા  
પરસ્પરાંચા સ્નેહ જિબ્હાલા  
પણતીચ્યા મંદ પ્રકાશાત  
ગવાધાંચા સાજ આગળા

આકાશ દિવ્યાચ્યા રંગાંચ્યા  
માલા ગગની ભરારલ્યા  
સડા નભાંગણાત શિંપુન  
દશદિશા ઉજાલવિલ્યા

પર્ણકુટી સહ મહાલા દારી  
મંગલ તોરણ ઝુલા ઘેર્દ  
અંગણીચ્યા તુલશી વૃદ્ધાવની  
અલ્પનાહી રેખાંકિત હોર્દ

આકાશી ઝેપલેલ્યા ચંદ્ર જ્યોતી  
અવની ભેટીસ હોતી અધીર  
રંગતુષારાંચ્યા વર્ષાવાત ઉજલે  
સણ હા દિવાળીચા શુભંકર

મિલિંદ કલ્યાણકર ...

### ◎ મैત्रीचे ધારો

ઘડ્યાળાચે કાટે અડવૂન ધરલે

તરી વેળ અડૂન રહાત નાહી

તે ક્ષણ રડવણારે આઠવૂન

આજ હસ્ય આવારત નાહી

કા, કોણ જાણે ત્યા

ક્ષણાંચી આઠવણ સરત નાહી

કથ્થી સુટણાર ત્યા જંજાળાતૂન

મ્હણણાંન્યા મનાલા આજ રડૂ આવારત નાહી

માઝી મસ્કરી ઉડવૂન

માઝા રાગ કોણ સહન કરણાર

માઝે પકાવ jokes એકૂણ ગપ ગં

મ્હણત મલા કોણ બોલણાર

exam period મધ્યે કિતી

અભ્યાસ જાલા હે messege

કરુન કોણ વિચારણાર

lunch break તર બરેચ યેતીલ

પણ હેવ ડબે પુન્હા કોણ કથ્થી ઉઘડણાર

વિનાકારણ બડબડ આતા કરુ કોણાશી

વિનાકારણ ભાંડણ આતા કરુ કોણાશી

કોણ માઝ્યા problems વર solution દેણાર

હરભર્યાંચ્યા જ્ઞાડાવર ચઢૂન ધપકન ખાલી કોણ પાડણાર

MacD આણિ Dominoz મધ્યે

જાણ આતા સૂનં સૂનં વાટેલ

તુમ્હી તિથે નાહીત હિ ઉણીવ અસેલ ...

### ◎ એક કિનારા ગાઠત આહे ...

એક કિનારા ગાઠત આહे ...

સમુદ્ર ઉસકૂન નિઘતો  
લાટાંચે સંકટહી દેતો  
ભયાનેચ મન કલ્લોળ હોતો .

પાણ્યાત શ્વાસ કોંડતો આહे .  
કાહીતરી 'આપલં' મિળવણ્યાસાઠી ,  
એક કિનારા ગાઠત આહे .....

જગાયચી આવડ અસતે .

મરણ અજૂન દૂર આહે .

પ્રયત્ન આપલાચ અસતો  
કિનારા અજૂન દુર આહે

તરી મન સાંગત અસતે  
કિ એક કિનારા ગાઠત આહે ....

પ્રત્યેક ક્ષણ જગત આહે  
જગણ્યાચી ધુંદ ચઢલી આહે  
મરણાચી વાત મંદાવલી આહે

આપલં ગાવ દિસણ્યાસાઠી  
એક કિનારા ગાઠત આહે ..

### ◎ એકટા મી

એકટા મી એકટા મી  
નાહી કુણાચા સાંગતી મી  
જરી પાખરાંચ્યા થવ્યાત મી ,  
સ્વઃતાલા પાહતો એકટા મી ,

ઉજડે સૂર્ય અંધારાત હી  
તરી અંધારાચા શાપ હી,  
મીચ માઇયા કાંતીલા  
રોજ પાહતો આજ મી

માગતો રોજ ક્ષમા  
ગેલેલ્યા દિવસાંચી મી  
શોધતો રોજ ત્યાંના  
યેણાંચ્યા દિવસાત મી

જોડલી સારી નાતી  
કુણી ના રાહિલે ઇથે  
સુખાંચ્યા ઘરાભોવતી  
દુઃખાચે ગાવ મી પહિલે

પ્રેમભાષા વેગણી  
ન્યાહાલુની પહિલી  
વંધનાંચ્યા ઘોળક્યાત  
સ્વતઃસ એકટે પાહિલે

મિલિંદ કદમ ...

### ◎ એક ક્ષણ જગાયચા આહે

પરત એક ક્ષણ જગાયચા આહે  
માઇયાસાઠી રડણાંચ્યા ચ્યા અશ્રૂમધ્યે માઝં સ્થાન અનુભવાયચં આહે ,  
આણિ ત્યાસાઠી પરત એક ક્ષણ જગાયચા આહે .

આયુષ્યભર લિહિલેલ્યા જીવનાંચ્યા નિબંધાંચ્યા ચુકા સુધારુન  
દહા પૈકી દહા ગુણ મિળવાયચે આહેત ,  
આણિ ત્યાસાઠી પરત એક ક્ષણ જગાયચા આહે .

નકળત દુખાવલેલ્યા મનાંના વિદુષક બનવૂન હ્રસવાયચં આહે  
ત્યા હાસ્યાતલે હિરે નજરકૈદ કરુન ઠેવાયચે આહેત ,  
આણિ ત્યાસાઠી પરત એક ક્ષણ જગાયચા આહે .

સેહલ તાંબે...

## ◎ રાત્ર હોતી...!!

અશ્યા કિતી રાત્રી જાગલી  
પણ આજચી ખાસ હોતી...!!  
અર્ધી કહાણી પૂર્ણ કરણાર મી  
કારણ તશી તી બાત હોતી...!!

આણિક કિટ્યેક રાત્રી યેતીલ  
પણ આજચી યાદગાર હોતી...!!  
હોત્યા વાદળી વિજા આણ પાऊસ  
કારણ તુલા વિલગણ્યાચી આસ હોતી...!!

શબ્દ મુકે દોન્હીકડે  
પણ બોલકી તી અદા હોતી...!!  
ડોળયાંચે અન હજાર નખરે  
કારણ ત્યાંના તેવઢી મુધા હોતી...!!

પૌર્ણિમેચા ચંદ્ર ઝાકાછલેલા નભી  
પણ શુક્રાચી લખ્ખ ચાંદણી હોતી...!!  
રાત્ર કાજાલી તરી પ્રસન્ન હ્રી  
કારણ જવળ તુંબી સાજણી હોતી...!!

તૂ યેણાર હે કધીચ ઠરલેલે  
પણ તરી હી ઓઢ પ્રચંડ હોતી...!!  
ગર્દ હિરવા શાલૂ આણ હા સાજ  
કારણ પહિલીચ હી નજરભેટ હોતી...!!

યુગાયુગાચ્યા વિરહા નંતર આજ  
શેવટી હી મિલન રાત્ર હોતી...!!

## ◎ હી રાધા પણતી ઝાલી...

સૌભાગ્યાચા શાપ અસલેલી  
એક મુર્તી ઝાલી...  
તુઝ્યા આઠવણીત  
મી આજ રાધા ઝાલી...

સંપલ સર્વ વાટ્ત અસતાના  
એક આશા દિલી...  
તુઝ્યા આઠવણીત  
મી આજ રાધા ઝાલી...

પ્રતિક્ષેચા કલ્સ ગાઠતાના  
વેડી ફાર ઝાલી...  
તુઝ્યા આઠવણીત  
મી આજ રાધા ઝાલી...

દિવાળીચી હી સાંજ  
સ્વપ્નાચી રેષા ઝાલી...  
તુઝ્યા આઠવણીત  
મી આજ રાધા ઝાલી...

એક દિવા માઝ્યાહી  
અંગણાત લાવ સખ્યા...  
તુઝ્યા આઠવણીત  
હી રાધા પણતી ઝાલી...

વૈષણવી સરોદે ...

## ◎ ઈંડિયા ટુડે

આજકાલ Happy Independence Day wish કરણ  
વાટતે ફક્ત એક formality  
કારણ આજ યા so called, independent દેશાત  
આઢલતાત અનેક તુટી  
કરોડોચી population આહે યા દેશાચી  
ઇથે વિવિધતા આહે અનેક ભાષેચી  
ઇથે રાહતાત દોન પ્રકારચી માણસ  
એક, તુમચ્યા આમચ્યા સારખા ભારતીય માળૂસ  
આપણ દુસરા ભષ્ટ નેતા  
જ્યાલા લાગલી આહે ફક્ત પૈશ્યાચી ફૂસ  
૧૫ august ૧૯૪૭ આધી, આપણ જગાયચો britisha ન ખાલી  
આતા british એવજી, આલી આહે ભ્રષ્ટાચારાચી સાવલી  
આજ એકાવસ નાહી વાટત,  
૧૫ ઑગસ્ટચ લાલ કિલ્લ્યાવરચ ભાષણ  
કારણ, આજ સાધા ભ્રષ્ટાચાર વિરોધી કાયદા  
આણાયલા કરાવ લાગત ...ઉપોષણ  
આજ ભષ્ટ ઝાલે આહેત ઇથલે નેતે  
bomb blast હોતાત જેથે તેથે  
આજ બાહેર પડાયલા વાટતે ભીતી  
અશી ઝાલી આહે આપલ્યા ભારતાચી સ્થિતી  
મનાપાસૂન વાટતે એક ખંત,  
ઇથલ્યા નિરપરાધ લોકાંના મારુન પણ  
અજૂન કસા કાય હોતા કસાબ જિવંત ?  
મહણુનચ આજ મિઠ્ઠન આપણ ભારતીય સગળેજણ  
કરુયાત એક પણ,  
કરા આતંકવાદ આणિ ભ્રષ્ટાચાર ગારદ  
આणિ મગચ મ્હણ્યા જય હિંદ જય ભારત  
લવકરચ સ્વપ્રાતલા ભારત અવતરેલ  
હીચ આહે ઇચ્છા

સાગર મેહતા ...

## ◎ આતા

મી ગીત નાહી ગાત આતા  
આહે કુઠે તી સાથ આતા  
વિસરુની ગેલો ઓળી ત્યા  
નકો નવી સુરવાત આતા  
  
સુખાચ્યા વાટે જાઊ કશાલા  
રહાયચે જેવ્હા દુખખાત આતા  
  
સ્વપ્રાતચ યેણે નાહી મગ  
ડોલા લાગેલ તરી કસા  
જોપેવિનાચ નિઘૂન જાતે  
દરરોજચી રાત આતા  
  
એકદા ચુકૂન મ્હટલે તયાંના  
આઠવા જરા ત્યા આઠવણી  
જુને અસતે સારે વિસરાયચે  
પડલા મ્હણે પ્રધાત આતા  
  
હે મૃત્યો ઘે તાવ્યાત મજલા  
ઉભા અસા કા દારાત આતા  
  
સંજય સિંગલવાર ...

### ◎ કાય જ્ઞાલ ? મી તુઝા જ્ઞાલો નાહી તર...

કાય જ્ઞાલ ? મી તુઝા જ્ઞાલો નાહી તર. .

તુઝી સ્પંદન તર માઝી જ્ઞાલીચ ના

તુઝ મન તર મી જિંકલચ ના

કાય જ્ઞાલ ? મી તુઝ્યા પ્રેમાત નલ જ્ઞાલો નાહી તર. .

તુઝ્યા પ્રેમાત મજનૂ જ્ઞાલોચ ના

તુઝ્યા પ્રેમાત દેવદાસ બનલોચ ના

કાય જ્ઞાલ ? મી તુઝા પતી જ્ઞાલો નાહી તર. .

ત્યાચ્યા ચેહ્ણાત મી સદૈવ દિસેનચ ના

ત્યાચ્યા બાહુપાશાત માઝી ઊં જાણવેલચ ના

કાય જ્ઞાલ ? મી તુઝ્યા ગળ્યાતલ મંગલસૂત્ર જ્ઞાલો નાહી તર. .

ત્યા મંગલસૂત્રાચા ધાગા જ્ઞાલોચ ના

સોનેરી નસલા તરી કાળા મણી બનલોચ ના

કાય જ્ઞાલ ? મી જીવનાત યશસ્વી જ્ઞાલો નાહી તર. .

તૂ તુઝ્યા સંસારાત છ્ઘાન રમલીસ ના

એક પરિપૂર્ણ ગૃહિણી બનલીસચ ના

કાય જ્ઞાલ ? મી પ્રેમ વ્યક્ત કરુ શકલો નાહી તર. .

તુઝ્યા મનાની માઝ મન જાણલચ ના

તુઝ્યા નયનાંની માઝ્યા ભાવના ઓળખલ્યાચ ના

હે કાય જ્ઞાલ ?

યાચા અંદાજ બાંધણે આતા કઠીણ આહે.

પણ હે કા જ્ઞાલ ?

હ્યા વિચારાતચ સંપૂર્ણ જીવન આતા સમર્પિત આહે. .

સિદ્ધેશ ભરત શિરવાડકર ... ✎

### ◎ લાજ

વાદલ શાંત હોતાના, મી છ્યપ્પર ન્યાહાળત હોતો

બિલગૂન લાજ અંગાશી, ગુંલે શ્વાસ સોડવત હોતો

વાન્યાશી ઝુંજતાના એકટા, મી રક્ત પેટવત હોતો

શોધાત ક્ષણભર સુખાચ્યા, મી ઘામાત ભિજલો હોતો

સખે શહારલી તુઝી તી કાયા, એવઢેચ ઓરડત હોતી

મોહાત દાટલ્યા ધુક્યાચ્યા, ડોળે મિટૂન હરવલી હોતી

પ્રત્યેક જુના તો ઉસાસા, નવ્યાને પરત વરસતો

જખમા જ્ઞાલ્યા તરી પરંતુ, જિવ તુજવિણ તરસતો

લઢતા વેગવાન લાટાંશી, ભારી દાતાંચેવ પારડે

ગિલ્લુન સર્વ પ્યાયલો તરી, ઓંઠ જન્માતરીચે કોરડે

સર્વ શાંત જ્ઞાલ્યાવર, પાઠ માઝી કા કુરવાળલીસ ?

જણૂ સમાધાનાચ્યા બોટાને, રાંગોળી પ્રાતઃકાળી રચલીસ

વણવા શાંત જ્ઞાલ્યાવર, તૂ સ્મિતહાસ્યાત નિજલેલી

શરમેચી ધગ પાંઘરૂન, લાજ કાપરાપરી જળલેલી .

ઓંકાર મોહન ઘાડગे ... ✎

## ◎ દર્શનાલા દેવા તુઝ્યા

દર્શનાલા દેવા તુઝ્યા  
આજ સારેજણ એકત્ર યેતીલ  
તુઝ્યા વિસર્જનાનંતર  
પુન્હા આપાપલ્યા માર્ગી લાગતીલ

દર્શનાલા દેવા તુઝ્યા  
ભક્તાંચી રાંગ લાગેલ  
પાસ નાહી મિઠાલા તર  
મુખદર્શન લાંબૂન હોઈલ

દર્શનાલા દેવા તુઝ્યા  
અનેક નૈવેદ્ય યેતીલ  
તૂ કાહી ઘેત નહીસ  
તુઝ્યા પ્રસાદાચા લિલાવ હોઈલ

દર્શનાલા દેવા તુઝ્યા  
અખેરચ્યા દિવશી તોબા ગર્ડી હોઈલ  
ઢોલ તાશાંચ્યા તાલાવર  
ડીજેચી સાથ પદ્ધી હોઈલ

દર્શનાલા દેવા તુઝ્યા  
પુન્હા ભક્ત વાટ પાહિલ  
તુ અસતાના દેન્હાર્યાત  
તુઝ્યાચ પરતીચી વાટ પાહિલ

## ◎ બાબા

ઝોપ તિલા લાગાવી  
મહણુન રાત્રભર જાગતો  
તી ઉઠણ્યાાધીચ માત્ર  
ઝ્યુટીવર જાયલા નિઘતો

તિલાહી પ્રશ્રંચ પડતો  
બાબા કાળોખાતંચ કા યેતો ?  
અન્ જાગ આલ્યાવર  
ઉજેડાત દિસેનાસા કા હોતો ?

તિચ્યા પ્રશ્રાંના ઊત્તરં  
માઝી બાયકોચ દેતે  
માઝી વેલ માત્ર  
overtime મધ્યેચ નિઘૂન જાતે

પુન્હા મી ઘરી યેતો  
તેન્હા તી નિજલેલી અસતે  
મી માત્ર એકટાચ ઉરતો  
રાત્ર માઝી એકદ્યાચીચ અસતે

પ્રથમેશ સુરેશ શિરસાટ ... 

## ● વાત્રટિકા

ફુ બાઈ ફુ ફુગડી ફુ

દમલાસ કાય માઇયા ગોવિંદા તૂ

બાયકો મ્હણે મંબ્રાલા, તુમ્હી લય બાઈ છોટે

ઘોટાક્યાત પેપરલા નાવ નસતે કોઠે (૧)

ફુ બાઈ ફુ, ફુગડી ફુ

દમલાસ કાય માઇયા ગોવિંદા તૂ

બંઢા મ્હણે બાપા, લોક કરતી આમ્હા જાચ

કિતી દિસ લાંબ રાહણાર, ઘ્યાહો આતા લાચ (૨)

ફુ બાઈ ફુ, ફુગડી ફુ

દમલાસ કાય માઇયા ગોવિંદા તૂ

કન્યા હટુ પિત્યાસી, લગ્ન દણક્યાત કરા

ગાવ જેવણાસાઠી, સ્પોન્સર શોધા જરા (૩)

ફુ બાઈ ફુ, ફુગડી ફુ

દમલાસ કાય માઇયા ગોવિંદા તૂ

શ્રેષ્ઠી મ્હણે મંબ્રાસી, ફંડ ઠેવા બાપૂ

ફંડ નાય દિલા, તર તિકીટ મ્હોર કાપૂ (૪)

ફુ બાઈ ફુ, ફુગડી ફુ

દમલાસ કાય માઇયા ગોવિંદા તૂ

વિરોધી મ્હણે મંબ્રાસી, કામે આમચી ૪ કરા

લુટુ સારે તિજોરી, પણ ભ્રષ્ટાચાર કરા (૫)

ફુ બાઈ ફુ, ફુગડી ફુ

બદલલાસ કાય માઇયા મંબ્રા રે તૂ

મંત્રી મ્હણે સર્વાસી, હોઈન મી બોકા

પૈસા કુઠ ખાણ્યાચા સોડણાર નાય મી મોકા (૬)

એકે દિવશી કાય જ્ઞાલે

ગન્યા મ્હણાલા સાસરયાલા

હુંડા દ્યાયચી તયારી કિતી,

સાંગા સાસરે બુવા આકડા !

સાસરા મ્હણાલા ગણ્યાલા

કન્યા સુંદર, નોકરીવાલી માઝી,

હુંડા તૂચ દે માકડા !

### મરાઠીચ્યા ગપ્પા

બોબડે બોલ બોલતાના

ભારી મારતો ગપ્પા !

બોલ બેટા બોલ  
આવડેલ મલા પપ્પા !

લાડે લાડે શિકવિતાના  
પડતો આમ્હી કમી !

આઈ જરા વાટતે ગ્રામીણ  
બોલ તૂ મમી

### રોજ મરે

તિચે ઉશિરા યેણે

આતા સવયીચેચ જ્ઞાલે !

તિચ્યાસોબત યેણે જાણે

ખરેચ જીવઘેણે જ્ઞાલે !

રોજ મરે ત્યાલા કોણ રડે,

મ્હણ આજ મલા પટલી !

મધ્ય રેલ્વેચી ઓબ્હરહેડ વાયર હો,

પહા, આજ પણ તુટલી !

### વયોમર્યાદા

૫૮ અસો કિંવા ૬૦ વય

ઠરલેલી અસતે નોકરી નિવૃત્તી

૬૦ કાય અન ૮૦ચ કાય

ખુચ્ચી સોડાયચીચ નસતે વૃત્તી

વાગ્ણુક મિલાવી સ્પેશલ

મ્હણુન આગ્રહ અસતો મોઠા

ગેલેલ્યાંની 'વર' કેલીય માગણી

દ્યાવા VIP KOTA કોટા

ફુ બાઈ ફુ, ફુગડી ફુ

બદલલાસ કાય માઇયા મંબ્રા રે તૂ

મંત્રી મ્હણે સર્વાસી, હોઈન મી બોકા

પૈસા કુઠ ખાણ્યાચા સોડણાર નાય મી મોકા (૬)

ગજાભાऊ લોખંડે...

### ◎ માધાર

પેટલેલ્યા વા-યાત પાચોળા ઉડે  
તહાનલેલ્યા ઉરાત, આરપાર તડે  
  
વહિવાટ જુનીચ ચાલાયલા નકો  
તોંડાવર બોલાયલા, જીવ ફડફડે  
  
મનાચ્યા નભાત, સ્વચ્છદી ઝરે  
પાપળીચ્યા આડ, સ્મૃતિચે કડે  
  
સાંજવેળી આર્ત તગમગ કિતી  
કાઠજાચ્યા ગાભારી, ઈતિહાસ રડે  
  
ઠેચ લાગતા પાયી ઉંબ-યાત અડે  
માયેચ્યા પાન્દ્યાત, સત્ય કુડકુડે  
  
કલ્પી જોશી ... 

### ◎ સંસ્કાર

પદવ્યાંચા વાહત આહે ભાર હલ્લી;  
મી આહે શિક્ષિત, પણ બેકાર હલ્લી.  
  
જાગોજાગી સંસર્ગસિમ પસરલા;  
પैસે ખાણ્યાચા હા આજાર હલ્લી.  
  
શત્રૂંપેક્ષાહી વરચઢ મિત્ર ઝાલે;  
ઘાતીતચ કરતાત સરળ વાર હલ્લી.  
  
એકાંતાચ્યા તિમિરામધ્યે ઉભા મી;  
ઘાયેચાહી ના મજ આધાર હલ્લી.  
  
'પૈસા આહે કલ્પતરુ' યા યુગાને;  
અમુચ્યાવર કેલા હા સંસ્કાર હલ્લી...!

મિલિંડ હિવરાળે ... 

### ◎ એક વિચાર

પ્રેરણેમાગે ઘામાચં સિંચન નસેલ તર તી થોડ્યા દિવસાત રેતાડ બને...!  
જ્યાસ પ્રકાશમાન બ્હાયચે, ચમકાયચંય ત્યાસ પ્રતિકૂલ પરિસ્થીતીસ લાજ વાટત નસે...!  
જય અસો કિંવા પરાજય ત્યાસ તો પ્રચંડ પ્રાણ પણાસ લાવત અસે...!  
ઇતિહાસાચ્યા પાનાંવર જ્યાંચં નાવ નોંદવલંય અસા મહાપુરુષાચ્યા માર્ગાવર ગુલાબ પુષ્પ ગાલિચા અંથરલે અસં કોણી મ્હણુ શકેલ...?  
રૂપેશ પેવેકર ... 

### ◎ ગઝાત

એવદ્યા લાંબૂનહી ઇતકે સુચાવે કા તરીહી વાટતે તૂ જવળ યાવે ?..  
મી તુઝ્યાવર માંડલેલે ઠોકતાળે શક્યતો આત્તાચ પડતાળૂન ઘ્યાવે !..  
રોજ ડોઢ્યાંની મલા ઓવાઠતે તી કાઠજાવર કાજઠાચે વઠ ઉઠાવે !..  
મી તસેહી ટાઠતો નાજુક ફુલાંના શેવટી અપધાતહી મજબૂત બ્હાવે !..  
ફાર તપશીલાત જાણે ટાઠતો મી કા તિચે સાંગુ તુમ્હાંલા બારકાવે ?..  
મી કિતીદા તોલતો કાઠીજ માઝે પણ તુઝ્યા વજનાત હે કેબ્હાં ભરાવે ?..  
મગ ભલે ઝાલો તરી ચાલેલ દિલદલ ફક્ત એકા મૃગજાને "હો" મ્હણાવે !..

સુધીર મુલીક ... 

# પાકકૃત્યા

## • ક્રિસમસ કેક

હા ઘરી બનવણે અગદી સોએ આહે, હ્યાલા રમ કેક સુદ્ધા મ્હણતાત , આપલ્યાતીલ બરેચ જન રમ ઘેત નાહીત પર્યાય મ્હણું રમ વગળૂન હિ ખાસ પાક-કૃતી

### કેક સાઠી સાહિત્ય :



મૈદા	૧૧૫ ગ્રામ
માર્જેરીન / બટર	૮૫ ગ્રામ
અંડી	૨ નગ
પિઠી સાખર	૧૧૫ ગ્રામ
બેકિંગ પાવડર	૧/૨ ટી સ્પૂન
વેનિલા ઇસેન્સ	૨-૩ થેંબ
કેરેમલ	૧ ટી સ્પૂન
કન્ડીડ પીલ	૪૦ ગ્રામ
ચેરી	૪૦ ગ્રામ
કાજૂ	૨૦ ગ્રામ
લેમન ઇસેન્સ	૨-૩ થેંબ
લિંબૂ	અર્ધા

### કૃતી

- ૧) કન્ડીડ પીલ , ચેરી , કાજૂ હ્યાંચે છોટે તુકડે કરુન, ત્યાત લેમન ઇસેન્સ આણિ અર્ધા લિંબૂ પિલાવા , હે ૨-૩ દિવસ મુરણા સાઠી ફ્રીજ મધ્યે ઠેવુન દ્યાવે, વાપરણા પૂર્વી થોડાવેલ બાહેર કાઢુન ઠેવાવે, સાધ્યા તાપમાનાવર આલે કિ મગ વાપરાવે .
  - ૨) એકા લાકડી પણીને પિઠી સાખર આણિ માર્જેરીન / બટર વર્તુલાકાર દિશેને ફિરવત એક ભાંડ્યાત નીટ એકજીવ કરાવે , માર્જેરીન ચા રંગ અધિક પાંદરા જ્ઞાલા કિ ફેટણે થાંબવાવે.
  - ૩) મુરવલેલા સારણ અર્ધા મૈદા મધ્યે વ્યવસ્થિત ઘોલવૂન ઘ્યાવે .
  - ૪) અંડી આણિ વેનિલા ઇસેન્સ એકત્ર ફેસૂન ઘ્યાવે. હ્યાત થોડા મૈદા ફેટલેલી અંડી આણિ કેરેમલ ઘાલૂન હલ્લુ હલ્લુ મિક્સ કરાવે.
  - ૫) વરીલ મિશ્રણાત મૈદા ઘોલવલેલા સારણાણિ ઉરલેલા મૈદા ટાકૂન હલક્યા હાતાને એકજીવ કરાવે .
  - ૬) એકા કેક ટીન લા બટર લાવાવે, ત્યાવર બટર પેપર લાવણે , આણિ હલક્યા હાતાને તયાર કેક ચે મિશ્રણ ઓતાવે .
  - ૭) કેક ટીન મધીલ મિશ્રણાવર પાણ્યાચા હાત અલગદપણે ફિરવાવા, બકિંગ સાઠી ગરમ કેલેલ્યા ઓવન મધ્યે ૧ તે દીડ તાસ ૧૫૦ અંશાંવર બેક કરાવા .
- કેક ૧ તાસાચ્યા વર ઓવેન મધ્યે ઠેવાયચા અસલ્યામુલે પાણ્યાચા હાત ફિરવલ્યાસ તો કોરડા પડત નાહી મંજ રાહતો .
- \*યા મધ્યે હવે અસલ્યાસ ખજૂર , સુંકે પ્લાસ્ટ , મનુકા હે સુદ્ધા મુરત અસતાના ટાકૂ શકતો,

સંકેત ભંડારી... ☑

## • चॉकलेट गनाश केक

गनाश केक बहुतांशी ठिकाणी आपण खातो आणि खूप प्रसिद्ध असा हा केक आहे,

केक साठी साहित्य :



मैदा	१०० ग्राम
कोको पावडर	१५ ग्राम
मार्जीरीन / बटर	७५ ग्राम
अंडी	२ नग
साखर	११५ ग्राम
बेकिंग पावडर	१/४ टी स्पून
वेनिला इसेन्स	२-३ थेंब

कृती :

- १) मार्जीरीन किंवा बटर वितळवून , थंड होऊ घ्या.
- २) मैदा ,कोको पावडर , बेकिंग पावडर एकत्र चाळून घ्या.
- ३) एका खोलगट भांड्यात अंडी फोडून त्यात साखर घ्या आणि हे भांडे गरम पाणी असलेल्या भांड्याच्या वर ठेवा. गरम पाणी वर ठेवलेल्या भांड्याला अजिबात स्पर्श करणार नाही ह्याची काळजी घ्यावी.
- ४)एग -बिटर च्या मदतीने साखर आणि अंडे फेसून घेणे, वरील मिश्रण चमच्याने ओतल्यास रिबीन तयार होई परंत फेसत राहणे.
- ५) इसेन्स आणि चाळलेल्या मैद्यातील अर्धा भाग , वरील मिश्रणात हलक्या हातांनी "स्पचुला" च्या मदतीने हळू हळू घडी करावा
- ६)आत्ता उरलेला मैदा आणि वितळवून , गार केलेलं मार्जीरीन / बटर अधून आळी-पाळीने वरील मिश्रणात काळजी पूर्वक मिक्स करावे.
- ७)पसरट केक टीन ला बटर लावून , त्यावर बटर पेपर चे आच्छादन करावे , त्यात हे तयार मिश्रण ओतावे .
- ८) ओवन मध्ये १८० अंश तापमानावर ३० मिनीटान साठी बेक करून घेने.
- ९) १५ मिनिटांनी केकचे भांडे उलटे करून, भांड्यातून केक हलक्या हातांनी काढून घ्यावा, अलगदपणे केक वरील बटर पेपर काढून टाकावे, व ह्याच स्थितीत केक वर आयसींग लावावे .

महत्वाच्या टिप्स: बटर पेपर न लावल्यास अखंड केक काढणे शक्य होणार नाही त्यामुळे, मिश्रण बनवायला घेण्या पूर्वी भांड्याला बटर आणि बटर पेपर लावून घ्या.

चॉकलेट फज आयसींग :

आयसींग शुगर	१५० ग्राम
कोकोपावडर	३० ग्राम
मार्जीरीन	७५ ग्राम
दुध	६० ml अंदाजे



કૃતી :

- ૧) માર્જેરીન વિતળવૂન , આચેવરુન કાઢુન ઘ્યા, ત્યાત એકત્ર ચાઠલેલી આયસિંગ શુગર આણ કોકો પાવડર ફેટૂન ઘ્યા.
- ૨) દુધ ઘાલુન હે મિશ્રણ ૫ મિનિટે મંદ આચેવર શિજવા, મિશ્રણ ગુઠ-ગુઠીત જાલે કિ, કેક વર વ્યવસ્થિત પસરવૂન ઘ્યા, સગળ્યા બાજૂને ફજ આયસિંગ ફિરવૂન કેક ગુઠ-ગુઠીત કરા, તુમ્હાલા હવે તસે સજવૂન , ફ્રીજ મધ્યે કેક સેટ હોણ્યાસાઠી કમીત કમી અર્ધા તાસ ઠેવા . તુમચા ચોકલેટ ગનાશ કેક તયાર આહે.

સંકેત ભંડારી...✍

## ૧. નિનાવે

સાહિત્ય: નારળાચે દુધ ૪ વાટી, ચણા ડાલીચે પીઠ ૨ વાટી, કળિક ૧ ટે. સ્પુન, ગુલ ૨ વાટી, સાજુક તુપ ૧ ટી. સ્પુન, જાયફલ વ વેલચી પાવડર, ચ્વીપુરતે મીઠ.

કૃતી: નારળાચ્યા દુધાત ગુલ વિરઘલવણે. નંતર થોડે મીઠ ઘાલૂન ચણા પીઠ વ કળિક ઘાલણે. પીઠાચી ગુઠલી હોઊ ન દેણે. મગ જાયફલ વ વેલચી પાવડર ઘાલણે. ૧ ટી. સ્પુન સાજુક તુપ ઘાલણે. મગ ગ૱સવર ઠેવૂન ઘાટણે. ગાઠી ન હોઊ દેતા પિઠલ્યાયેવઢે ઘટૃ ઝાલે કી કેકચ્યા ભાંડ્યાલા તુપ લાવુન મિશ્રણ ટાકૂન ૧૯૦ ડિગ્રી સે. વર ઠેવૂન અર્ધા તાસ બેક કરણે.

ટીપ: અર્ધા કિલો ચણાડાળ વ અર્ધા વાટી ગહ્ય ખમંગ ભાજુન દલ્દન આણણે. હે પીઠ વાપરલ્યાસ નિનાવે ખમંગ હોતે.

સીમા ગિરીશ બેન્ડ્રે ... 

## ૨. નારળી ભાત

સાહિત્ય: ૨ ૧/૨ વાટી જિરેસાલ કોલમ (બારિક તાંદુલ), ૩ વાટી કિસલેલા ગુલ, ૩ ટિ. સ્પૂન તુપ, ૨ હિરવ્યા વેલચ્યા, ૨ લવંગા, ૫ વાટી નારળાચે દૂધ, ૧/૩ ટિ. સ્પુન મીઠ, ૧/૨ ટિ. સ્પુન જાયફલ પાવડર, ૧/૪ ટિ. સ્પુન વેલચી પાવડર, બેદાળે, કાજૂ, બદામ.

કૃતી: પ્રથમ તાંદુલ ધૂવૂન સાધારણ અર્ધા તાસ ઠેવણે. નંતર જાડ બુડાચ્યા પાતેલ્યાત તુપ ઘાલૂન ત્યાત વેલચી વ લવંગા ઘાલણે. ત્યાવર ધૂતલેલે તાંદુલ ઘાલૂન પરતણે વ ત્યાત મીઠ ઘાલૂન પરતણે. ત્યાવર નારળાચે દૂધ ઘાલણે. તાટલીવર પાણી ઘાલૂન ભાત શિજવૂન ધેણે. ભાત ઝાલ્યાવર તો પરાતીત મોકળા કરુન તો થંડ કરણે. નંતર જાડ બુડાચ્યા પાતેલ્યાત ગુલ ઘાલૂન ત્યાત ૧ વાટી પાણી ઘાલણે વ સર્વ સુકા મેવા, વેલચી વ જાયફલ પાવડર ઘાલણે. ગ૱સવર ઠેવૂન એકતારી પાક કરુન ધેણે. ત્યાત પરાતીતીલ ભાત ઘાલૂન ૩-૪ મિનીટે પરતણે વ ગ૱સવરુન ખાલી ઉત્તરવણે. થોડા પાતળ અસલા તરી ચાલેલ ભાત ત્યાત મુરતો. નંતર ૧/૨ તાસાને વાઢણે.

સીમા ગિરીશ બેન્ડ્રે ... 

## ૩. મટણ / ચિકન બિર્યાણી



### મટણ / ચિકન

સાહિત્ય: ૧ કિલો મટણ / ચિકન, (૨ મોઠે કાંદે ઉભે ચિરુન થોડ્યા તેલાત બદામી રંગાવર પરતણે, ૨ હિરવ્યા મિરચ્યા ૧ ઇંચ આલે, ૧ લસૂન કાંદા, મુઠભર કોથીંબર, થોડાસા પુદિના) એકત્ર વાટણે\*. ૨ ચમચે લાલ તિખટ, ૧/૨ ચમચા હલ્દ, ૧ ૧/૨ ચમચા ગરમ મસાલા, અર્ધા વાટી દહી, ૧ ચમચા ભરુન મીઠ, ૧/૨ વાટી તેલ, ૨ તમાલ પત્ર.

**કૃતી:** મટણ / ચિકન ચે મોઠે તુકડે કરુન તે ધૂવૂન ઘેણે. ત્યાલા હલ્દ વ મીઠ લાવણે. મટણ અસલ્યાસ ત્યાલા દહી પણ લાવણે. કુકર મધ્યે તેલ ટાકુન ત્યાવર ૨ તમાલ પત્ર ટાકુન ત્યાવર વાટણ\* ટાકણે. તેલ સુટેસ્ટોવર પરતણે મગ ત્યાત હલ્દ, તિખટ વ ગરમ મસાલા ઘાલૂન પરતણે. ત્યાવર મટણ / ચિકન ટાકણે, ચાંગલે પરતૂન ઘેણે. ત્યાત કોમટ પાણી ટાકણે. પાણ્યાલા ઉકળી આલ્યાવર કુકરચે જ્ઞાકણ લાવણે. ૧ શિટ્ટી જ્ઞાલ્યાવર ગેંસ બરિક કરુન ૨૦ મિનિટાંની ગેંસ ઘાલવણે. (ચિકન અસેલતર ૧ શિટ્ટી જ્ઞાલ્યાવર ગેંસ ઘાલવણે).

## ભાત

**સાહિત્ય:** ૪ પેલે બાસમતી તાંડૂલ, ૧ ચમચા મીઠ, પાણી.

**કૃતી:** એકા જાડબુડાચ્યા પાતેલ્યાત ભરપૂર પાણી ઉકળાવયાસ ઠેવણે. પાણી ઉકળલ્યાવર ત્યાત તાંડૂલ ધૂવૂન ટાકણે વ મીઠ ટાકણે. બરોબર ૧૦ વ્યા મિનિટાલા ગેંસ બંદ કરુન ભાત ચાલણીત ઉપસણે વ લગેચ્ચ તાટાત પસરુન ગાર કરાવયાસ ઠેવણે. ત્યામુલે ભાત સુદ્ધા વ સલસલીત હોતો.

## વિયાણીચી તયારી

૬ કાંડે પાતલ ઉભે ચિરુન બ્રાઊન કલરવર ભરપૂર તેલાત ડીપ ફ્રાય (deep fry) કરણે વ લગેચ્ચ હવા બંદ ડબ્યાત ઠેવણે (કુરકુરીત જ્ઞાલા પાહિજે). ૮ બટાટે સાલ કાઢુન ઉભ્યા પાતલ ફોડી કરુન તેલાત તલ્લુન ચિપ્સ કરણે. ૨૦૦ ગ્રેમ કાજૂ તુકડે બદામી રંગાવર તલ્લુન ઘેણે. ૯ અંડી ઉકડૂન ત્યાચ્યા ગોલ સ્લાઇસ કરણે. બટાટે, કાજૂ, અંડી વ ભાત સર્વાના મીઠ વ લવંગા વ દાલચિનીચી પાવડર ચોળણે. એકા લિંબાચા રસ કાઢુન ત્યાત કેશર ભિજવણે. ૧/૨ વાટી તૂપ વિતલવણે.



**કૃતી:** જાડ બુડાચ્યા ભાંડ્યાલા તૂપ લાવૂન ઘેણે. પ્રથમ ભાતાચા થર લાવણે. ત્યાવર મટણાચી ગ્રેવી ટાકણે. નંતર મટણાચે પિસેસ ટાકણે. પરત ભાતાચા થર લાવણે. ત્યાવર પરત મટણાચી ગ્રેવી ટાકુન વર મટણાચે પિસેસ ટાકણે. ત્યાવર બટાટાચા થર લાવણે મગ ઉકડલેલ્યા અંડ્યાચા થર લાવૂન વર કાજૂ પસરણે. સર્વ થર લાવલ્યાવર મધે-મધે ખડુ કરુન ત્યાત કેશરમિશ્રિત લિંબૂરસ વ તૂપ ચમચા ચમચા ઘાલણે. ભાંડ્યાવર જ્ઞાકણ ઠેવુન ભિજવલેલ્યા કણકેને તે ભાંડે વ જ્ઞાકણ ચિકટવૂન બંદ કરણે. ખાલી તવા ઠેવુન ગેંસવર ૧૦ મિનિટે ગરમ કરણે.

વાઢતાના જ્ઞારા ઉભાચ ઘાલૂન વાઢણે વરુન તઢલેલા કાંદા પસરવૂન દેણે. વિયાણી બરોબર કાંદા ઉભા ચિરુન તેવઢેચ ઓલે ખોબરે ખવૂન ત્યાત મીઠ, સાખર વ દહી કાલવૂન વાઢણે.

**સીમા ગિરીશ બેન્ડે ...** 

## છાયાચિત્ર.

# ચિત્રં આણિ ઇતર કલાકારી



૪૭ ચિત્ર સાભાર : [ચેરિલ ડિસોજા](#)




© Copyright 2013: Amit Shinde (amzee4udear@gmail.com)



© Copyright 2013: Amit Shinde (amzee4udear@gmail.com)



© Copyright 2013: Amit Shinde (amzee4udear@gmail.com)



© Copyright 2013: Amit Shinde (amzee4udear@gmail.com)




© Copyright 2013: Amit Shinde (amzee4udear@gmail.com)






© Copyright 2013: Amit Shinde (amzee4udear@gmail.com)

૪૭ છાયાચિત્ર સાભાર : અમિત શિંડે ૪૮



જી છાયાચિત્ર સાભાર : [વિશાલ મસૂરકર](#) જી



૯૦ ચિત્ર સાભાર : શુભાંગી તેલંગ ૯૧



Darshan Vasudev Kamat Photography



Darshan Vasudev Kamat Photography




Darshan Vasudev Kamat Photography



Darshan Vasudev Kamat Photography



Darshan Vasudev Kamat Photography



ગાયનાચાસ્કર  
ચુલાસુ  
કુંગા રી  
લેસુ હેતો  
ઓજનાચાચુલા  
કુંજકસ્કર!

કુંગવા  
સાપડતનાઈ  
મુણુનુગાચંચ  
કુંગવા  
કુરન્યો!  
સંસ્કૃતાંગ

સાડાવરચ્ચ  
અશુલ્ય રોં  
ઝાજ એચ્ચ બછુમોલ  
અસેલ...  
પણ તુદ્યા  
કુચરાપેટીલ  
જમાકુલાલે  
લેચ રોં માત  
કુવડીમોલ કુદેલ!

હૃદ્યચ  
ચઢ્ઠ કી  
આપણ  
પાયરોકહુ  
યેતો!  
સંસ્કૃતાંગ

કુવેળ  
દ્રેવદૃષ્ટિન નકો  
પણ  
દ્રેવપૃષ્ઠિન  
શીંબવા!

